



# સક્રાંતિ માનવદી મહામાનવદી



પ. પુ. ગણાધિપતિ આ.  
શ્રીવિજયજ્યાઘસૂરીશ્વરજી મ.સા.

## સર્વ : માનવથી મહામાનવની

\* લેખક \*

પ.પૂ. પુવામાનસમર્મણ સકલસંઘાતિતચિંતક આચાર્યદેવ  
શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પદ્ધાલંકાર  
ગીતાર્થ શિરોમણિ સુવિશાલ ગાઢાધિપતિ આચાર્યદેવેશ  
શ્રીમદ્વિજય જ્યધોષસૂરીશ્વરજી મ.સા.

◆ સંપાદક ◆

પ.પૂ. મુનિવરશ્રી સત્યકાંતવિજયજી મ.સા.

\* પ્રકાશક \*

શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ  
૩૮, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા,  
ધોળકા - ૩૮૭૮૧૦

વિ.સं. ૨૦૫૭

વી.સं. ૨૫૨૭

મૂલ્ય : રૂ. ૩૦.૦૦

### મહયો અમને લાભ

સ્વ. શ્રીમતી નીશા નરેશભાઈ જવેરી  
સેલમ (તામિલનાડુ)



પ્રાપ્તિ સ્થાન :

દિવ્યદર્શન ટ્રસ્ટ

૩૮, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા,  
ધોળકા - ૩૮૭ ૮૧૦

\* \* \*

લાલભાઈ ત્રિકમલાલ

૪૫૬/અ, શાંતિનાથની પોળ, હાજી પટેલની પોળમાં,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૧.

\* \* \*

અરવિંદભાઈ જે. શાહ

૮૮, શેખ મેમણા સ્ટ્રીટ, બીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૨.

મુદ્રક : રાજુલ આર્ટ્સ, ઘાટકોપર, મુંબઈ.

ફોન : ૫૧૪ ૮૮૬૩, ૫૧૧ ૦૦૫૬

શ્રી શંખેશ્વર પાદ્યનાથાય નમઃ

શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયધોષસૂરિ-સૂર્યકાંતવિજયગુરુલ્બ્યો નમઃ

## થોભો....વાંચ્યો...

હુનિયાના કોઈ પણ ધર્મ માનવ બનવું, મનુષ્ય થવું તેને અતિ મહત્વની બાબત ગણી છે. ધર્મા પુરુષ કે બહુ ભાગ્યની નિશાની બતાવી છે.

**'મળુઆ ! તુમસેવ સચ્ચં'**

માનવ ! તું જ સત્ય છે, સાચો છે. બાકીનું બધું ભ્રામક - વિપરીત છે.

કારણા આ ભવ એક જંકશાન-સ્ટેશન છે. અહીંથી બધે જદ્ય શકાય છે, પહોંચાય છે. જોકે ક્યાં જવું તે પોતાની ઉપર છે. ઇચ્છિત સ્થળે પહોંચવું કે જ્યાં ત્યાં અટવાયા કરવું તે સ્વની છચ્છા અને પ્રવૃત્તિને અવલંબિત છે. ક્યાંની મુસાફરી આદરવી તે જાતે નક્કી કરવાનું હોય છે.

વ્યવહારમાં એમ દેખાય છે કે સફરમાં નીકળેલ વ્યક્તિ પોતાના ગંતવ્ય સ્થાને કેમ જલ્દી પહોંચાય તેવી તમના રાખતો હોય છે અને પ્રવૃત્તિ પણ તેવી જ કરતો હોય છે. પરંતુ જીવનમાં સંસારની સફરમાં કંઈ જુદુ-ઉલ્લંઘ જ જોવા મળે છે. તેને મુકાબે પહોંચવાની ઉતાવળ નથી હોતી. તેને મંજિલની નહીં પણ માર્ગની મમતા વળગી જતી હોય છે.

કંઈક કરી લેવાની, બની જવાની દુર્લભ તક જોવા આ અવતારને પાખ્યા પદ્ધી પણ હામ, જોમ કે પુરુષાર્થનો અભાવ વર્તતો હોય છે આ જોઈને પેલી કડીઓ યાદ આવી જાય...

*નામ* { 'વર્ધાને તો વહી જવાની ટેવ પડી,  
અમને તો બસ રહી જવાની ટેવ નડી.'

બીજુ પંડિતમાં રહેલ 'નડી' શાબ્દ ધણું બધું કહી જાય છે. જીવનના અંત સમયે આવા અફસોસના ભોગ ન બનવું પડે માટે અત્યારથી જ કંઈક કરવું પડશે. માનવમાંથી મહામાનવ બનવાના આ સોનેરી અવસરને જડપી

લેવામાં જ સાર છે. મહામાનવ બનવાના ત્યાં સુધી પહોંચવાના અનેક ઉપાયો-માર્ગાં પૂજયપાદ દાદાજુરુદેવ ગાચ્છાધિપતિ આ. શ્રીવિજયજ્યઘોષસૂરીશ્વરજી મહારાજાએ પ્રવચન, વાચના કે લેખન દ્વારા જે બતાવ્યા તેને અહીં સંગૃહીત કરવામાં આવ્યા છે.

\* રસ્તામાં બોર્ડ પર વાંચવા મળતાં ઉભા રહો, જુવો અને જાવ ના સૂચનાને વ્યવહાર અને આધ્યાત્મિક સંબંધમાં લગાવીએ તો ઉભા રહો=ઉપશમ, જુવો=વિવેક અને જાવ=સંવર કહેવાય.

\* વ્યવહારમાં સૌભ્યતા અને ચિત્તમાં સમતા રાખો.

\* આલોચના જેમ દોષની કરવાની છે તેમ કાર્યની પણ કરવાની..

\* જે ધર્મપ્રવૃત્તિ દ્વારા આત્મામાં મૈન્યાદિ શુભભાવો, ગુણો આવે તે બધો જ ધર્મપુરુષાર્થ છે અને આ જ વૃદ્ધિ પામતા શુભભાવ દ્વારા આત્મા આગળ વધીને સ્વરૂપમાં ઠરતો જાય તે બધો મોક્ષપુરુષાર્થ છે.

\* લકવો થતા પરમાત્માની પૂજા કરવા ન જઈ શકાય પરંતુ પથારીમાં રહ્યા શત્રુજયની ભાવયાત્રા કરતા કોઈ રોકી શકતું નથી.

\* નજીકની ઉપેક્ષા કરીને દૂરવાળાની કરતી સેવા-ભક્તિ વાસ્તવિક હોતી નથી.

\* બિમારની સેવા કરવાના સમયે જો પોતાની આરાધના મુખ્ય કરે તો પણ કુર્મબંધ.

\* જે ઘરેડ પ્રમાણે ચાલે, ગૌણ-મુખ્યપણું ન કરે, ન માને તે જ્યણ॥  
વિનાના કહેવાય.

આવા અનેક નિરૂપણો પુસ્તકના પાને પાને આલેખાયેલા છે. કોઈ એક પણ પકડાયેલો (ગ્રહણ કરેલો) માર્ગ અચૂક સામે પહોંચાડશે જ એવી દૃઢ આશા છે.

પુસ્તક કાર્યમાં સહાયક બનનાર મુનિરાજ શ્રી સંયમબોધિ વિ.મ. ને  
યાદ કરીને વાંચકવર્ગને પુસ્તક વાંચવાની-વાગોળવાની ભલામણ સાથે વિરમું છું.  
કા. સુ. ૧૫ સત્યકાંત વિ.

## ઉભા રહો, જુવો અને જાવ

રસ્તા ઉપર ઘણી જગ્યાએ લગાડેલા બોર્ડ પર એક વાક્ય વાંચવા મળતું હોય છે.

**“ઉભા રહો, જુવો અને જાવ”**

સાત રસ્તા, ચાર કે ત્રણ રસ્તાના મિલન ઠેકાણો કે ટ્રાફિકવાળા સ્થળે ઉપરનું સેન્ટન્સ લખાયેલું હોય છે. કારણ તે વાહન ચાલકને-પગે ચાલનારને સાવધાન કરે છે. રસ્તા પર માણસ આડેઘડ ડ્રાઇવિંગ કરે યા ગમે તેમ ચાલે તો અક્સમાતનો ભોગ બન્યા વગર ન રહે. રસ્તો કોસ કરતા, સામે જતા કે આગળ વધતા પહેલા ઉભા રહો, આજુભાજુ જુવો=નજર ફેરવો અને પછી જાવ=આગળ વધો. આ ત્રણ વાતને જે આચરે છે, તે મુજબ જે ચાલે છે તે ઇચ્છિત સ્થળે હેમખેમ પહોંચી શકે છે. કોઈ નુકશાન, જાનહાની કે અક્સમાત થતા નથી.

આ જ વાક્યને સાધકે-ધર્મી આત્માએ આગળ વધતા પહેલા નજર સામે રાખવાનું છે. પરમાત્મા પણ આપણાને સાધનાપથ પર ચાલતા સાવચેત કરે છે, ત્રણ સૂત્રો આપે છે.

૧) ઉભા રહો - વિષય-કખાયની આંધિને, અજ્ઞાન, મોહ વગોરેથી ઉત્પન્ન થતા જીવના આવેગ-આવેશને રોકો, એની મોહોદ્યજન્ય, અજ્ઞાનજન્ય, કખાયજન્ય ગતિ રોકો. તમે સ્વસ્થ-શાંત-સ્વભાવસ્થ

- અપરાધીન બનો.

૨) એ રોક્યા બાદ જીવોની ગતિ તપાસો, પુદ્ગલોની ગતિ તપાસો જેથી તમે એનાથી અથડાવ નહિં, એ તમારાથી અથડાય નહિં. અર્થાત્ સામો અજાસમજું હોય તો તેને સમજાવવામાં અથડામણ જ થાય. સામો અવિનયી હોય તો પણ ન સમજે. સામો પાત્રતાવાળો કે પાત્રતા વિનાનો છે, ગરજવાન કે બેફિકર છે, તેનું ધ્યેય શું છે ? તેની લાઇન કદ છે આ બધું નક્કી કરવું પડે. એ જ રીતે પુદ્ગલની પણ પદ્ધતિ - ચાલ - સ્વભાવ નક્કી કરવા પડે અર્થાત્ જાણવા પડે.

એ પછી પોતાની ગતિ - અવસ્થા - કાર્યશક્તિ - દિશા નક્કી કરવી જોઈએ. આ બને (અન્યની તથા પોતાની ગતિ) ઉચિત હોય તો વ્યવસ્થિત કાર્ય થાય અને અનુચિત હોય તો અથડામણ થાય. આ બધું જોવાનું કામ પહેલા કરવું પડે અને તે ઉભા રહ્યા પહેલા ન થાય. બીજાની ગતિ તીવ્ર હોય તો આપણો ઉભા રહેવું પડે, ધીમા પડવું પડે. તેની ગતિ મંદ હોય તો આગળ નીકળી જવાય. તે વળતો હોય તો જગ્યા આપવી પડે, જુદી દિશામાં વળે તો વાંધો નથી હોતો. આમ બીજા જીવનો વ્યવહાર જોવો. એ રીતે પુદ્ગલનો પણ વ્યવહાર = નવું-જૂનું, સમર્થ - અસમર્થ બધું શ્રુતજ્ઞાન અને ભત્તિજ્ઞાનથી જોતા રહેવું જોઈએ. કદ ભૂમિકામાં, કદ અવસ્થામાં, ક્યાં, ક્યારે, શું કરાય - શું ન કરાય આ બધું જોતા રહેવું પડે.

ઉભા રહેવું તે ઉપશમ છે, આવેગ - આવેશની ગતિ રોકવી તે ઉપશમ છે.

જોવું એટલે કે વિચારવું - યોગ્ય વિભાજન કરવું તેનું નામ વિવેક.

ડ) આ પછી કઇ લાઇન છોડવી, કોનો વ્યવહાર છોડવો, કેટલો છોડવો, શું આચરવું, કેટલું આચરવું, કેવી રીતે આચરવું આ બધો નિવૃત્તિ અને પ્રવૃત્તિ વ્યવહાર તે, જાવ શબ્દથી લેવાનો છે તે સંવર કહેવાય.

આમાં અનુચિત-નુકસાનકારકની જે નિવૃત્તિ તે આશ્રવ-ત્યાગરૂપ સંવર છે અને ઉચિત-લાભકારી-આવશ્યક-રક્ષક કર્તવ્યોમાં જે પ્રવૃત્તિ તે ધર્મ-આચરણરૂપ સંવર છે અર્થાત્ વિવેક પછીની યોગ્યપ્રવૃત્તિ અને અયોગ્યનિવૃત્તિ તે બતે સંવર છે. આ બતે ‘જાવ-ચાલો’ એનાથી સૂચિત થાય છે.

જેમ ભૌતિક ક્ષેત્રે સર્વત્ર આ ત્રણાની જરૂર પડે છે તેમ અધ્યાત્મ ક્ષેત્રે અધ્યવસાય અને પરિણાતિમાં પહેલા ઊભા રહેવું, પછી જોવું અને ત્યાર બાદ યોગ્ય રીતે આગળ વધું આ જરૂરી છે. આ ત્રણાને આત્મપરિણાતિને અનુલક્ષીને ઉપશમ, વિવેક અને સંવર શબ્દથી શાસ્ત્રમાં બતાવેલ છે.

ઉપશમ આવે એટલે આંધિ - દોડધામ - આવેગ બંધ થાય અને જીવ વિચારમાં સ્વસ્થ - શાંત બને. તેને વ્યવહારમાં ઊભા રહો કહેવાય છે. સ્વસ્થ અને શાંત બનેલ જીવ યોગ્ય - અયોગ્ય, ગ્રાહ્ય - અગ્રાહ્ય, ઉચિત - અનુચિત, કર્તવ્ય - અકર્તવ્યના ભેદથી જે વિચાર કરવો જોઈએ તે કરી શકે છે. આ વિચારશક્તિ અને વિચારજન્ય કાર્ય તે વિવેક શબ્દથી બતાવાય છે. તેને જ જુવો એ શબ્દથી વ્યવહારમાં સૂચયવાય છે.

તે પછી જવું હોય તો જાવ, ધીમા-જટ ચાલો, વળો - પાછા પડો, ઊભા રહો - આગળ જાવ વગેરે જવાની અને બીજાને જવા દેવાની અનેક પ્રક્રિયામાં કાળજી રાખી વર્તવું તેનું નામ સંવર છે.

ઉિભા રહેવા માટે પણ અમુક નિયમનો છે, દસ્તિકોણો છે, કાળ પ્રમાણ છે તેમ જોવાની પણ રીતરસમ, પદ્ધતિ હોય છે અને જવા માટે પણ અનેક પ્રક્રિયા તરતમભાવે હોય છે. આ ત્રણ સંખ્યકું હોય તો કાર્ય થાય. આગળ ચાલતી ગાડી અચાનક ધીમી પડે કે ઉભી રહે તો Accident થાય માટે તેને લગતા નિયમનો, કાયદાઓ, મર્યાદાઓ જાણવા જોઈએ.

આ ત્રણો વ્યવહાર કર્માદય, બીજા જીવોના વ્યવહાર અને પૌદ્ગલિક વ્યવહારથી આપણાને ભૌતિક કે આધ્યાત્મિક નુકશાન-અથડામણ ન થાય તે માટે વૈચારિક જ્ઞાનની પ્રક્રિયા છે. માટે ઉપશમ વગેરે ત્રણો જ્ઞાનની - ઉપયોગની પરિણાતિના વિષય છે. એમ ઉિભા રહેવું, જોવું, જવું એ પણ જ્ઞાનપરિણાતિના ઉપયોગરૂપ કાર્ય છે. ક્રિયા તેને આધીન હોય તો સાચી-સારી. બાકી તે ક્રિયા અસંઘ્રુતની નાશક પણ બને છે. ટૂંકમાં

- ૧) પરભાવથી ઉભા રહો, પરભાવમાં તણાવ નહિં, મુંજાવ નહિં.
- ૨) પરભાવને પરરૂપે જુવો - ઓળખો, સ્વભાવને સ્વરૂપે જુવો-જાણો.
- ૩) સ્વભાવ - સ્વગુણ - સ્વકર્તવ્યમાં - સ્વઆચારમાં જાવ-રમો.

પરભાવ - પરની પંચાત - પરની સંભાળમાંથી નિવૃત્ત થાવ, સાધન - ઔચિત્ય પૂરતું અપ્રધાનતાથી સંભાળો.

આ નિશ્ચય અને વ્યવહાર, આધ્યાત્મિક અને ભૌતિક, ધાર્મિક અને સાંસારિક બધે લાગુ પડતી પ્રક્રિયા છે. તેનાથી બધે અસમાધિ, અસંદ્રવ્યવહાર, અરૂચિ આહિ ટાળી શકાય છે, ચિત્ત પ્રસન્ન - સ્વસ્થ રહે છે, આરાધનામાં શુભ ભાવો જાગી શકે છે અને સત્ત્વ ખીલતાં કર્મક્ષય થછ મોક્ષ સુધી પહોંચી શકાય છે.

## વજુએ વચન કરોર

અનંતશાની પરમાત્માની વાણીસ્વરૂપ ૪૫ આગમોમાં જે સૌ પ્રથમ રહેલું છે તે આચારાંગ સૂત્રમાં પરમાત્મા જગતનું સ્વરૂપ દેખાડતા કહે છે કે આખો લોક-સંપૂર્ણ વિશ્વ આર્ત છે, પીડિત છે. દેવલોક હોય કે નરક, મનુષ્યલોક હોય કે તિર્યંચ બધા જ સંતપ્ત છે.

પરમાત્માનું આ વચન આજે પૂર્ણ સત્ય જેવું લાગી રહ્યું છે. દુનિયામાં સર્વત્ર અશાંતિ-અજંપાનું વાતાવરણ દેખાય છે. ધરમાં કે બજારમાં, સ્વજન કે પરજનમાં, સંસારમાં કે ધર્મક્ષેત્રમાં કલેશ-જઘડાનું જ પ્રમાણ વધતું દેખાય છે. કોઇ પ્રસંગ કે પરિસ્થિતિ ઉભી થતાં આકુળ બાકુળ બની જતાં હોઈએ છીએ, બીજાને જ દોષી ગણતા હોઈએ છીએ. પોતાની પણ થોડી કચાશ-ભૂલ છે તેવું માનવા આપણો તૈયાર હોતા નથી. સામેવાળાનું હદ્ય તો એક આરિસા જેવું છે. આપણા વિચાર-વાણી-વર્તન જ તેમાં પ્રતિબિંબિત થતા હોય છે. જો આપણા હદ્યમાં કોમળતા, વચનમાં મધુરતા અને વર્તનમાં વાત્સલ્ય હોય તો સામાન્ય તરફથી પણ એવું જ મળે.

સંસારના વ્યવહારોને સુંદર બનાવવા કે આધ્યાત્મિક વિકાસ સાધવા પરસ્પર પ્રેમ-પ્રેરણા અને આલંબનની જરૂર પડતી હોય છે. તે માટે સામાન્ય હદ્યમાં આપણા પ્રત્યે અને આપણા હદ્યમાં તેના પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય હોવું જરૂરી છે.

સૌ પ્રથમ તો આપણા વદ્યમાં પ્રેમ જોઈએ આપણો બીજાની સાથેનો પ્રેમભર્યા સંબંધ આપણા માટે અને બીજા માટે લાભદાયક બને છે. વિપરીત સંબંધ નુકશાનકારી બની શકે છે. આપણો જો મીઠાશ રાખીએ તો સામો માણસ પણ મીઠાશ રાખે. લાગણીના સંબંધો જેના જીવનમાં નથી તેનું જીવન પશુ જેવું છે. જીવનમાં જો પ્રેમ-વાત્સલ્ય આવે તો આપણો બીજાના લાભ-નુકશાનને વિચારી શકીએ. બીજાને યોગ્ય-અયોગ્ય સમજાવીને આગળ વધારી શકીએ. સામી વડ્ઝિત આપણી સાચી-સારી પણ સલાહ જો ન માને, ન સ્વીકારે તો સમજવું કે આપણા સંબંધમાં-લાગણીમાં ખામી છે અને તેથી જ તેની જોડે રાખેલ સંબંધ લાભકારક નીવડ્યો નથી.

પશુ પણ આપણા તરફથી થતાં કડવા-મીઠા વ્યવહારને સમજતું હોય છે. તેની સાથે પણ જો મીઠો વ્યવહાર કરીએ તો તે આપણી વાત માનવા-સ્વીકારવા તૈયાર થાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહને જડબામાંથી પકડી કપડુફાડે તેમ ફાડી નાંખ્યો. સિંહની આંખમાં કોધ અને દુઃખ જોઈ બાજુમાં ઉલ્લેલા સારથિએ મીઠાશભર્યા વચ્ચે કહ્યું ‘તું જેમ પશુઓમાં રાજા છે તો તને છણનાર પણ મનુષ્યોનો રાજા છે માટે અફસોસ કરીશ નહીં’ આ વચ્ચનોએ સિંહના દિલમાં સારથિ પ્રત્યે પ્રેમ જાગ્યો અને તેના જ પ્રભાવે સારથિનો જીવ ગૌતમસ્વામી બન્યો અને સિંહના જીવ ખેડૂતને સમ્યક્ત્વ પમાડી શક્યો. આમ બીજા સાથેનો મીઠો વ્યવહાર આ ભવમાં અને ભવાંતરમાં લાભદાયી બને છે.

આપણો માત્ર જીવવાનું-જ નથી. જીવીને કંઇક કરવાનું છે, મેળવવાનું છે. કંઇક નવું કરવા માટેનું સાધન જ્ઞાન-મીઠો વ્યવહાર છે. જ્યાં કડવો વ્યવહાર રાખીએ ત્યાં જ્ઞાન-રૂચિ-પ્રવૃત્તિ અને પ્રીતિ

બધું નાશ પામે છે.

જેના ઘરમાં કંકાશ હોય, સંપ-સહ્યતા-મીઠાશ-આનંદ ન હોય તે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની વૃદ્ધિ થતી નથી. બાપ દિકરાને પચ્ચીસ પેસાના નુકશાનમાં કડવા શબ્દોથી ઠપકારે, ધમકાવે તો છોકરો કેટલા દિવસ દુકાનમાં આવે ? ઠપકાની જગ્યાએ જો તેને પ્રેમથી સમજાવવામાં આવે તો તરત દુકાને આવે, અર્થાતું વ્યવહારમાં અને ચિત્તમાં સૌભ્યતા-સમતા જોઈએ. સમતાથી જે કામ થાય તે દંડથી ન થાય. સામ-દામ પણી દંડ આવે. જે પ્રેમથી-લાલચથી ન માને તે દંડને યોગ્ય છે.

જેની જીબમાં સરસ્વતીને બદલે ચંડીકાઢેવીનો વાસ હોય તે બધે જ માર ખાય-હડધૂત થાય. જ્યાં સુધી પુષ્ય હોય ત્યાં લગી બધા સાથે રહે, આજ્ઞા માને. જ્યાં પુષ્ય પરવારે ત્યાં બધા તરફથી તિરસ્કાર મળે, બધા તેને છોડીને ચાલ્યા જાય, એકલો અટુલો પડે, ભવાંતરમાં પણ વચ્ચનશક્તિ-લઘ્ય ન મળે. જ્યાં જાય ત્યાં વિકાર-અવજ્ઞા-અનાદર જ થતા રહે, નિરાધારપણાની બુદ્ધિ મળે.

કોઈ પણ મહાપુરુષના જીવનમાં-વચ્ચનમાં-દ્રષ્ટિમાં તિરસ્કાર-ઋક્ષતા-અસહ્યતા હોય નહીં. પરમાત્મા દરેક જીવોનું ત્રણો કાળનું સ્વરૂપ જાણો છે છતાં દેશનામાં ક્યારેય કટુ-કર્કશ શબ્દ આવે નહીં.

જેના ઉપર પ્રેમ ન હોય તેના તરફથી આવતી પ્રતિકૂળતા-અગવડ આપણાને ઉશ્કેરાટ કરાવે, જ્યારે આપણાં હદ્ય પ્રેમથી ભરેલું હોય તો તે પ્રતિકૂળતા લાગતી જ નથી. તેની મોટી ભૂલ પણ Let go કરાય અને જો પ્રેમ ન હોય તો નાની ભૂલમાં પણ તેને છોડીએ નહીં. પાડોશી કોઈ પણ વસ્તુ લાવીને આપણી બારીમાં મૂકે તો

અકળામણા-ગુસ્સો થાય જ્યારે ઘરની જ વ્યક્તિ લાવીને મૂકે તો ન થાય. કારણ એક જ કે પાડોશી પ્રત્યે પ્રેમ નથી જ્યારે ઘરની વ્યક્તિ ઉપર સ્નેહ છે. જ્યાં લાગણી હોય ત્યાં વ્યવહાર સ્વાભાવિક રીતે જ બદલાઈ જાય છે.

બીજ વાવેલું હોય પણ જો પાણી ન નાંખીયે તો ન જ કૂટે, બીજને ફૂટવા માટે પાણીની જરૂર પડે અને તેને આગળ વધારવા માટે માટી જોઈએ, તપેલીમાં બીજ ફોડી શકાય પણ આગળ ન વધારી શકાય, માટી જ તેને વધારી શકે અર્થાતું બીજ વાવીને તેને ફૂટવા પાણી જોઈએ અને આગળ વધારવા માટી જોઈએ તે જ રીતે સામી વ્યક્તિના વિકાસના બીજને ફૂટવા માટે સ્નેહધત્તા અને સ્નેહમયતા હૃપી પાણી જોઈએ અને આગળ વધારવા પ્રેમ અને વાતસ્થ્ય જોઈએ.

આજ અનુસંધાનમાં બીજ વાત, આસપાસની બધી વ્યક્તિઓ ભાઇ-બાપા કરતી હોય, બધું જ પોતાનું સાચવતી હોય, ચારેબાજુથી અનુકૂળતા મળતી હોય છતાં ઘણીવાર માણસ ઉદાસ દેખાતો હોય છે, કાંઈ કરવાનું તેને મન થતું નથી. ગુમગીનતા-બેચેનીમાં સમય પસાર કરવો પડતો હોય છે. તેની પાછળ એક જ કારણ હોય છે-બીજાની સાથે ઋક્ષતા કરીને તેને આપેલી અપ્રસન્તતા. તેના દ્વારા એવું કર્મ બંધાય કે જેનાથી બહાર બધું જ વ્યવસ્થિત હોવા છતાં અંદરથી પોતે બેચેન હોય. બીજાની સાથે ઋક્ષબ્યવહાર હોય તો પોતાની જાત માટે અપ્રસન્તતા ઉભી થાય તેવા કર્મો બંધાય તેથી પોતે પ્રસન્ત રહેવા માટે પણ બીજાની જોડે ઋક્ષબ્યવહાર ન કરવો. જેની સાથે ઋક્ષબ્યવહાર થતો હોય તેમાં સામેની વ્યક્તિ સહનશીલ હોય તો સત્ત્વ ફોરવીને સહન કરે, બાકી ઋક્ષતાથી પોતાને-બીજાને

ધર્ષણું નુકશાન થાય. મધુર વ્યવહારથી બધે સારું થાય, સારું મળે.

જ્ઞાનતાને છોડવા વાતસલ્ય ઉભું કરવું. બધા જીવો પ્રતિ ફદ્ય કોમળ બનાવવું જોઈએ. વાતસલ્ય જેવું માને બાળક પ્રતિ હોય છે તેવું જોઈએ.

પરિવાર પર-સ્વજનો પર તો વાતસલ્ય-સ્નેહ રહે છે પરંતુ જે ગુનેગાર છે તેના ઉપર પણ વાતસલ્ય રાખવું જોઈએ. ડોક્ટર જેમ દર્દી પ્રત્યે વાતસલ્ય જ રાખે, દર્દ પ્રત્યે ભલે કઠોર બને તેમ સંસારના જીવો નિમિત્તવાસી-મોહ-અશાનને પરવશ છે. કોઈના પણ જીવનમાં નાની મોટી ભૂલો થવાની પૂરી સંભાવના છે તેવે સમયે તેને ધિક્કારવો તે અયોગ્ય છે. વ્યક્તિ નહીં ભૂલ ધિક્કારપાત્ર છે. છતાં આપણો વ્યક્તિને દોષિત ગણીને તેની જોડે જ્ઞાનવ્યવહાર કરીએ છીએ. ભૂલ પણ પ્રેમથી બતાવીએ તો સુધુરે. વધારે તીખી વસ્તુ કોઈ ન જાય તેમ તીખા વ્યવહારવાળા ના કોઈની સાથે સંબંધ સારા ન રહે.

આનાથી લાભ એ થાય છે કે વાતસલ્યથી ભરેલા ફદ્યવાળો જ્યારે વાતસલ્ય નથી કરતો ત્યારે પણ પુષ્ય બાંધે છે. જ્યારે જ્ઞાનવ્યવહારવાળો શાંત હોવા છતાં પાપ બાંધતો હોય છે કારણ કે જ્ઞાનતા મનમાં તો ભરેલી છે તેથી નિમિત્ત મળતા ક્યારે ઉકળી પડે, તે કહેવાય નહીં. માટે ફદ્યમાં તો ભરપુર પ્રેમ-વાતસલ્ય રાખવા.

જેને સંદા માટે પ્રશામ જોઈએ, આનંદ જોઈએ તેણો બધા ઉપર ફદ્યમાં વાતસલ્ય અને વાણીમાં મીઠાશ રાખવા.



## ઉપશમ અમૃત રસ પીજુએ

ઉપશમ=આવેશ અને આવેગથી રહિતપણું, એનો ત્યાગ,  
એને અટકાવવું. કોધાહિ ચારેમાંથી કોઇપણ કખાયથી આવિષ્ટ-વ્યાપ્ત  
જીવનું મન શાંત નથી હોતું. કોઇની પણ વાત વિચારવા-સમજવા  
તૈયાર નથી હોતો. ચંડકૌશિકના પૂર્વના સાધુના ભવમાં પોતાની  
ભૂલ હોવા છતાં તે ભૂલ સ્વીકારી ન શક્યા. ભરત મહારાજા માનના  
આવેશમાં ભાઈઓ સાથે યુધ્યમાં ઉત્ત્યા. પોતે મહાશક્તિશાળી હોવા  
છતાં છેવટે બાહુબલી સાથે પાંચ યુધ્ય લડ્યા અને ચક મૂક્યું. આ  
બધો આવેશ હતો. માનના કારણો બ્રાહ્મી અને સુંદરી પૂર્વભવમાં  
પોતાના ઇર્ઝા અને અયોગ્ય વિચારને ન પારખી શક્યા. એ રીતે જે  
દોષ જેનામાં હોય તે તેને ન જણાય એમાં અજ્ઞાન જેમ કારણાં હોય  
છે, તેમ કખાય-નોકખાયની તીવ્રતા પણ કારણરૂપ હોય છે. આના  
કારણો જીવ સમજવા-જાણવા છતાં પોતાના દોષને દોષ તરીકે પકડી  
શકતો નથી.

ઉપશમવાળાને બીજા સમજાવી શકે છે. ઉપશમવાળાને  
અજ્ઞાન હોય અને ખોટા-ભૂલના રસ્તે હોય તો પણ સમજવાની યોગ્યતા  
છે, તેથી તે પ્રજ્ઞાપનીય છે, અનાભિગ્રહીક અવસ્થા છે. આ  
અનાભિગ્રહીકપણું જેમ મિથ્યામત સંબંધી છે તેમ કખાય અને વિષયો  
સંબંધી છે, તેથી આ ઉપશમ ચરમાવર્તમાં અને અપુનર્બન્ધકથી હોય

છે. આ ઉપશમના કારણો અપુનર્બંધકના લક્ષણા :- તીવ્રભાવે પાપ ન કરે, ભવરાગ તીવ્ર ન હોય. આ બે તીવ્રતાનો નિર્બેદ તે વિષય-કખાયની તીવ્રતાના નિર્બેદ રૂપે છે. આ બજેના કારણો ઉચિત મર્યાદા ન ઉલ્લંઘે તે ત્રીજો ગુણ બતાવ્યો છે. આ અપુનર્બંધકપણાથી જે ઉપશમ આવે તે પ્રધાન હોય છે અને ઉત્તરોત્તર તીવ્ર-તીવ્રતર બનતો હોય છે.

આનાથી પહેલા અચરમાવર્તમાં ઉપશમ અપ્રધાન હોય છે. અપ્રધાન ઉપશમ કર્મદયની મંદ્તારૂપ છે. મોહનીયની તીવ્રતાની યોગ્યતા હોવા છતાં દ્વય-ક્ષેત્રાદિ કારણોથી ભવ વગેરેના કારણો, સાંયોગિક કારણો કે તેવા પ્રલોભન વગેરે ભાવના કારણો કે નિઃસત્ત્વતા વગેરેના કારણો ઉપશમ જેવું જે હોય તે અપ્રધાન છે. તે લાંબો સમય ટકાતું નથી. તે નિર્ભૂળ નાશ પણ થાય છે. તે વિશિષ્ટ કર્મ નિર્જરા કે વિશિષ્ટ પુષ્યબંધનું કારણ નથી. આ ઉપશમ સામાન્ય પુષ્ય અને સામાન્ય નિર્જરાનું કારણ છે. તેને સંલિયાનું આલંબન હોય તો ગ્રૈવેયક સુધી લઇ જાય છે. સામાન્ય બાળતપ-અજ્ઞાનકષ્ટ વગેરેના આલંબનમાં ભવનપતિ-બંતરમાં પણ આ ઉપશમના પ્રતાપે જવાય છે.

મરણ વખતે પીડા, પ્રતિકૂળતા કે કોઈનાથી મરાવું કે આપધાત કે અચાનક શીંઘ થતું મરણ, આ બધામાં અંતકાળે જો મનમાં કખાય વિષયોથી મન ન ધેરાતા, શાંત-શુભ વિચારયુક્ત કે પીડા વગેરે પ્રત્યે ઉદાસીનતારૂપ શુભભાવ આવે તો તે ભવનપતિ બંતરમાં જાય છે. આ પણ અપ્રધાન ઉપશમ છે. આનાથી ક્યારેક શાસ્ત્રની શુંતિ-ચિંતન-અધ્યયનની વેરાગ્ય ભાવનાના આલંબનથી, તપ-ત્યાગ-સંયમના આલંબનથી જે થોડી વિશેષ છતાં અપ્રધાન

સ્વસ્થતા આવે તેને શુંતસામાયિકનો લાભ કહેવાય છે. આ શુંત સામાયિકમાં સ્વસ્થતાનું કારણ જ્ઞાન, ચિંતન, આચાર, ઔભ્યાસ, તપ, અનુષ્ઠાન પણ હોય. શુંત વગેરેના કારણો આગાંતુક અને અલ્યુ પ્રમાણના ઉપશમનો લાભ તે શુંતસામાયિક. સમતા અને ઉપશમ બજેનો અપેક્ષાએ એક અર્થ પણ છે.

બીજો અપુનર્બન્ધકથી જે ઉપશમ હોય છે તે પ્રધાન ઉપશમ. તે પ્રારંભિક અવસ્થામાં અલ્યુ હોય છે, પછી ઉત્તરોત્તર વધતાં વધતાં ૪ થે વગેરે ગુણસ્થાને વિકસિત થાય છે.

આ પ્રધાન ઉપશમના બે પ્રકાર છે. લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ. લબ્ધિરૂપ ઉપશમને સભ્યક્તવની નીચેની ભૂમિકામાં કેટલાક કષાયોપશમ કહે છે, કષાયની મંદતા કહે છે, પણ આ મંદતા પ્રતિપાતી અને અપ્રતિપાતી અથ બે પ્રકારે છે.


આ ઉપશમના કારણો જીવ અપુનર્બન્ધકપણામાં અંત: કોટાકોટીથી વધારે સ્થિતિ બાંધતો નથી. અશુભ પ્રકૃતિઓનો ર સ્થાનકથી વધારે રસ બાંધતો નથી.

આ ઉપશમ જે લબ્ધિરૂપ મિથ્યાત્વ અવસ્થામાં અપુનર્બન્ધકને હોય છે, તેના કારણો જીવ શુભ વિચાર અને શુભ આચાર પુક્ત બને છે, તેમાં મજબુત થાય છે. ચારિત્ર મોહનીયની રૂપ પ્રકૃતિઓની ર અને ૪ સ્થાનક રસના ઉદ્યની અયોગ્યતા આ ઉપશમના પ્રભાવે થાય છે. આના કારણો મિથ્યાત્વ પણ મંદ-મંદતર બને છે.

આ ઉપશમના પ્રતાપે ચારિત્ર મોહનીયની મંદતા અને મિથ્યાત્વની મંદતાના કારણો ગુણોની પ્રભા-પ્રકાશ ઉત્પત્ત થાય છે. જેને માર્ગાનુસારી વગેરે ગુણો કહેવાય છે.

આ ઉપશમની તીવ્રતા વધતાં બીજા ગુણોનો વિકાસ થવાની સાથે જ્ઞાનાવરણા, દર્શનાવરણા, અંતરાયોનો પણ અમુક ક્ષયોપશમ થાય છે, તેથી વિશેખરુપે સમજણાશક્તિ-વિચારશક્તિ ઉત્પત્ત થાય છે, તેને વિવેક કહેવાય છે. ઉપશમ વગર વિવેક આવે નહિ, ટકે નહિ, વધે નહિ. શાંત માણસ વિવેકી હોય કે ન પણ હોય પણ વિવેકી શાંત જ હોય. ઉપશમની અમુક હદની પરાકાણાની ભૂમિકામાં વિવેક હોય છે.

•\*• •\*• •\*•



## બાળો ખોટો દોષ- કરે ભવણો પોષ

હુનિયામાં કોઈ પણ વસ્તુના-ચીજના-પદાર્થના-વ્યક્તિના બે બેદ પરસ્પર વિરુદ્ધતાને કારણો પડે છે. તે કાં તો સારી હોય યા નરસી હોય, સાચી હોય કાં ખોટી હોય, લાભકારી હોય અથવા નુકશાનકારી હોય. એકને આપણો સારી કે સાચી કહીએ એટલે બીજું-બીજા ખરાબ-ખોટાના વિભાગમાં જાય, તેની વિરુદ્ધ-ઓપોર્ઝિટ બની જાય.

આધ્યાત્મિક જગતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્માના વિકાસ કે વિનાશ માટે ગુણા કે દોષ રહેલા છે. જો આત્મોનતિ માટે ગુણોને પ્રાયોરીટી આપીએ એટલે દોષો આપોઆપ માધનોરીટીમાં મૂકાઈ જવાના. જો દોષને મહત્વ આપીએ તો ગુણો ગૌણા બનવાના.

પરંતુ બહારની વસ્તુ કે વ્યક્તિની ઓળખાણ-જાણકારીમાં ભૂલ થાય તો એટલું નુકશાન નથી થવાનું જેટલું ગુણા-દોષના જ્ઞાનમાં થાપ ખાઈને સંસાર વધવામાં થવાનું. કારણ કે પદાર્થ કે પર વ્યક્તિ કોઈ એકાંતે સારા-નરસા, સાચા-ખોટા, લાભકારી-નુકશાનકારી નથી, જ્યારે ગુણા દોષમાં એવું નથી. દોષો એકાંતે અહિતકારી જ છે અને ગુણો એકાંતે હિતકારી છે. દોષો નુકશાન જ કરવાના અને ગુણો લાભ જ આપવાના.

દોષો બે પ્રકારના છે - નાના અને મોટા, સૂક્ષ્મ અને સ્થૂલ. જોયા વગર ચાલવું, ઉધાડા મુખે બોલવું, પાણી ગાળવું-કચરો કાઢવો વિ.માં અજ્યણા તે નાના દોષો. આ ઝીણા ઝીણા પ્રમાદને કારણો સંયમ-ક્રત નિર્ભળ ન થાય. નિયમ-ક્રતને નિર્ભળ-સ્વચ્છ રાખવા માટે નાના દોષને-અલ્ય પ્રમાદને પણ દૂર રાખવાં પડે છે કારણ કે નાના જ આગળ જતાં મોટા સ્વરૂપને ધારણ કરે છે. જોકે નાના દોષમાં માયાનો સંભવ નહિવત્ત હોવાથી ક્યારેક પણ તેની ભૂલ સુધારી શકાય છે, પ્રમાદ દૂર કરી શકાય છે. છતાં તે દોષ પોતાનો પ્રભાવ તો બતાવે જ છે. નુકશાનના નાના ખાડામાં પણ ઉતારી જ દે છે. પરભવમાં ભવનપતિ-વંતર જેવા તુચ્છભવોમાં સાધુને પણ ઉતારી દે છે. બાકી સાધુ માટે કહેવાય કે -

એગદિવસં પિ જીવો પબજ્જમુવાગઓ અણણણમણો ।  
જઇવિ ણ પાવડ મોકખં અવસ્સ વેમાળિઓ હોડ ॥

અક દિવસનું પણ ચારિત્ર પાળનાર જો મોક્ષ ન પામે તો ય અવશ્ય વૈમાનિકમાં તો જાય જ. છતાં નાના દોષની બેકાળજી- ઉપેક્ષા તેને નીચે ઉતારે છે. નીકિમાં વચ્ચે આડી પડતી સળીની જો ઉપેક્ષા કરાય તો તે જગ્યાએ બીજી સળીઓના ભરાવાથી આગળ જતા બગીચાને સુક્કોલહુ કરી નાંખે છે.

બીજા નંબરમાં છે મોટા દોષો - મનનાં સંક્લેશો-કિલાદ અધ્યવસાયો. તેની ઉપેક્ષા તો ભયંકર નિવડી શકે છે કારણ તેમાં માયા પેસવાના પૂરા ચાન્સીસ છે અને જેમાં માયા પેસે તે સંસાર વધાર્યા વગર ન રહે. જેની પક્કડ થઈ જાય અને જે માયાયુક્ત બને તે યાવત્ત અનંતસંસાર વધારનાર બને. આમે ય પ્રમાદ દોષ ખતરનાક } }

છે જ તેમાં પાછી માયા ભળે એટલે બાકી શું રહે ? ચોરી ઉપર શિરજોરી જેવું થાય. સાધ્વી રૂક્ષમી કે સાધ્વી લક્ષ્મણાનો સંસાર કોણો વધાર્યો, દોષે-ભૂલે ? ના, દોષ-ભૂલ તો નાના હતા. તેમાં માયા ભળી ત્યાં સંસાર ઉભો થયો.

આવા દોષ-પ્રમાદ-ભૂલોને કાઢવાનો-દૂર કરવાનો ઉપાય છે (૧) હદ્દયમાં અત્યંત પશ્યાત્તાપ (૨) ગુરુસમક્ષ આલોચન. થયેલ ભૂલ પ્રત્યે હદ્દયમાં જો પશ્યાત્તાપ હોય અને ગુરુ સમક્ષ તેનું યથાવસ્થિત નિવેદન હોય તો શુદ્ધિ સાચી થાય. આલોચના પશ્યાત્તાપ સાથે અને પશ્યાત્તાપ વિના બતે રીતે થાય છે. પશ્યાત્તાપપૂર્વકની જો આલોચના હોય તો દોષનો નિર્ભૂળ ક્ષય થાય. ફરી વાર તે દોષ જીવનમાં આવી ન શકે.

પશ્યાત્તાપ વિના આલોચના કરે તો દોષ ઉભો રહે છે છતાં ગુરુસમક્ષ નિવેદન કરે છે તેથી તેની પાછળનું માયાકરણ જાય છે. માયાકરણ જતાં તેના પક્ષપાત-પક્કડ નાશ પામે છે. જે માયા-પક્ષપાત સંસાર ઉભો કરવામાં હેતુભૂત છે તે આલોચન દ્વારા નખ થાય છે તેથી પશ્યાત્તાપ ન હોય તો પણ આલોચના કરાય. છઘસ્ય આત્માઓમાં ઓછા-વતા અંશો દોષો-ભૂલો રહેવાના. પરંતુ તેટલા માત્રથી સૌ દોષી, પાપી કે અચારિત્રી નથી બની જતા. શાસ્ત્રમાં ત્રણ વિભાગ પાડ્યા છે. ૧) સંવિગ્ન ૨) સંવિગ્નપાક્ષિક ૩) અસંવિગ્ન.

- ૧) જે નાના નાના દોષોમાં પણ કાળજીવાળો, પશ્યાત્તાપવાળો, આલોચના કરનારો છે, શુદ્ધિને છઘણારો છે તે બફુશ-કુશીલચારિત્રવાળો હોવા છતાં સંવિગ્ન કહેવાય.
- ૨) જે આત્મામાં દોષોનો પશ્યાત્તાપ છે પરંતુ ‘હું તેને છોડી-

રોકી શકવાનો નથી' તેમ માની આલોચના-શુદ્ધિ કરતો નથી તે સંવિઘનપાદિક કહેવાય. જોકે આ વધારે ટકાવી શકતું નથી.

૩) અને જેનામાં પશ્યાત્તાપ જ નથી અને આલોચના-શુદ્ધિ પણ નથી તે અસંવિઘન કહેવાય.

જેને પશ્યાત્તાપપૂર્વકની આલોચના હોય તેના ચારિત્ર-ગ્રત સાતિયાર હોવા છતાં નિરતિયાર કહેવાય કારણ કે વાસ્તવિક શુદ્ધિ કરે છે. પણ જે આલોચના કરતાં જ નથી તેનું તો વ્યવહારથી પણ ચારિત્ર નસ્ત થાય. તે માયાને કારણ-પશ્યાત્તાપના અભાવને કારણે પરિણામવિશેષથી સંસાર વધારે છે.

શુદ્ધ પશ્યાત્તાપ + આલોચના હોય તો સૌથી ઉત્તમ. કદાચ પશ્યાત્તાપ ન જાગે તો ય જીવ હિંમત કરીને ગુરુ આગળ આલોચના કરે તો આગળ વધવા યોગ્ય બને.

પ્રશ્ન :- આલોચના શા માટે કરવાની ?

ઉત્તર :- આલોચના કરવાથી (૧) પાપનો પક્ષપાત તૂટે છે.  
(૨) પાપ નો પશ્યાત્તાપ થાય છે. (૩) પાપનિવૃત્તિ શક્ય બને છે.  
(૪) ધર્મનો પક્ષપાત ઉભો થાય છે. (૫) ધર્મ પ્રાપ્ત થાય છે.

સ્વાધ્યાય ન કરે તેને સ્વાધ્યાયની અરૂપિ હોય ને તપ કરાવીએ તો શુદ્ધિ ન થાય. યવરાજર્ષિને અરૂપિ હતી, છોકરાના બોલાયેલા શબ્દો ગોખીને ઘાતમાંથી બચ્યા ત્યારે કામ થયું, અરૂપિ ગઇ.

કોઈ પણ યોગની આરાધના ઓછી-વતી હોય તો ચાલે પણ એકેય યોગની અરૂપિ-તિરસ્કાર એ બધા યોગની આરાધનામાં આગળ વધવાના દરવાજા બંધ કરે છે.

આલોચના બે પ્રકારે, ૧) દોષની ૨) કાર્યની, કાર્યની

આલોચનાનો પ્રથમ વિચાર કરીએ. અહીં આલોચનાનો અર્થ કથન કરવાનો. કાર્ય કરતા પૂર્વ કહેવું અને કાર્ય કર્યા પછી ‘આ રીતે કર્યું’ તેમ જ્ઞાવવું તે કાર્યની આલોચના કહેવાય. આમાં મોટા-નાના પણ ગોણ બને છે. કારણ મોટા પણ મોહ-અજ્ઞાનવશ ભૂલે ત્યારે જો નાનાને કથન કરવાનું રાખ્યું હોય તો બચી જાય. આ કાર્યની આલોચનાથી (૧) જો કાર્ય કરવાનું બાકી હોય તો તેના દોષ જાણી અટકી જવાય છે અને (૨) કાર્ય થઇ ગયું હોય તો પોતાને કોઈ દોષ ન દેખાયો હોય છતાં બીજાને કહેવાથી તેમને દોષ-નુકશાન દેખાતા બતાવી શકે છે. સાધુને ગોચરી લાવ્યા પછી ગુરુને-મોટાને (મોટાના અભાવમાં નાનાને પણ) બતાવવાનો વિધિ બતાવો છે. અને આ વિધિના કારણો જ પેલા સાધુને તુંબડી કડવી હોવાનું, પરઠવવાનું ગુરુ કહી શક્યા અને પેલા મહાત્મા સર્વાર્થસિદ્ધ કે મોક્ષ મેળવી શક્યા.

બીજા નંબરમાં છે દોષની આલોચના-કથન. આ કરવાથી દોષો પર અરૂપિ / તિરસ્કાર ઉભો થાય છે. તેનાથી નિવર્તન શક્ય બને છે. જે આલોચના કરે નહીં તેનામાં પાપવલણ નાસ્ત થતું નથી. સ્થૂલભાષામાં પશ્ચાત્તાપ દેખાતો હોવા છતાં ગુરુને નહીં કહેવા દ્વારા તેનો પક્ષપાત ઉભો થાય છે.

તેથી ફદ્યના પશ્ચાત્તાપપૂર્વક આલોચના કરવી. પાપનો પશ્ચાત્તાપ ન હોય તો પણ આલોચના કરવી, તેનાથી જીવન સ્વસ્થ-નિયમિત-શુદ્ધ બને છે.

જે આલોચના ન કરે તેનામાં ભાવસંયમ/ વિરતિ પ્રાય: હોતા નથી તેથી બધાએ વ્યાવહારિક રીતની જેમ આંતરિકશુદ્ધિથી પણ આલોચના કરવી એનાથી આરાધનામાં, લાગણીમાં અને અંદરની પાપવૃત્તિના ઘસારામાં ઘણો ફરક પડશે.

# સ્મરણા-શરણા-સમર્પણા-સમાપનિ

સ્મરણ એટલે યાદ આવવું, યાદ કરવું. સ્મરણ ત્રણ પ્રકારે થાય છે. હૃદયમાં ત્રણ પ્રકારની લાગણી હોય છે. ૧) જ્ઞાયરૂપે (૨) હેયરૂપે (૩) ઉપાદેય રૂપે.

**હેય તત્ત્વ :-** જ્યાં જીવને નુકશાનની સંભાવના કે નિર્ણય થાય પછી ભલે તે વાત સાચી હોય કે ખોટી હોય ત્યાં જીવને હેયની લાગણી થાય છે. આ હેયની લાગણીમાં બુદ્ધિની તરતમતા અલ્ય-વધારે નુકશાનની તરતમતા ઉપર છે. નુકશાન ન હોય છતાં નુકશાનકારક છે તેવું જ્ઞાન થાય તો હેયબુદ્ધિ થાય. વધારે નુકશાનકારક છે તેવું જ્ઞાન થાય તો વધારે હેયબુદ્ધિ થાય. નુકશાનના આધાર ઉપર હેયબુદ્ધિ નથી પરંતુ નુકશાનકારકતાના જ્ઞાન-પરિણાતિ ઉપર હેયબુદ્ધિ થાય છે. હેયબુદ્ધિ થાય ત્યાં અરૂચિ પણ થાય. પ્રારંભિક જીવોમાં એ સ્પષ્ટ જણાઈ આવે.

**હેયપણાની લાગણી** ૧) પૂર્વના સંસ્કારોથી થાય. ૨) નુકશાન દેખાવાથી ભય લાગે અને હેયપણાની લાગણી થાય. ૩) કોઈના સમજાવવાથી થાય. ૪) શાસ્ત્ર અધ્યયન અને વારંવાર તેની ભાવનાથી પણ થાય. આવી લાગણીઓ દ્વારા જે સંસ્કાર પડે તેથી તે વાતના સ્મરણાની સાથે હેયપણાની, નુકશાનકારકતા વળેરેની લાગણીઓ વ્યક્ત થાય છે. આ લાગણી વસ્તુ માટે, વ્યક્તિ માટે,

તેવા સંયોગો અંગો, વિયોગ અંગો કે તેવી તેવી અવસ્થા માટે થાય છે.

**ઉપાદેયતત્ત્વ :-** જ્યાં જીવને લાભકારી, ગુણકારી, અનુકૂળ, ઉત્તમ, સારી વગેરે સમજણા, બુધ્ધિ થાય, તેવો અનુભવ થાય ત્યારે એ વસ્તુ-વક્તિ-અવસ્થા-સંયોગ વગેરેમાં ઉપાદેયપણાની લાગણી થાય છે. આ લાગણીઓ થયા બાદ એની સ્મૃતિ વખતે પણ એ લાગણીઓ વક્તપણો અનુભવાય છે. પ્રયત્ન સમજણા વગેરેથી જુની લાગણીઓ સુધરે છે, નાશ પામે છે, ફેરવાય છે અને તે જ રીતે નવી લાગણીઓ ઉત્પત્ત થાય છે, મજબુત બને છે.

આથી જ છદ્દસ્થ જીવોના જૂના પડેલાં સંસ્કારો જે મોહ-અજ્ઞાન-કખાય-વિષય-અવિવેક-દુર્ગુણના છે તેને પ્રયત્નથી સુધારી શકાય છે, નાશ કરી શકાય છે. ગુણોના-વિવેકના-જ્ઞાનના-ઔચિત્યના-આદરના સંસ્કારો, જ્ઞાન-ક્રિયા-ભાવના વગેરે દ્વારા મેળવી શકાય છે. આ નાંખેલા ગુણકારિતા વગેરે સંસ્કારોમાં ઉપાદેયતાની લાગણી પણ ભેગી જ હોય છે અને તેથી સ્મૃતિ આવતાં ઉપાદેયતાની લાગણી પણ વક્ત થાય છે.

કેટલીકવાર વસ્તુ સારી-લાભકારી હોય પણ પોતાની અપેક્ષાએ તે અનુપયોગી હોય ત્યારે એની લાગણીમાં ઉપાદેયતાની લાગણી સાથે હાલ મારી પરિસ્થિતિમાં તે અનુપયોગી છે તે લાગણી હોય છે. જેમ મકાનના દાદર ચડવા ઉત્તરવામાં ઉપયોગી છે પણ માળ ઉપર રહેલાને જ્યાં સુધી તેને નીચે નથી ઉત્તરવું એટલા કાળ પૂરતા દાદર ઉપયોગી નથી, પરંતુ દાદર ઉપાદેય કહેવાય, હેય નહિ. ઉપાદેયપણાની દ્રષ્ટિ જેમાં હોય તેની સ્મૃતિમાં પણ ઉપાદેયપણાની સ્મૃતિ થાય છે.

**જ્ઞેયતત્ત્વ :-** ગ્રીજા નંબરની લાગણી છે જ્ઞેયની. જેમાં

ઉપાદેયતાની લાગણી છે તેમાં જ્ઞેયપણાની લાગણી હોવા છતાં ઉપાદેયપણાની પ્રધાનતા આવે છે, માટે તેને જ્ઞેયની લાગણી ન કહેતાં ઉપાદેયપણાની લાગણી કહેવાય. પરંતુ જ્યાં હેય કે ઉપાદેયપણું બેમાંથી એકે ન હોય, બેમાંથી એકેની લાગણીનો વિષય ન હોય તાં ફક્ત હેયપણાની લાગણી હોય છે. અજ્ઞેયપણાની લાગણી સામાન્યથી જીવને ક્યાંય ન હોય. અનુપયોગી-અપયોજનવાળા-અભાધક તત્ત્વો, વસ્તુ, વ્યક્તિ વગેરેમાં જ્ઞેયપણાનો ભાવ હોય છે. તે વસ્તુની સ્મૃતિમાં પણ ફક્ત જ્ઞેયપણું ઉપસ્થિત થાય છે. રાગની લાગણીથી ઉપાદેયપણાની લાગણી જન્મે છે જ્યારે દ્રેષ્ણની લાગણીથી હેયપણાની લાગણી જન્મે છે.

પ્રભુ, પ્રભુનું શાસન, ઉપાસ્ય તત્ત્વો, આચારો, ક્રિયાવિધિ વગેરે બધોમાં જો હૃદયમાં ઉપાદેયપણાની લાગણી હોય તો તેના સ્મરણમાં પણ ઉપાદેયપણાનો ભાવ આવે, પણ જો તેમાં હેયપણાની લાગણી હોય તો સ્મરણમાં પણ હેયપણાની લાગણી ઉપસ્થિત થાય. જો ઉપાસ્ય તત્ત્વોમાં લાભ-નુકશાનથી પર ઉપેક્ષા-માધ્યસ્થ જેવી અવસ્થા હોય તો તેના સ્મરણ વખતે પણ જીવને મધ્યસ્થપણાની લાગણી થાય છે. જેમ જૈન સાધુને રસ્તામાં જૈનેતર મંદિર આવે તો તિરસ્કાર ભાવ નથી, ફક્ત જ્ઞેયભાવ છે. તેને આનંદ કે શોકની લાગણી થતી નથી. આ રીતે આપણા સ્મરણમાત્રમાં ત્રણ લાગણી ભળેલી છે જે આપણા સંસ્કારરૂપ છે. તેથી સમ્યક્તવના સ્વરૂપમાં ઉપાદેય તત્ત્વોમાં ઉપાદેયપણાની સંસ્કારરૂપ લાગણી જોઈએ અને હેય તત્ત્વોમાં હેયપણાની લાગણી સંસ્કારરૂપ જોઈએ અને તે સિવાયમાં જ્ઞેયપણાની લાગણી જોઈએ.

ઉપાદેય તત્ત્વોના સ્મરણ વખતે ઉપાદેયપણાની લાગણી

એ ઉપાદેયતત્ત્વોની પ્રથમ ભૂમિની ઉપાસના છે. આવનાર વ્યક્તિને આવકારવી તે અનું પ્રથમ સ્વાગતગૌરવ છે, એજ રીતે હેય તત્ત્વોના સ્મરણમાં હેયપણાની લાગણી એ પણ રૂપાંતરે ઉપાસ્ય તત્ત્વોની ઉપાસના છે, જેટલા આશ્રવના સ્થાનો છે તેટલા જ સંવરના સ્થાનો છે, માટે હેયતત્ત્વની શ્રદ્ધા તે તેના પ્રતિપક્ષમાં ઉપાદેયતવની શ્રદ્ધા છે. અને ઉપાદેયતવની શ્રદ્ધા તે તેના પ્રતિપક્ષમાં હેયત્વની શ્રદ્ધાયુક્ત છે. આ સ્મરણ એ શ્રદ્ધાનું જ બીજું રૂપક છે.

આશ્રવના સ્થાનોમાં હેયત્વ બુધ્ધિ એ સમ્યકૃતવના સંવરસ્થાનો છે અને સંવરના સ્થાનોમાં ઉપાદેયત્વ બુધ્ધિ એ પણ સમ્યકૃતવના સંવરસ્થાનો છે. આ રીતે બત્તે સંવર થયા, આશ્રવ સંવર રૂપ થયો. સંવર તો સંવર છે જ. એવી જ રીતે આથી વિપરીત થાય તો સંવર પણ આશ્રવ અને આશ્રવ પણ આશ્રવ બને છે, માટે મિથ્યાત્વીને સંવરના ભેદો નથી. અને સ્વરૂપ સંવર છિતાં અનુબંધ આશ્રવ છે. જ્યારે સમકિતીને એકે આશ્રવ અનુબંધ આશ્રવ નથી, પરંતુ સમ્યકૃતવના ગળહળતા પ્રભાવથી અનુબંધ સંવર છે. આ રીતે પ્રભુ-પ્રભુશાસનનું સ્મરણ એ સમ્યકૃતરૂપ અને દૃઢતર સમ્યકૃતવનું કારણ છે.

શરણ એટલે આશ્રય કરવો, આશરો લેવો. જે કાર્ય કરવા પોતે સમર્થ ન હોય અને તે કાર્ય કરવું હોય તો માણસ તે કાર્ય કરાવી આપવા સમર્થના આશ્રયે જાય છે. તેવી જ રીતે હેયતત્વ માનવા છિતાં, સમજવા છિતાં જીવ જ્યારે જેટલા અંશો છોડવા સમર્થ ન હોય તો એ છોડેલાના શરણો-આશ્રયે જાય છે. જેની પાસે જે શક્તિ પ્રકૃષ્ટ હોય અને આપણી પાસે તે શક્તિ ન હોય અથવા અધૂરી હોય અને આપણાને તે શક્તિ જોઈતી હોય અથવા પૂર્ણ જોઈતી

હોય તો તે શક્તિવાળાનો આશ્રય કરવો અનિવાર્ય છે. આ જ નિયમ અનુસાર સમકિતી આત્મા હેય-ઉપાદેયને સમજે છે અને દૃઢ માને છે, પરંતુ તે રીતે વર્તવા સમર્થ નથી. જે કોઈ વર્તે છે તે પણ સંપૂર્ણપણે જ્યાં સુધી વર્તી શકતા નથી ત્યાં સુધી એ સંપૂર્ણ વર્તનમાં આત્માને સમર્થ બનાવવા આ શરણ અનિવાર્ય છે.

શરણ એટલે આપણું અસામર્થ અને શરણ જેમનું સ્વીકારીએ છીએ તેનું પૂર્ણ સામર્થ્ય. સંસારી જીવો શક્તિ અને આત્મગુણાના બધા જ ક્ષેત્રમાં અસમર્થ અને અસંપૂર્ણ છે જ્યારે પરમાત્મા અને પરમાત્માનું શાસન આ બને બાબતમાં કાયમ માટે પૂર્ણ અને પરાકાશાએ છે, માટે એમના શરણથી આપણા અંતરાયો તુટે છે, પુષ્યશક્તિઓ અને આત્મશક્તિઓ પ્રગટ થાય છે અને આપણો બાધ્ય અને અભ્યંતર રીતે પૂર્ણ બનીએ છીએ. માટે જે કાર્ય સિદ્ધ કરવું હોય તે કાર્યથી સંપત્તનું શરણ લેવું તે ન્યાયથી પરમાત્મા અને પરમાત્માના શાસનનું શરણ સ્વીકારવું. પ્રભુના શરણથી સર્વ ગુણો સર્વ શક્તિઓ સિદ્ધ થાય છે. આપાતની પ્રાપ્તિ માટે જેમ અસમર્થ સમર્થનું શરણ લે છે, તેમ પ્રાપ્તનું રક્ષણ કરવા પણ અસમર્થ સમર્થનું શરણ લે છે અને પૂર્વ કથન અનુસાર નવી શક્તિઓ અને ગુણો મળે છે. માટે યોગ અને ક્ષેમ કરવા માટે શરણ લેવાનું છે. બને વાતમાં છચ્છા હોય પણ સામર્થ્ય ન હોય તે આત્મા શરણ ભાવથી-ઉત્કંઠિતાથી અત્યંત તન્ય બનીને શરણ લે એટલે કે ભાવથી સેવક આજાંકિત બને. શરણથી સામર્થ્ય મળે છે, પૂર્ણ થવાય છે. શરણ લેવાથી ૧) આપત્તિઓ જતી રહે છે. ૨) આપત્તિમાં રક્ષણ મળે છે. ૩) આપત્તિઓ આવતી નથી. ૪) શક્તિ અને ગુણોની છચ્છા તીવ્ર થાય છે. ૫) શક્તિ અને ગુણો આપનારનો સંયોગ થાય છે. ૬) શક્તિ અને

ગુણોનો પાદુભર્વિ થાય છે. ૭) ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ થાય છે અને ગુણો પરાકાશાના થઇને ક્ષાયિકભાવરૂપ બને છે. આ જગતમાં ગુણોની ઈચ્છા થાય ત્યારથી ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓનો પાદુભર્વિ થાય છે. રક્ષણ અને વૃદ્ધિ પણ ઈચ્છાસહિત ગુણાના પ્રયત્નથી થાય છે. સર્વગુણોના સ્થાનરૂપ વ્યક્તિ કે સ્થાનનું શરણ લેવાથી ગુણોનો પ્રયત્ન દૃઢ થાય છે. અધૂરા માણસો શરણ ન સ્વીકારે તો એ ગર્વનું પરિણામ છે, બીજાના અનાદરનું પરિણામ છે, પોતાની અપૂર્ણતાનું અજ્ઞાનરૂપ છે. તેને સર્વાશની પૂર્ણતા જોઈતી નથી અથવા તેને સર્વાશની પૂર્ણતાની મહત્તમ નથી, માટે પૂર્ણની મહત્તમ સ્વીકારતો નથી. બીજુ અપૂર્ણના શરણથી કાર્યસિદ્ધિ નથી, એ એક સામાન્ય વાત હોવા છતાં, જેઓ પૂર્ણના શરણ છે તેવા અપૂર્ણનું શરણ પણ કાર્યસિદ્ધિ કરે છે. માટે પોતાની હેય સ્થિતિના જ્ઞાનવાળા અને તેના ત્યાગની ઈચ્છાવાળા અને ઉપાદેય સ્થિતિને મેળવવાની ઈચ્છાવાળા, સ્મરણવાળા જીવો પરમાત્મા વગેરેને હેય રહિત થયેલા અને ઉપાદેય સંપત્ત થયેલા જાણી શકે છે, જોઈ શકે છે અને એથી પરમાત્માનું એટલે કે અરિહંત અને સિદ્ધનું તથા અપૂર્ણ હોવા છતાં પૂર્ણના શરણ રહેલા સાધુઓનું, પૂર્ણથી ભાગિત ભર્યાદા તત્ત્વોરૂપ ધર્મને શરણ તરીકે ઓળખી શરણ લે છે. જે જીવો શરણને ઓળખે તે પોતાને અશરણ તરીકે ઓળખે છે. જે પોતાને અશરણ તરીકે ઓળખે છે, તે પરમાત્માને શરણ્ય તરીકે ઓળખે છે. પોતાની અને પરમાત્માની કંઈક સાચી ઓળખ સ્મરણથી આવે છે અને તે પછી શરણ માપન થાય છે. સદ્ગુરૂઆચાર-તદ્ગુરુવિષયક જ્ઞાન-ભાવના-પ્રભુશાસન-પંચપરમેણી સંઘ-ઉપાસ્યતત્ત્વો-નવપદ-વીશસ્થાનક-ધર્મક્રિયાઓ-ઉપકરણો-ધર્મસ્થાનો વગેરે ઉપર જે હૃદયની મીતિ એ સ્થાનોની

અને એમાં પ્રવર્તનારની પ્રશંસા-એની ભક્તિ-સહાય-જાતે પ્રવર્તનની ઇચ્છા-તે માટે શક્ય પ્રયત્ન આ બધા દ્વારા હદ્યમાં જે આનંદ-આદરભાવ ઉત્પત્ત થાય તે આંશિક સમ્યકૃત્વ છે. તેના દ્વારા સંસ્કાર પડે છે. આ બનેમાં ઉપાદેય તરીકે, લાભકારક તરીકેની રૂચિ હોય છે અને તેથી સનિમિત્ત કે અનિમિત્ત સ્મૃતિ થતાં આનંદ થાય છે.

આત્માને આત્મિક ગુણોની, તેની નિર્ભલતાની પરાકાષ્ઠાની ઇચ્છા જન્મે, તીવ્ર બને અને ઉપરના તત્ત્વોની ઉપાસનાથી એ પ્રાપ્ત થશે એવું સમજાય ત્યારે જીવ એ તત્ત્વોના શરણો જાય છે. શરણ સ્વીકારે છે એટલે તે તે કાર્યમાં એમને અનુકૂળ વર્તે છે. એમની ઇચ્છા મુજબ, કખા મુજબ કરવાનું કરે છે.

આ શરણગુણાની અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે અને જે શક્તિ ગુણ છે તે નાશ ન પામે તે માટે, તેના રક્ષણ માટે આવે છે. માટે ક્ષાયિકભાવ અને પૂર્ણભાવ ન આવે ત્યાં સુધી આની જરૂર છે.

ક્ષાયિકભાવ અને પૂર્ણભાવ બને સાથે આવે છે પણ જ્યાં સુધી અસમર્થ અવસ્થા છે ત્યાં સુધી શરણભાવ મુખ્ય છે.

જ્યારે અસંપૂર્ણ અવસ્થા છતાં ગુણોની અને શક્તિની સમર્થ અવસ્થા આવે છે, સમજણ અને સત્ત્વ વિકસે છે ત્યારે સમપેણ આવે છે.

નબળા-ઉત્તરતા સ્થાન-શક્તિવાળા શરણાગત કહેવાય છે. વિશિષ્ટ સ્થાન-શક્તિવાળા જ્યારે સર્વોપરિને સર્વાંશે અનુકૂળ હોય ત્યારે એમને સમર્પિત કહેવાય છે.

સમર્પિત એટલે પોતાની બધી શક્તિ-ગુણો-સમજણ-પુણ્ય વગેરે પરમાત્મા, ગુરુઓ, વીશસ્થાનકને ભાવથી અર્પણ કરેલા જેવી સ્થિતિ હોય છે. પોતે મહાસમર્થ હોવા છતાં બધો પરમાત્મા વગેરેનો

પ્રભાવ છે, બધું એમનું છે, બધું એમના માટે છે એવો જે દૃદ્યનો ભાવ-લાગણી, પોતાની લઘુતા તેને સમર્પણ કહેવાય. સુર્વસ્વ દેવગુરુ પસાય-દેવગુરુનું છે આ વૃત્તિને સમર્પણ કહેવાય અર્થાત્ દૃદ્યમાં હું એમનો હું, મારું એમનું છે, મારા ઉપર સંપૂર્ણ અધિકાર-હક્ક એમનો છે, આવું જે દૃદ્યનું વલણ તે સમર્પણ છે. આના પરિણામે પૂજ્યની ઇચ્છા અને વચન મુજબ પોતાની સર્વશક્તિ-પ્રવૃત્તિ અને વલણ કરવા ભાવનાશીલ અને પ્રયત્નવંત હોય.

શરણમાં એ પૂજ્યનો આશરો સ્વીકારે પણ તેમના વચન મુજબ આચરે કે ન પણ આચરે. ન આચરે તેમાં પોતાની અશક્તિ-અસમર્થતા વિચારે.

શરણમાં તે-તે જરૂરી કાર્ય માટે તે-તે જરૂરી અંશમાં આશ્રિત થાય છે. વચન અનુષ્ઠાન વખતે સમર્પણ આવે છે. સમૃ એટલે સર્વથા સંપૂર્ણ અર્પણ-એમાં પૂર્ણ આચાર અને સામર્થ્ય હોય છે.

શરણમાં ઉપાસ્યની મહત્ત્વા સાથે પોતાના લાભ અને જરૂરિયાતની દર્શિ છે. અને સમર્પણમાં પોતાના દૃદ્યમાં ઉપાસ્ય એ જ સર્વસ્વ છે, પોતાના માટેની કોઈ ઇચ્છા કે દર્શિ નથી. આથી વ્યક્તિભેદ હોવા છતાં બુદ્ધિ-વિચારણામાં અભેદની ગંભીરા છે. જેને ઉપાસ્ય ઊંચા જણાય અને પોતે પણ એવો થવા ઇચ્છે તે સર્વ રીતે સમર્પણ કરે, જેને પોતાની જુદા તરીકેની પણ ઇચ્છા નથી તે અભેદની ઇચ્છાથી જે પ્રયત્ન કરે તે સમર્પણ માટે અભેદ અપેક્ષાથી જે સમર્પણ આવે છે તે સમાપ્તિ = એકતામાં પરિણામે છે. સમાપ્તિ એટલે સિદ્ધસ્વરૂપી પરમાત્મા અને આપણાં આત્માની એકતા, પરમાત્મા સાથે આત્માની એકતા. આ આંશિકપણો અસંગ અનુષ્ઠાનમાં આવે છે. મુખ્ય સમાપ્તિ વીતરાગને આવે છે, કેવળજ્ઞાનીને હોય છે.

# કરણ કરાવણ નો અનુમોદન

## સરિખા ફળ નિપાયા

પ્રભુશાસન મણ્યા વગર-સમજ્યા વગર જીવનો ઉદ્ધાર નથી. લોકમાં કહેવાય છે “કરે તે પામે, કરે તેવું પામે.” પરંતુ ભગવાનના શાસનમાં “ઇચ્છે તે પામે”

શુભ કાર્યમાં જે ધર્મમાં કાર્યની ઇચ્છા કરીએ તો તેનાથી ધર્મ-પુષ્ટ બન્ને મળે છે, ક્યારેક તાત્કાલિક તો ક્યારેક ભવાંતરમાં.

ધર્મ ઇચ્છનારને ધર્મ મળે, તપ ઇચ્છનારને તપ મળે, સંયમ ઇચ્છનારને સંયમ મળે, દેવ ઇચ્છનારને દેવ મળે, સદ્ગુરુની ઇચ્છાવાળાને સદ્ગુરુ મળે. આજ રીતે શુભકાર્યમાં બીજાને સહાય કરીએ, પ્રેરણા કરીએ, પ્રોત્સાહિત કરીએ તો તે દ્વારા આપણી ઇચ્છા પણ તેમાં રહેલી જ છે, માટે કરાવણ દ્વારા પણ આપણને તે વસ્તુ વ્યક્તિ વગેરે મળે, ધર્મક્ષિયા મળે, ધર્મ આરાધના મળે અને પુષ્ટ પણ મળે. આ બને ધર્મકરણ કરતાં અપેક્ષાએ સહેલા છે. માટે સ્વચ્છુપમાં, આજુભાજુમાં અને સર્વની થતી દાનાદિ આરાધના, જ્ઞાનાદિ આરાધનાની અનુમોદના તે કરી શકે છે કે જેને તે કરવાની ઇચ્છા છે, કરાવે છે અને કરે છે એવી જ રીતે પોતે ન કરી શકતો હોવા છતાં, ઇચ્છાવાળો કરાવણ અને અનુમોદના કરે છે. અને તેવા સંયોગ-શક્તિના અભાવમાં, બીજાને કરાવવામાં સહાયક ન થઈ શકવા છતાં પોતાની પ્રબળ ઇચ્છાના કારણો, તે વ્યક્તિ

અનુમોદના કરીને પણ વિશેષ ધર્મ અને પુણ્ય મેળવે છે. જે ફક્ત કરે છે તેનો ધર્મ અતિ અલ્યુ છે. જે કરે છે અને કરાવે છે, તેનો ધર્મ પૂર્વ કરતા અનેકગુણો છે. જે કરે છે, કરાવે છે અને અનુમોદના પણ કરે છે તેનો ધર્મ પૂર્વના બજે કરતા અનેકાનેકગુણો થાય છે.

જે શક્તિ અને સંયોગના અભાવમાં ન કરી શકતો હોવા છતાં, ઈચ્છાની તીવ્રતાના કારણો કરાવણ અને અનુમોદન કરે છે, તે પણ કાલાંતરે પ્રકૃષ્ટપણાને પામે છે, કરણ પણ પામે છે.

જે તેવા કર્માના ઉદ્યથી પ્રમાદ-આળસના કારણો કરતો નથી, તે પણ ઈચ્છાને પ્રબળ કરવા માટે જો કરાવણ અને અનુમોદન કરે તો તેનાથી તેના અંતરાય તુટે અને ઈચ્છાની તીવ્રતા પામે. કરણ અંતરાયો ખસે અને કરતો પણ થાય.

જેને જે સાધના કરવામાં સંયોગ-શક્તિની ખામી હોય અથવા ઉત્સાહની ખામી હોય, તે જીવો તે સાધનામાં બીજાને સહાયક, ઉપબૂધક, પ્રશંસક અને અનુમોદન કરનાર બને, તે રીતે પ્રયત્ન કરે તો તેને સાધનાનું મોટા ભાગનું ફળ મળે છે અને ટુંકા ગાળામાં પોતે પણ કરવાનું સામર્થ્ય આ ભવે કે ભવાંતરે પામે છે.

જે કરવામાં ઉદ્ઘત છે પણ કરાવવામાં રસ વગરનો છે તેનું કરણ દ્વારા જેવું અપ્રધાન છે. જે કરવામાં ઉદ્ઘત છે અથવા નથી પરંતુ જે કરાવવામાં ઉદ્ઘત છે પરંતુ અનુમોદનામાં રસ નથી તેનું કરાવણ પરોપદેશો પાંડિત્ય જેવું છે અથવા કરણ-કરાવણ એ પણ માનપ્રધાન છે. આરાધનાપ્રધાન નથી. માટે બીજાની આરાધનાની અનુમોદના જીવનમાં સૌ પ્રથમ જરૂરી છે. જે ગુણાનુરાગ રૂપે સમજવી.

અશુભ પાપ કાર્યમાં કરણથી પાપ લાગે, કરાવણથી પાપ લાગે, તેનાં કરતાં પણ અનુમોદનાથી અથવા કરણ-કરાવણમાં પણ

રસની તીવ્રતાથી પાપની તીવ્રતા થાય છે, જેથી પાપનું ફળ મળે છે,  
અંતરાય બંધાય છે, પાપ કરવાની બુદ્ધિ મળે છે. પાપ કરવાની  
સાધન-સામગ્રી નથી મળતી, છતાં પાપ લાગે છે.

જેને જેનો રસ તે વાત-વસ્તુ બીજે હોય તો પણ સામાન્યથી ગમે, તેથી પાપી આત્માઓને સર્વત્ર પ્રવર્તતું પાપ ગમે છે. પાપના પક્ષપાતી આત્માઓને જગતના તમામ પાપીઓના પાપની અનુમોદના વ્યક્ત કે અભ્યક્ત રહેલી હોય છે. તેવી રીતે ધર્માધર્મના રસવાળા ધર્મના પક્ષપાતી આત્માઓમાં જગતના તમામ ગુણી, ધર્માધર્મની, ગુણધર્મની અનુમોદના સામાન્યથી રહેલી હોય છે અને તે નિભિત મળે વ્યક્ત થાય છે. વ્યક્ત અને વારંવાર ધર્માધર્મની અનુમોદના દ્વારા, અનુમોદનાના સંસ્કાર દ્વારા સાહજીક અભ્યક્ત અનુમોદના થાય છે અને આ જ ધર્મપક્ષપાતીનું એક મહત્વનું સ્વરૂપ છે. માટે પાપીના પાપની અનુમોદના કરવી નહીં. તે રીતે ધર્માધર્મની અનુમોદના કર્યા વિના રહેવું નહીં.



# દુઃખ મળે પાપથી, પુણ્ય મળે ધર્મથી

- (૧) જીવ પાપને દુઃખના કારણરૂપ ઓળખે તો પાપને છોડે.
- (૨) પાપ છોડે તેમ દુઃખ ઓછા થાય.
- (૩) પુણ્યને સુખના કારણરૂપ સમજે તેમ જીવ પુણ્ય આચરે.
- (૪) પુણ્યના કારણને આચરે તેમ સુખની સામગ્રી અને સંયોગ મળે.
- (૫) સુખમાં પણ મન-વચન-કાયાથી પુણ્યના કારણો જીવ આચરતો જાય જેમ અત્યંત સુખી માણસો પણ વ્યાપાર કાળજીથી કરતા રહે છે.
- (૬) ધર્મકિયા-ધર્મસ્થાન-ધાર્મિક વ્યક્તિ, ભાવનાઓ, જીવદ્યા, પાપ-અરુચિ, પાપ-નિવૃત્તિ, સહનશીલતા, સ્વસ્થતા, પ્રસન્નતા, ગંભીરતા વગેરે ગુણોને, કિયાઓને, વ્યક્તિઓને, વસ્તુઓને અનુકૂળ વર્તતો રહે, એની યથોચિત ઉપાસના પુણ્ય માટે કરતો રહે.
- (૭) આટલી ભૂમિકા બાદ ભૌતિક સુખમાં રાગ-મમતા એ પાપનું-  
દુઃખનું કારણ છે તે સમજવાની શક્તિ-યોગ્યતા પ્રગટે છે.
- (૮) તેથી તે જીવ સુખમાં આંધળો ન થતાં સાવધ અને ઉદાસીન-  
બને છે.
- (૯) આ પછી દુઃખમાં પણ અકળામણ એ આર્તધ્યાન છે,

અસહિષ્ણુતા એ પાપને વધારે છે અને તે દુઃખનું કારણ છે  
તેમ સમજી એ સહનશીલતા કેળવે છે.

(૧૦) આ ભૂમિકા બાદ જીવ ભૌતિક સુખમાં રાગાંધ ન થતાં એ  
પોતાના મૂળ સ્વરૂપને સમતાને જીવે છે, અનુભવે છે, કેળવે  
છે અને આત્મસ્વરૂપને સમજવા પ્રયત્ન કરે છે.

(૧૧) એજ રીતે દુઃખમાં પણ આ આગંતુક પરિસ્થિતિકૃત આત્માની  
અવસ્થાને જોઈ પોતાના નિરંજન, નિરાકાર સ્વરૂપને યાદ  
કરતો દુઃખમાં ઘૈરૂ કેળવે છે.

આ ભૂમિકા બાદ જીવ સર્વગ આત્મદૃષ્ટિવાળો,  
ભાવધર્મવાળો બને છે. એનો સાંસારિક-ભૌતિક વ્યવહાર પણ ભાવ-  
સંસાર ન બનતા દ્રવ્યસંસાર હોય છે અને તે દુર્ગતિ કે વિશિષ્ટ  
પાપબંધનું કારણ નથી બનતો.

શુભ પ્રવૃત્તિ-વાણી અને વિચાર એ ભાવધર્મરૂપ છે અને  
મોકાનું કારણ છે.

આ ભૂમિકાને અવિરત સમકાળીની ભૂમિકા અને એની  
ઉપરની ભૂમિકા સમજવી.

ઉપરની ૧૦ ભૂમિકા એ ભાવસમક્કિત-ભાવધર્મનું કારણ  
છે. માટે જીવ દરેક પ્રવૃત્તિ, વાણી અને વિચારમાંથી પાપબંધના  
કારણો સમજીને છોડતો જાય, જેથી ભવિષ્યમાં દુઃખી ન થાય અને  
દરેક પ્રવૃત્તિમાં પુણ્યબંધના કારણોને જાણીને જીવ આચરતો જાય.  
એટલે કે પોતાના વાણી, વિચાર અને વર્તન પુણ્યના કારણ બને તે  
લક્ષ રાખે તો સુખી થાય અને કાળકમે આંતરિક દ્રષ્ટિ ખુલવાની  
યોગ્યતા પ્રગટે અને ૧૦-૧૧ નંબરની ભૂમિકામાં ભાવધર્મની  
પરિસ્થિતિમાં જીવ આવે.

## જ્ઞાન તે સકળ આધ્યાર

જીવનની અંદર જ્યાં સુધી દોષોનો નિર્ણય ન થાય, તે ખટકે નહીં, તે ગ્રાસદાયી ન લાગે ત્યાં લગી તે જાય નહીં. દોષોની ઓળખાણ-જાણકારી પ્રથમ મેળવવી પડે. અજ્ઞાનનો નિર્ણય થાય, તે ખૂંચે તો જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે.

પહેલા આવી આવી પ્રવૃત્તિ, આ આ માન્યતા દોષ છે તે જાણવું પડે. પ્રવૃત્તિના ગુણ-દોષ જાણ્યા વિના તેને ગ્રહણ કરવાની કે છોડવાની હચ્છા થતી નથી. જે માણસ કાચના ટુકડાને હીરો જ સમજે તે તેને છોડી શકે નહીં યા તેની પાસેથી છોડી શકાવાય પણ નહીં. તેથી જ પ્રથમ જ્ઞાન અને પછી કિયા બતાવી 'પઢમં નાણ તઓ દયા'.

દોષો પણ અનેક પ્રકારના છે તે વૃત્તિરૂપ પણ હોય અને પ્રવૃત્તિરૂપ પણ હોય. માનસિક-વાચિક-કાયિક ત્રણો પ્રકારના હોય. આપણો જેને ગુણરૂપ માનતા હોઈએ તે વાસ્તવમાં દોષરૂપ પણ હોય તેથી પહેલા તેને-તેના ભેદોને જાણવા જોઈએ.

**પ્રશ્ન :-** આપણા દોષો જોવાના કે દોષ કદ રીતે જોવાય તે જાણવાના ? પહેલાં શું કરવું પડે ?

**ઉત્તર :-** પૈસા ગણતા જ ન આવડે તે પોતાના પણ પૈસા શી રીતે ગણી શકે, તેમ દોષ કોને કહેવાય એ જેને ખબર નથી એ પોતાના દોષ કેમ જોઈ શકે ? કાઢી શકે ?

જેમ દોષનું જ્ઞાન જરૂરી છે તેમ તેને છોડવાની ઈચ્છા પણ જોઈએ. જેને છોડવાની ઈચ્છા ન થાય તેનું જ્ઞાન પોપટીયો પાઠ કહેવાય. વસ્તુ ખોટી લાગ્યા પછી માણસને છોડવાની ઈચ્છા થાય જ. દરિદ્ર માણસને દરિદ્રપણાનો દોષ દેખાય એટલે તેનાથી છૂટવા-લક્ષ્મી મેળવવા પ્રયત્ન કરે, રોગી માણસને રોગનું જ્ઞાન-નિદાન થાય એટલે તેને દૂર કરવા, આરોગ્ય મેળવવા તત્પર બને.

જ્ઞાન-દોષોની જાણકારી દોષી-નિર્દોષી બને આત્માએ મેળવવાની છે. દોષી તેની ભયંકરતા જાણો તો તેને દૂર કરી શકે અને નિર્દોષ તે દોષો પોતાનામાં ન આવે તેની સાવધાની રાખી શકે. તમાંકુ ખાનાર જો તેની નુકશાની જાણો તો તે છોડી શકે અને ન ખાનાર જાણો તો તેનાથી દૂર રહી શકે.

જ્ઞાન થયા પછી તેને છોડવાની ઈચ્છા થવી જોઈએ.

પ્રશ્ન :- દોષોએ આપણાને પકડ્યા છે કે આપણો દોષોને ?

ઉત્તર :- દોષો આપણાને પકડી શકે નહીં. આપણો દોષોને પકડ્યા છે. બીજો આપણાને પકડે ત્યારે તેનાથી છૂટવું આપણા હાથમાં નથી. જ્યારે આપણો બીજાને પકડ્યો હોય ત્યારે છોડવો હોય તે વખતે છોડી દેવાય. આત્માનું બળ અનું છે કે આપણો છોડવા માંગીએ તો બધું છૂટી જાય. માખતુષ મુનિને અજ્ઞાનનો દોષ ૧૨ વર્ષે પણ ગયો.

આપણાને સારી વસ્તુના ગુણ દેખાય છે તેથી તેનો સ્વીકાર અમલ જલ્દી કરીએ છીએ પરંતુ ખરાબના દોષ દેખાતા નથી તેથી ત્રૈને છોડી શકતા નથી. તપણનો ગુણ દેખાય છે પણ ખાવામાં દોષ દેખાય ? ભાવતી વસ્તુ ત્યાગ ન હોય તો પણ ભાણા પર ત્યાગ કરનાર કેટલા ?

છોડવાની ઈચ્છા થયા બાદ તેનો નિર્ણય કરવો પડે અર્થાત્ દોષોને મારે છોડવા જ છે તેવો દૃઢ નિશ્ચય-સંકલ્પ કરવો પડે. દુકાન

માંડ્યા પછી કમાવાનો નિશ્ચય ન કરે તો શું કામનું ? જ્યાં સુધી મજબૂત નિર્ણય ન હોય ત્યાં સુધી તેને કાઢવાની પ્રવૃત્તિ બરોબર જામતી નથી. ‘મારે ધન જોઈએ જ છે’ આ નિર્ણય સાથે વેપાર કરનાર જ તેમાં વ્યવસ્થિત પ્રવૃત્ત થઇ શકે છે.

**નિર્ણય-નિશ્ચય પણ સાર્થક-સફળ-ફળદાયી ત્યારે બને** જ્યારે તેના વિરુદ્ધની પ્રવૃત્તિનો ત્યાગ હોય અને તેને પોષકપ્રવૃત્તિ ચાલુ હોય. અર્થાત્ દોષો કાઢવા જ છે. આવી ભાવનાવાળાએ તે જેનાથી વધતા હોય, ટકતા હોય તેવી પ્રવૃત્તિ વિ.ને છોડવા પડે અને પોતાની ભાવનાને બળ મળે-પોષણ મળે તેવી કિયા વિ. ને આચરતા રહેવું પડે.

જેને વાતોની ટેવ ન પાડવી હોય તેણે ટૂંકે પતે તેમ પતાવવું, પછી લાઇન કટ કરવી. તેમ જેને દોષો કાઢવા હોય તેણે અશક્ય પરિહાર કે નબળાછથી પ્રવર્તિતું પડે તો વારંવાર Linecut કરતા જવાનું. વારંવાર લાઇન જોડીએ તો પ્રણિધાન કાચું. **તપના પારણામાં** બીજો તપ કરવાની ગણતરી ન આવે તો પ્રણિધાન કાચું કહેવાય.

દોષ કાઢવા તેની નોંધ કરો. થોડા ઘણા મોટા દોષોની નોંધ મનમાં રહે પરંતુ નાના દોષોની નોંધ ખરી ? પ્રથમ નાના દોષો કાઢવાના કે મોટા મોટા ?

પહેલા નાના દોષો કાઢવાના-તેમાં પ્રયત્ન કરવાનો. મોટા તો બળ આવશે એટલે નિકળવાના જ છે.

**પ્રશ્ન :- સંસારી અને ધર્મી આત્મામાં ફરક શું ?**

**ઉત્તર :-** દોષો છોડવાની તીવ્ર છચ્છા અને ગુણો મેળવવાની અતિ જંખના જેનામાં હોય તેનું નામ ધર્મી અને ગતાનુગતિક ચાલે તે સંસારી. રાત્રે તાવ આવે ને તરત દવા લે તે સંસારી. થોડું સહન કરે તે ધર્મી. જ્ઞાન-છચ્છા-નિર્ણય-વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ આ કમથી જો આગળ વધીએ તો અચુક દોષવિમુક્તિ અને ગુણાની પ્રાપ્તિ થાય.

# ભગવાન ! કર્મ નાઈ, સંરક્ષાર

આપણા આત્મામાં અનાદિકાલીન સંસ્કારો રહેલા છે. કર્મ વધારેમાં વધારે ૭૦ કોડાકોડી સાગરોપમથી વધારે રહી શકતું નથી પરંતુ આ સંસ્કારો અનાદિ અનંતના ભાંગે રહેલા છે. માટે ખરાબ સંસ્કાર ન પડે તેની પૂર્ણ તકેદારી રાખવાની છે.

આપણી હાલની કિયાઓ, તેમાં રહેલ ઉપયોગ અને આપણા સ્વભાવ વૃત્તિને ઘડનાર ભૂતકાલીન સંસ્કાર છે. જો અત્યારના કિયાદિ શુભ સારા હોય તો માનવું કે આત્મામાં શુભસંસ્કારોનું જોર છે અને કિયા વગેરે ખરાબ હોય તો અશુભસંસ્કારો મજબૂત જાણવા.

જ્યાં સંસ્કાર ન હોય ત્યાં કિયા અને ઉપયોગ પરાણો કરવા પડે છે. આપણી અશુભપ્રવૃત્તિ અને કિલણ અધ્યવસાયો અત્યારે પૂરજોશમાં ચાલી રહેલા છે તેના પરથી એ સૂચિત થાય છે કે આત્મામાં અશુભસંસ્કારોનો માલ થોકબંધ પડ્યો છે. અને ધર્મ-ગુણાના સંસ્કારો નથી અને તેથી જ સંસારમાં ભટકી રહ્યા છીએ.

હવે પરમાત્માનું શાસન પાય્યા પછી-સમજ્યા પછી દરેક આરાધના, અનુષ્ઠાનો કરવા દ્વારા આત્મામાં ધર્મના ગુણાના સંસ્કારો નાંખવાના છે. શરૂઆતમાં કિયા પરાણો કરવી પડે, ઉપયોગ પરાણો લાવવો પડે.

**પ્રશ્ન :- પરાણો કઇ વસ્તુ-કઇ કિયા હોય ?**

**ઉત્તર :- જેમાં આદર હોય, સામે ફળ દેખાતું હોય ત્યાં પરાણો પણ**

થાય. દરિદ્ર માણસ પરાણો પણ શ્રીમંતની નોકરી કરે છે કારણ સામે ફળ-ધનપ્રાપ્તિ દેખાય છે.

પરાણો કરેલી કિયા એ આગળ જતાં તેમાં આદર ઉભો કરે છે અને તેના દ્વારા આત્મામાં સંસ્કાર નંખાય છે. સંસ્કાર વગર કાંઈ કામ ન થાય. સંસ્કાર નાંખવા માટે આદર અને ઉપયોગ છે. અહીં સંસ્કાર આદરના પ્રતાપે નંખાય. કિયા જુદી અને આદર જુદો તો જેનો આદર હોય તેના સંસ્કાર નંખાય. સમકિતીને સંસારની પ્રવૃત્તિ કરવા છતાં અલ્યબંધ આના જ કારણો કલ્યો છે, તે ભવે પ્રવૃત્તિ સંસારની કરે પરંતુ તે આદર વગરની હોય છે. ખાલી પિસ્તોલ નુકશાન નથી કરતી જ્યારે તેમાં ગોળીઓ ભરાય ત્યારે જ તે નુકશાની કરે છે.

ઘણાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે તેમાં પૂર્વભવનું તે જ યાદ આવે જે તીવ્ર રાગથી કે તીવ્ર દેષથી ઉપયોગપૂર્વક કામ કર્યું હોય, જેના સંસ્કાર પડ્યા હોય. જ્યાં સંસ્કાર ન પડ્યા હોય ત્યાં તે યાદ આવે તો પણ લેવાનું મન ન થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વભવમાં વર્ષો સુધી ચારિત્ર પાણ્યું હોવા છતાં આ ભવમાં ભાઇમુનિની ઘણી શિખામણ છતાં સંયમ સ્વીકારવાના ભાવ ન જાગ્યા કારણ સંસ્કાર નહોતા પડ્યા.

આપણા જીવનમાં કિયા અને ઉપયોગ બને પરિમિત જ રહેવાના પરંતુ બને રાખતા જઈએ ન સુધારતા જઈએ તો અશુભ ઉપયોગ પરથી મન પાછું વળે, શુભ ઉપયોગ રહે, સંસ્કાર પડે.

જમતીવખતે તપસ્વીને યાદ કરો, નમસ્કાર કરો તો ખાવામાં નહીં પણ તપમાં ઉપયોગ જાય. તપ-તપસ્વી મનમાં ન આવે તો રસ-કસમાં ઉપયોગ જાય એટલે રાગના સંસ્કાર પડે.

દરેક જીવનવ્યવહારમાંથી અશુભ કિયાઓ અશુભ ઉપયોગ

કાઢવા મથવું જોઈએ. ત્યાગ પ્રત્યે આદર હોય તે ખાતી વખતે તપસ્વીને-ત્યાગીને-ત્યાગને યાદ કરે અને જાતનો પશ્ચાત્તાપ કરે. એ જો ન કરે તો તપના જૂના પણ સંસ્કાર ભૂલાઇ જાય, ઘસાઇ જાય. એક કલાક મૌન પાળ્યા પછી બોલતા જઈએ, છૂટથી વાતો કરીએ તો કયો આનંદ વધે ? કયો સંસ્કાર પડે ? કલાક પછી છૂટથી વાતો થાય તેનો અર્થ એ થયો કે મૌનમાં અકળામણ હતી તે પૂર્ણ થયો એટલે હાશકારો થયો. આમાં મૌન રાખવા છતાં તેના સંસ્કાર ન પડે.

કિયા ઉપયોગ દ્વારા આદર ઉભો કરવાનો છે અને એથી આગળ વધીને કહેવાય કે “આરાધનાના-મોક્ષ મેળવવાના-આગળ વધવાના અસંખ્ય યોગો છે. પરંતુ જીવનમાં બધાની આરાધના કરી શકવાના નથી, થઈ શકવાની નથી, આચરણમાં એક બે ગ્રણ જ યોગ આવવાના પરંતુ આદર તો દરેક પર જોઈશે. એ વ્યક્તતૃપમાં કે અવ્યક્તતૃપમાં ભલે હોય. આદરની બાબતમાં કોઈ અપવાદ નહીં. એક યોગ ઉપર પણ અનાદર હોય તો ન ચાલે. દૂધપાક ગમે તેટલો સારો બનાવ્યો હોય પરંતુ તેમાં થોડું મીહું નાંખવામાં આવે તો દૂધપાક ખાવાલાયક ન રહે. તેમ એક યોગ ઉપરનો અનાદર આરાધાતા બધા યોગને નિર્બંધ બનાવે છે.

મેતાર્થમુનિને આવેલ ગુરુ પરનો અનાદર એ છેક ચારિત્ર પરના અનાદરને લાવનાર બન્યો અને તેની સામે કુરગડુ મુનિને તપનો અંતરાય હતો કારણ ગર્વ કર્યો હતો પરંતુ તપ ઉપર અરૂચિ-અનાદર નહોતા તેના જ કારણો ખાવા ઉપર પશ્ચાત્તાપ હતો. જો અરૂચિ હોત તો કુરગડુની અવસ્થા મ્રાપ્ત ન થાત. ખાવા છતાં પશ્ચાત્તાપ ન હોત.

આપણા જીવનમાં કયા યોગ પ્રત્યે અરૂચિ / અણગામો છે

તેને જાણી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ તો જ આરાધાતો યોગ મોક્ષપ્રાપ્ત બને. કોઈ પણ સંધ-સાધુ-વક્તિ-સ્થાન પ્રત્યે હદ્દ્યમાં જો અરૂપિ રહી તો ગુણોના-આરાધનાના બધા દરવાજી બંધ થશે. કામરાગ / સ્નેહરાગની જેમ અરૂપિ / દેખ પણ આરાધકપણાને અટકાવે છે. તેથી પ્રથમ નંબરે બધા યોગો પર આદર લાવવાનો. બીજા નંબરે શક્ય અનુષ્ઠાનો આચરવાના. ત્રીજા નંબરે તે કિયાઓમાં ઉપયોગ રાખવાનો.

ઉપયોગ એ આપણાને આધીન વસ્તુ છે. કોઈને છદ્દ વક્તિ જોડે વાતો કરતા ઉપયોગ ન રહે તેવું દેખાતું નથી. આપણાને કિયામાં ઉપયોગ નથી રહેતો એનું મૂળ છે, આદર-પ્રયત્ન નથી. બીજી બાબતોમાં આદર છે તેથી ઉપયોગપૂર્વક થાય છે. બીજાના આદર જેટલા ઘટાડીએ તેટલો આમાં આદર આવે અને આદર-કિયા આવતા ઉપયોગ તો દોરડાની ભાફક બંધાયેલો રહે છે.

સંસ્કાર એટલે નિશ્ચય અને ઉપયોગ-આદરપૂર્વકની કિયા એ વ્યવહાર છે. વ્યવહારથી જ નિશ્ચય આવે તેથી કિયામાં ચુસ્તતા રાખવાની. પદ્ધતિસર વિધિપૂર્વક કિયા જેને ફળ જોઈતું હોય તે જ કરે. વ્યવહારમાં ક્યાંય પદ્ધતિ વગર ચાલતું નથી. પદ્ધતિવાળું કાર્ય જ ફળ આપે છે. પરંતુ આ વિધિ-પદ્ધતિને લાવનાર છે આદર. આદર વિનાની વિધિપૂર્વકની કિયા કદાચ બતાવવા પૂરતી હોય તોય તે જારી ટકે નહીં.

ઉપયોગને પકડીને સંસ્કાર નહિ પાડીએ તો ભવાંતરમાં ચારિત્ર ધર્મ નહીં મળે. ભગવાન મળશે તો વચન નહીં મળે-અસર નહીં કરે તેથી આદર સહિત ઉપયોગપૂર્વક આચારમાં પ્રવૃત્ત થવું.

# કક્ષા જીવોની તરતમતા ભાવોની

દુનિયામાં જેમ ચિત્ર-વિચિત્ર પદાર્થો જોવા મળે છે. તેની કવોલિટીના આધારે જેમ સારા-નરસા ભેદ પડે છે તેજ રીતે જગતમાં ભિત્ર ભિત્ર પ્રવૃત્તિ-સ્વભાવવાળી વ્યક્તિઓ દેખાતી હોય છે તેના આધારે જધન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ અધમ-મધ્યમ-ઉત્તમ વિભાગ થાય છે. માણસનો સ્વભાવ તેની પ્રવૃત્તિ પરથી જણાય છે અહીં જીવોની પ્રવૃત્તિઓના પાંચ વિભાગ પાડ્યા છે :-

(૧) વિશેષ વિચાર, રાગ-દેખની તીવ્રતા વગર અનુપયોગથી કે સાહજીક પ્રવૃત્તિ કરે, તે અનનુષ્ઠાન કે અલ્ય પાપવાળી પ્રવૃત્તિ કહેવાય.

(૨) ભૌતિક અનુકૂળતા, પ્રતિકૂળતાઓને ઉદેશીને કાખાયિક કે વૈષયિક પ્રવૃત્તિઓ જીવ કરે છે, જેને સંસાર કહેવાય છે. જેમાં આત્માનો કે પુણ્ય-પાપનો ઉદેશ નથી હોતો, પરંતુ યશ, સમાજમાં પ્રતિષ્ઠા વગેરે કે સાહજીક ફુલાચાર વગેરે આશય હોય છે. આવા જીવો સામાન્ય પુણ્ય બાંધે છે. બહુધા પાપ અને પાપાનુભંધી પાપ બાંધે છે. આ જીવોને પરલોકદ્રષ્ટિ નથી હોતી છતાં, તેઓમાંથી કેટલાક આલોક ન બગડે તે રીતે કામ કરે છે. આલોક સંભાળીને કામ કરનારની કેટલીક પ્રવૃત્તિઓ સાહજીક પરલોક સુધારે, સામાન્ય સુારી અવસ્થા પરલોકમાં મળે. દયા, કરુણા, સહાનુભૂતિ, સહાય, કલેશ ન કરવો, ગળી ખાવું વગેરે પુણ્ય કે ગુણાના ઉદેશથી ન હોવા છતાં

સામાન્ય પુષ્ય અને સદ્ગતિ આપે જ્યારે કેટલીક પ્રવૃત્તિઓ આ લોકમાં શાંતિ આપવા છતાં પરલોક બગાડે છે. જેમ કે ભોગ-રસિકતા, કુટુંબ વગેરેની મોહ-મમતા, મમતાથી ભોગનું વિતરણ વગેરે

જેને પરલોકની અપેક્ષા ન હોય અને પરલોક વિરુધ્ય મહાઆરંભ સમારંભ, તીવ્રરાગ-દ્વેષ, આર્ત-રૌદ્રધ્યાન વગેરેથી પ્રધાન પાપ બાંધે છે તેઓ દુર્ગતિમાં જાય છે. અને કેટલાક આલોકમાં પણ સંપ-શાંતિ વિનાના વિશેષ લંપટ, લાલચુ, સંગ્રહખોર, ખૂન વગેરેના વિચારવાળા, દારુ વગેરે બદાદતમાં ચઢેલા આ લોક અને પરલોક બજે બગાડે છે. તેઓ અધમાધમ કહેવાય છે. ઉપરના જીવો અધમ કહેવાય. આ બજે પુષ્ય-પાપની દ્રષ્ટિ વગરના પુદ્ગલાનંદી-ભવાભિનંદી જીવો છે.

પ્રથમ ભેદવાળા શક્તિ-સમજણાના અભાવે, તીવ્રકર્મના ઉદ્યથી કે તેવા કોઈ કારણો સંમૂચ્યે જેવા કે મંદ વિજ્ઞાનવાળા છે, માટે તીવ્ર પાપ-પુષ્ય ન હોવા છતાં, પરિણામ ન હોવા છતાં એ ભૌતિક પૌદ્ગલિક દ્રષ્ટિવાળા અધમ સમાન જાણવા.

(3) ગ્રીજા નંબરના જીવો સંસારની દ્રષ્ટિવાળા હોવા છતાં, તેઓ સુખદુઃખના કારણ તરીકે બાધ નિમિત્તો, પ્રવૃત્તિઓ, વસ્તુઓને માને છે તેમ દુઃખના કારણ તરીકે પાપકર્મને અને પાપકર્મના કારણ તરીકે પાપસ્થાનને પણ માને છે. તેવી રીતે સુખના કારણ તરીકે પુષ્યકર્મને માને છે અને પુષ્યકર્મના કારણ તરીકે પાપસ્થાનનો ત્યાગ, ઘટાડો, અરૂચિ, પશ્યાત્તાપ વગેરે પણ માને છે. તે જ રીતે પુષ્યના કારણ તરીકે અનુકૂપા, જીવદ્યા, સદાચયરણ, ગુણા સ્વીકાર વગેરે અને જે દાન, તપ, શીલ, ભાવના વગેરે ધર્મસ્થાનો છે તે અપ્રધાનરૂપે પુષ્યના સ્થાનો પણ છે જ, તેથી આ પુષ્યના સ્થાનોને માને છે. તેથી તેના જીવનમાં સાંસારિક બધી પ્રવૃત્તિ, વાણી, વિચારમાં

અને પ્રાસંગિક, સામાજિક કે ધાર્મિક બધી પ્રવૃત્તિ આદિમાં દુઃખની નિવૃત્તિ માટે પાપસ્થાનોથી નિવૃત્તિ-ઘટાડો લક્ષ્યમાં રાખવા શક્ય પ્રયત્ન કરે છે. સુખની પ્રાપ્તિ વળે માટે પુષ્યસ્થાનોમાં પ્રયત્ન કરે છે. પાપસ્થાનની નિવૃત્તિથી પણ પુષ્ય બંધાય છે.

આ દૃષ્ટિ કેળવવાના કારણો કંઈક પરલોકને સુધારવા માટે આલોકના જીવનબ્યવહારો વિશેષ પાપનિવૃત્તિપ્રધાન બનાવે છે અને પ્રાસંગિક અલ્યુપ્રયત્નસાધ્ય ધર્મની પ્રવૃત્તિઓ પુષ્ય માટે કરે છે. આ જીવને આલોક પ્રધાન છે, છતાં પરલોક પણ આંખ સામે છે. આ મધ્યમ કક્ષાના જીવો પુષ્ય માટે ધર્મકરણી કરે છે. આલોકના સુખદુઃખ પૂર્વકર્મના અનુસાર હોવા છતાં પરલોકને સુધારે છે અને આલોકમાં સુખી હોવા છતાં પાપમાં તરબોળ, મળન, અંધ બનતો નથી અને આલોકમાં દુઃખી હોય તો બીજાને ગાળો દેતો નથી, પણ સમતા, સહનશીલતા અને સદ્ભાવના કેળવે છે. આને મધ્યમ કક્ષાના જીવો કહેવાય છે.

આ જ ગીજા ભેદમાં જીવની પુષ્ય-પાપની અને તેના કારણોની વિશેષ દૃષ્ટિ અને રૂચિ ખુલે છે, ત્યારે જીવ આલોકની ગૌણતા કરીને પાપનિવૃત્તિપ્રધાન અને પુષ્ય-ધર્મપ્રવૃત્તિપ્રધાન વાણી-વિચાર-વર્તન સર્વત્ર કે બહુધા રાખનાર બને છે. આ રીતે પાપનિવૃત્તિની પ્રધાનતાથી, પુષ્યપ્રવૃત્તિની પ્રધાનતાથી તેનો આત્મા પાપકર્મથી હળવો થાય છે અને પુષ્યથી સંચિત થાય છે. આના પ્રતાપે તેને સંસારની ઉત્તમ વક્સુઓ-ઉત્તમ અવસ્થા-ઉત્તમ બ્રહ્મિતઓ મળે છે. પાપથી હળવો થવાથી પાપબુદ્ધિ પણ મંદ-શાંત પડે છે. પુષ્યકાર્યથી પુષ્યના કારણરૂપ ધર્મસ્થાનની રૂચિ-શ્રદ્ધા પણ થાય છે તેથી તે શાંત, પ્રસત્ત, વિષયની ઉત્કટતા વિનાનો, કષાયની પ્રધાનતા વિનાનો યુગલિક ક્ષેત્ર કે આનતાદિ દેવની જેમ સ્વાભાવિક

ઉગ્ર નથી હોતો.

(૪) આવા આત્માને બીજા ભવોમાં પણ પુષ્ય કરવાની રૂચિ અને પાપ છોડવાની રૂચિ સ્વાભાવિક રહે છે. આના પ્રતાપે અત્યંત પુષ્યની પ્રધાનતાથી સતત પાપ છોડવાની અને પુષ્ય કરવાની લાગણીના સંસ્કાર બાદ પુષ્યથી મળેલ ભૌતિક સામગ્રી એ પુષ્ય છે પરંતુ એમાં મમતા-આસક્રિત-ખેંચાણાની લાગણી એ પાપ છે એવું અને હવે સમજાય છે અને તે સમજતા પુષ્યના ભોગવટાની લાગણીરૂપ પાપ છોડવા તત્પર બને છે. આ જ પ્રકૃષ્ટ પુષ્યના યોગે ઉત્તમ જ્ઞાની પ્રભાવક વચનલબ્ધિવાળા મહાપુરુષોનો યોગ થાય છે અને પોતાના વિષયક ખાયને છોડવાપૂર્વકના પુષ્યની ઉત્કૃષ્ટ રૂચિ ઉત્પત્ત થાય છે અને તેના કારણો આત્મસ્વરૂપ ઉપર દ્રષ્ટિ લઇ જાય છે, આત્મસ્વરૂપની ઇચ્છા ઉભી થાય છે અને તેની સાથે પાપસ્થાન નિવૃત્તિ કરવી, ઘટાડવા, અરૂચિ રાખવી, પશ્યાત્તાપ કરવો વગેરે જે અત્યાર સુધી પુષ્યરૂપ હતા, તે હવે આત્માના શુદ્ધ સ્વરૂપને મેળવવાના કારણરૂપ ધર્મરૂપ બને છે અને પુષ્યના વિશેષ કારણરૂપ ધર્મસ્થાનોની વાણી-વર્તન-વિચાર ભાવના દ્વારા જે પ્રવૃત્તિ થાય છે, તે હવે પુષ્ય ઉપાર્જન સાથે આત્મગુણો મેળવવા આત્મ-શુદ્ધિ માટે કરાતી થાય છે, તેથી તે પણ વિશેષ ધર્મરૂપ થાય છે. આ શુદ્ધ આત્મદ્રષ્ટિ જાગે ત્યારે જીવ ચોથી ભૂમિકામાં આવે છે. એની સાંસારિક બધી પ્રવૃત્તિ આત્મદ્રષ્ટિ જાગી હોવાથી બીજા જીવો કરતાં જુદી તરવરે છે, ઔચિત્ય-વિવેકપ્રધાન રસ વગરની જેમ ધાર્મભાતા બાળ ખેલાવે તેવી થાય છે અને ધર્મની પ્રવૃત્તિ ન થાય કે ન કરી શકે ત્યારે પણ શુદ્ધ આત્મદ્રષ્ટિ જાગેલાની લાગણી, ભાવ સદા ઝણકતો હોય છે. વળી તે ભાવધર્મરૂપ આત્મગુણોના ઉદેશરૂપ હોય છે અને તેની પ્રવૃત્તિઓ પણ ધર્મપ્રધાન રહે છે. તેથી પુષ્યનો ઉદેશ ન હોય તો

પણ વિશિષ્ટ પુણ્ય સાહજિક મળે છે. પાપ નહિંવતુ અને નિર્બળ થાય છે. આ દ્રષ્ટિવાળા જીવો ઉત્તમ કહેવાય છે. અહીં શરૂઆતમાં આત્મદ્રષ્ટિ ન ખસે તેની કાળજી રાખવી પડે પરંતુ કાળજીમે તે શુદ્ધ આત્મદ્રષ્ટિ સ્વાભાવિક થાય છે અને કભિક આગળ વધતાં કેવળજ્ઞાન પામે છે. આ દશામાં નિશ્ચયધર્મ-ભાવધર્મ સહજ હોય છે. વ્યવહારધર્મ પણ સંયોગ-પરિસ્થિતિ બાધક ન હોય તો બહુધા હોય છે. આ પરિસ્થિતિમાં જ્ઞાનસંપત્તિ, આચારસંપત્તિ અને પુણ્યસંપત્તિ જે હોય છે તે પરજીવોની શુદ્ધ આત્મદ્રષ્ટિને ખોલવા માટે સર્વજ્ઞ પરમાત્માનો મોક્ષમાર્ગનો ધર્મ પ્રરૂપે છે, પમાડે છે. તેઓ સ્વ-સાધના સાથે પરાર્થ પણ કરે છે, માટે કંઈક વિશિષ્ટ ઉત્તમતા છે અને પરમાત્મા શ્રી તીર્થની સ્થાપના કરવા દ્વારા ઉત્તમોત્તમ છે. અહિં ચોથા ભેદમાં શુદ્ધ આત્મદ્રષ્ટિ- ધર્મદ્રષ્ટિ-સ્વભાવધર્મ આવે.

(૫) પાંચમી ભૂમિકામાં ધર્મદાનનો પરોપકાર આવે. આમાં પ્રથમની બે ભૂમિકા દ્રવ્ય ભાવધર્મને અયોગ્ય છે. છેલ્લા બે દ્રવ્ય-ભાવધર્મ સંપત્તિ છે. ફક્ત ત્રીજો ભેદ દ્રવ્યધર્મ અને ભાવધર્મનું અસાધારણ કારણ છે. સર્વત્ર પુણ્યકિયાને પ્રધાન કરવી અને પાપકિયાને ગૌણ કરવી-ઇડવી. આ કરનાર ભાવધર્મ પામે છે, આશયવિશુદ્ધિ પામે છે.

આ આચાર-વ્યવહારધર્મ ક્ષયોપશમ ઉત્પત્ત કરવા દ્વારા સદ્ગુરૂદ્વારાને જન્મ આપે છે, ક્ષયોપશમ ઉત્પત્ત કરે છે અને વ્યવહારને શુદ્ધ-મજૂબુત બનાવે છે, ભાવનાને તીવ્ર કરે છે તેથી ક્ષયોપશમ વધે છે અને કુમશઃ ક્ષાયિકભાવ સુધી જીવ પહોંચે છે. ક્ષાયિકભાવ આવે એટલે કૈવલ્યાવસ્થા તરત મળે. માટે ધર્મની દ્રષ્ટિ ન ખુલે, ન વધે, સ્થિર ન થાય ત્યાં સુધી પાપ ઇડવાની અને પુણ્ય કરવાની દ્રષ્ટિ રાખવી-વધારવી.

## ક્ષયોપશમ મોહકર્મનો, ચખાડે સ્વાદ શિવશર્મનો

આપણો આત્મા અનંતજ્ઞાન-દર્શન-વીર્ય-ક્ષાયિકગુણોનો માલિક છે, સત્તામાં બધું જ પડેલું છે. કર્માના આવરણને કારણે અત્યારે બધું ઢંકાયેલું છે, સુખુપ્ત અવસ્થામાં રહેલું છે. તેને પ્રગટ કરવા માટે, જીગૃત કરવા માટે સત્પુરુષાર્થ દ્વારા આપણે કંઈક આંશિક ગુણોને મેળવી શકીએ છીએ. પરંતુ મળેલ બુદ્ધિ-શક્તિ-આવડત-જ્ઞાન-શ્રદ્ધા બધા ક્ષયોપશમભાવના ઘરના છે. ક્ષયોપશમભાવના અર્થાત્ મળેલ માલ ૧૦૦% ની કાયમી ગેરેટીવાળો નહીં.

જેમ અત્યારે નિરોગી દેખાતું શરીર ક્યારે રોગોથી ઘેરાછ જાય તે કહી શકાય નહીં,

જેમ અત્યારે કરોડ-અબજોપતિ લાગતી વ્યક્તિ ક્યારે નિર્ધન-પાયમલ થઇ જાય કહી શકાય નહીં,

જેમ અત્યારે અનુકૂળ વર્તતો પરિવાર ક્યારે બેવજા બને તે કહી શકાય નહીં. કારણ કે આ બધા પદાર્થો, પૌદ્રગલિક વસ્તુઓ ઔદ્યિકભાવના છે. દરેક પાછળ નાશવંત-કણિક-અનિત્ય લખાયેલું છે.

બાબુ પદાર્થોને આપણો કાયમી માની લેતા નથી, તેના ભરોસે બેસી રહેતા નથી તો અત્યારના આપણા ગુણોને પણ કાયમી માનવાની જરૂર નથી, નિર્ધિયત બનીને બેસાય તેમ નથી. કારણ કે જેણી વધ-

## ઘટ, આવન-જીવન ચાલુ રહે તે ક્ષયોપશમ ભાવ.

આવા ક્ષયોપશમભાવના ગુણો ક્યારે ચાલ્યા જાય તે કહેવાય નહીં. તેને ટકાવી રાખવા માટે ક્ષણો ક્ષણો સાવધાની રાખવી પડે. ત્યાં સુધી જ્ઞાન અને ચારિત્ર (ઉપલક્ષણથી બધા ગુણો) માટે જાગૃત બનવું પડે જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. અહીં જ્ઞાન અને ચારિત્ર એટલા માટે લીધા કે તે મુખ્ય છે. આ બનેમાં જે સાવધ રહે છે તેના ગુણો ૮૮% નાશ પામતા નથી. ક્યારેક રોગ, કર્મને કારણો ઝાંખા પડે તો પણ અલ્યકાળમાં પ્રકાશે છે.

જ્ઞાનની મહેનત કરવાથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય અને સદ્ભાવના તથા કિયામાં મહેનત કરવાથી ચારિત્ર મોહનીય ખપે અને બીજા પણ ધાતીકર્મ અને પાપકર્મ ખપે છે.

આ ત્રણામાંથી કોનો ક્ષયોપશમ મહત્વનો ?

જ્ઞાનાવરણ ખપે પછી મોહનીયનો ક્ષયોપશમ ન હોય તો . એ જ્ઞાન ક્યારેક વિષય-કખાયપોષક બનીને ગાઢ-ચિકણા કર્મો બંધાવે. શાસ્ત્રમાં આના અનેક દ્રષ્ટાંતો છે. જેમ મોહનીયના ક્ષયોપશમ વગરનું જ્ઞાન નકારું તેમ અંતરાયકર્મનો ક્ષયોપશમ પણ નુકશાનકારી. અંતરાયનો ક્ષયોપશમ શક્તિ-બળ આપે પણ મોહનીયનો ક્ષયોપશમ ન હોવાથી મૃગાપુત્ર લોઢિયાની જેમ વધુ કર્મો બાંધે.

જ્ઞાન અને શક્તિ એ મોહનીયના ક્ષયોપશમના સાધક બને તો સાર્થક, અન્યથા નિર્થક-મારક. જેમ છરી એક જ હોવા છતાં તે કોના હાથમાં રહેલી છે તેના આધારે તેની તારકતા-મારકતા બને છે. ચોરના હાથમાં રહેલી છરી મારે છે તો ડોક્ટરના હાથમાં રહેલ જિવાડે છે, તેમ કોઇપણ ક્ષયોપશમ જો મોહનીયના ક્ષયોપશમ યુક્ત હોય તો જ તારક....

જિનશાસનમાં શક્તિની જ્ઞાનની કિંમત જો તે માર્ગસ્થ હોય, સંયમી હોય તો જ છે. મોહનીયનો ક્ષયોપશમ કર્યા વગર ચાલે તેમ જ નથી. પ્રથમ તે બંધાય શેનાથી તે વિચારવું.

અવિવેક, આવેશ, અનાચાર, અવિચારકપણું, ૧૮ પાપસ્થાનકની પરિણાતિ-પક્ષપાત આ બધા મોહનીય બંધના સ્થાનો-કારણો છે. જે વ્યક્તિ અવિવેકી-આવેશવાળી હોય છે તેની કોઈ પણ પ્રવૃત્તિ સારી યા નરસી કર્મબંધ માટે જ થતી હોય છે. તેમાં ય મુખ્ય મોહનીય કર્મબંધ.

મોહનીયનો ક્ષયોપશમ જ્યષ્ઠા-કાળજી કરાવે છે. જ્યષ્ઠાયુક્ત પ્રવૃત્તિ કરતાં કદાચ વિરાધના થાય તો ય પુષ્ય-ધર્મ-ક્ષયોપશમ જ મળે.

જા જયમાણસ્સ ભવે વિરાહણા, સુતવિહિસમગ્રસ્સ ॥

સા હોડ નિજજરફલા, અજ્જાત્યવિસોહિજુત્તસ્સ ॥

અંત:કરણાની વિશુદ્ધિયુક્ત હળુકમી આત્મા સૂત્રવિધિપૂર્વક વિરાધના ન થએ જાય તેની કાળજી રાખીને કિયા કરે છતાં જો કોઈ જીવ વિરાધના આદિ થાય તો પણ તે કર્મનિર્જરા કરાવનારી બને છે.

જ્યષ્ઠા-કાળજી-વિવેક એ જ મોહનીય કર્મનો ક્ષયોપશમ છે અને તેનાથી જ ઉત્તરોત્તર મોહનીય કર્મનો ક્ષયોપશમ વધતો રહે છે. જ્ઞાન હોવા છતાં જીવનમાં ચારિત્ર-જ્યષ્ઠા ન દેખાય, શક્તિ હોવા છતાં સત્ત્વવૃત્તિ ન દેખાય તો શું સમજવાનું ? આ બેકાળજી શેનાથી ?

જેને મોહનીયનો ક્ષયોપશમ ન હોય તેના જ જીવનમાં આતું બની શકે, તેને મળેલ સાધનો અધિકરણ જ બને, ઉપકરણ નહીં.

જ્ઞાન મેળવવા મહેનત કરે, પણ જીવનમાં પદ્ધતિ, કાળ  
અપનાવવા-ગુણો મેળવવા જે પ્રયત્ન ન કરે તે ધર્મનો, મોક્ષનો  
અધિકારી નહીં. જેમ શાસનમાં કહ્યું છે “જેને સાવધાન-નિરસધાન  
ભેદ પાડતા ન આવતે તે બોલવા માટે યોગ્ય નથી તેમ જેને વિકે  
નથી તે કોઈપણ પ્રવૃત્તિ-કાર્ય માટે પાત્ર નથી.

દરેક પ્રવૃત્તિમાં જ્યાણાની-વિવેકની ગૌણા-મુખ્યભાવ  
અનિવાર્યતા છે. આ બધી વિચારસરણી જેનામાં આવે, જે કરત  
થાય એનામાં સંયમની પરિણાતિ આવે. આપણો જ્ઞાન ભણીએ  
ચારિત્ર પાળીએ દરેક પાછળ આરાધક થવાનો ભાવ રાખવાન  
મોહનીયનો કષ્યોપશમ એ જ આરાધક બનાવશે, આગળ વધાર  
અને ક્ષાયિકભાવ સુધી પહોંચાડશે તેથી તે રીતે પ્રવર્તન કરવું.



કોઈ પણ બ્યવહાર એ પોતાના કે બીજાના હૈયામાં સારા યા નરસા ભાવો નાંખવાનું, ઉત્પત્ત કરવાનું સાધન છે. આપણી પ્રવૃત્તિ-ક્રિયા જો સારી-આદરયુક્ત ચોક્કસાછવાળી હોય તો પોતાને આનંદ-શુભભાવો જરૂર અપાવે, સાથોસાથ દેખનાર સામી બંદિતને પણ તેના પ્રત્યે રૂચિ જન્માવે છે અને જો ક્રિયા જેમ તેમ કરતા હોઈએ તો સ્વને જ આનંદની અનુભૂતિ નથી થતી ત્યાં બીજાને તો સારા ભાવ ક્યાંથી ઉત્પત્ત કરાવે ? પ્રતિકમણ ઉભા ઉભા કરવું જોઈએ, ઉપયોગપૂર્વક કરવું જોઈએ, હાથ જોડીને આદરપૂર્વક કરવું જોઈએ તો કર્મથી હલકા થયાનો સ્વને અનુભવ થાય. બીજા જોનારને પણ આ ક્રિયા પ્રત્યે આદર-રૂચિ જાગે અને જો બેઠા બેઠા હાથ જોડ્યા વગર કરીએ તો ક્રિયાનો આ અનાદર સામાન્ય પુષ્ય અપાવે, કિલ્બિષિકપણું અપાવે.

આપણો ધર્મ પ્રવૃત્તિ-નિવૃત્તિ બતે સ્વરૂપ છે. મોટર-ગાડી ઝટ ચલાવવાય કે ધીમે ? સીધી જ ચલાવવાની કે વળાંક લેવાનો ? આમાં આમ જ કરાય તેવું કહી શકાતું નથી. પરિસ્થિતિ-સંયોગ પ્રમાણો વર્તવું પડે છે. Hard and Fastનું વલણ કોઈ જગ્યાએ ચાલતું નથી તેમ આપણા જીવનની દરેક પ્રવૃત્તિમાં નિયંત્રણ ન હોય તો ન ચાલે. કોઈ કહે કે હું માત્ર તપ કરું તો ન ચાલે. કોઈ ઓમ કહે હું માત્ર સ્વાધ્યાય કરું, જ્ઞાન ભરું તો ય ન ચાલે. કાલે કાલે શક્તિ મુજબ

બધું જ કરવું પડે તેથી જ પરમાત્માએ કાલે કાલં સમાયરેનું સૂત્ર આપ્યું છે. કોઇ જગ્યાએ પ્રવૃત્ત થવું પડે, ક્યાંક નિવૃત્ત બનવું પડે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ એકાંતે લાભ કે નુકશાન કરનારી નથી હોતી.

પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં જો નિયંત્રણ ન હોય તો તેને કિયા કહેવાય, ધર્મ કે સંયમ ન કહેવાય. સંયમનો અર્થ છે સમ્યગ્ન નિયંત્રણ, લાભ-નુકશાનના વિચારપૂર્વક થતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ. નાની ઉમરમાં શરીરના પોષણ માટે, શરીરના બાંધાને મજબૂત બનાવવા માટે થોડું થોડું ખાવા આપવું પડે તે જ વ્યક્તિને માટે જુવાનીમાં એકાસણા-આયંબિલનો તપ લાભકારી બને અને ઘડપણમાં છફ-અફમનો તપ કરાવવો ઉચિત. કારણ કે વિકૃષ્ટતપથી શરીરને જો કસેલું હોય તો મોત વખતે વધુ કષ્ટ-પીડા ન આવે, સમાધિ મળે.

તે જ રીતે બાળપણમાં માત્ર ગાથા ગોખાવવાની. યુવાવસ્થામાં અર્થની પ્રધાનતા કરાવવાની અને વૃદ્ધાવસ્થામાં જરૂર પૂરતું ગોખાવવાનું, બાકી વાંચન કરાવવાનું. યુવાનીમાં સ્વાધ્યાય મુખ્ય બને કારણ કે પરિણાત ઘડવાની છે. વૃદ્ધાવસ્થામાં જપ-ધ્યાન મુખ્ય.

પ્રવૃત્તિને ગાડરિયા પ્રવાહ જેવી ન બનાવતા ક્યારે શું કરવું, કેમ કરવું, કેટલું કરવું તેનું જો નિયંત્રણ કરીએ તો પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય, વિકસિત બને. જે અવસરને ઉચિત ન કરે તેને શાનાવરણીયનો અને મોહનીયનો કષ્યોપશમ ન થાય.

પરમાત્માનું શાસન લોકોત્તર છે. બીજાઓ જેવી જ આપણી ચર્ચા હોય તો તેમનામાં અને આપણામાં તફાવત શું ? લોકોત્તર જીવનચર્ચા તેને કહેવાય કે દરેક પ્રવૃત્તિમાં-આચારમાં આત્મપરિણાતિની, લાભ-નુકશાનની વિચારણા હોય.

વિવેકદ્રષ્ટિ રાખીને કરાતી પ્રવૃત્તિ કર્માનો કષ્ય-કષ્યોપશમ

કરવા માટે સમર્થ બને છે. જેમ આચારની ચુસ્તતાથી કર્મનો ક્ષયોપશમ થાય છે તેમ આંતરિક હચ્છાથી પણ ક્ષયોપશમ થાય. હચ્છા-ભાવના-પરિણામ પણ કર્મનો ક્ષયોપશમ કરાવે છે.

સામાન્યથી એક નિયમ છે કે જેવી હચ્છા-ભાવના હોય તેવો ક્ષયોપશમ-કર્મબંધ, ગુણ-દોષ ઉત્પત્ત થાય. જો સદ્ગ્લાવના હોય તો ક્ષયોપશમ દ્વારા ગુણની પ્રાપ્તિ થાય અને ખરાબ હચ્છા હોય તો કર્મબંધ દ્વારા દોષ મળે છે.

આંતરિક કાળજી અર્થાત્ મારે મારી પરિણાતિ સુધારવી છે આવી ભાવના જે પરિણાતિ સુધારે. મારે ગુસ્સો કરવો નથી એવો મનમાં સંકલ્પ કરો એટલા માત્રથી ક્ષયોપશમ થાય. મારે તપ કરવો છે એવી ભાવના ભાવીએ તો એનો ક્ષયોપશમ પ્રગટે. આજે શક્તિ ન હોય તો પણ તેનો ક્ષયોપશમ થયા કરે. અમુક કર્મ ખર્સે એટલે એક સાથે ક્ષયોપશમ થાય.

એવી જ રીતે જેટલી અસદ્વૃત્તિ-ખરાબ હચ્છા કરીએ તેમાં અશુભ કર્મ બંધાય. કોઈને છેતરવાની હોંશિયારી હોય તે આ ભવમાં કદાચ સફળ બને પણ અહીં જ્ઞાનાવરણકર્મ એવું બાંધે કે ભવાંતરમાં એ ટેવ ચાલુ રહે અને તે વખતે જ્ઞાનાવરણના ઉદ્યે બીજાને છેતરવામાં ગમે તે રીતે ફસાદ જાય.

કેટલાકને મશકરી કરવાનો સ્વભાવ હોય છે. આ ભવમાં એવી મશકરી કરે કે પોતે હાસ્યાસ્પદ ન થાય પરંતુ પછીના ભવમાં એવી સ્થિતિ આવે કે અસ્થાને પણ મશકરી કરે, વિવેક વગરની એ વૃત્તિ-પ્રવૃત્તિ ચાલુ રહે. પરમાત્મા મહાવીર સ્વામીના સમવસરણમાં એક વાર એક હાથણીએ આવીને જોરથી વાધૂટ કરી. બધા લોકો આશ્વર્ય પાંચ્યા. ગૌતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યા કે પ્રભુ ! આણો

આમ કેમ કર્યું ? ત્યારે પરમાત્માએ કહ્યું કે તેને પૂર્વભવમાં બધાની મશકરી કરવાની, સૌને હસાવવાની ટેવ હતી તે ટેવ તેને દેવભવમાં પણ સાથે આવી. એકવાર પડેલી-પાડેલી ખોટી ટેવ વિવેક/સ્થાન-અસ્થાન બધું જ ભૂલાવે છે.

જીવ અનાદિકાળથી અશુભપ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો રહ્યો છે તેથી એને અશુભપ્રવૃત્તિઓ અને એની વૃત્તિઓના સંસ્કારો દફન અને અસ્થિમજજા થયેલા છે તેથા બધા જીવોમાં બધી જાતના અશુભ સંસ્કારો દફન રીતે પડેલા છે તેથી તેના સંસ્કારો પાડવા પડતા નથી પરંતુ થોડી પ્રવૃત્તિથી પણ એ સંસ્કારો તરત જાગૃત થઇ ઉઠે છે અને જ્યારે એ સંસ્કારોથી વિપરીત શુભપ્રવૃત્તિઓ જીવને બરાબર જામતી નથી, એના સંસ્કારો ઝટ પડતા નથી પરંતુ અશુભપ્રવૃત્તિઓના સંસ્કારનો નાશ કરવા માટે અને શુભપ્રવૃત્તિના સંસ્કાર ઉત્પન્ન કરવા કાળજી-ઝુંશિયારી અને આદર ત્રણ જોઈએ. શુભપ્રવૃત્તિમાં જ્ઞાન અને રૂચિપૂર્વક વારંવાર પ્રવૃત્તિ થાય ત્યારે અશુભ સંસ્કાર ઘસાય અને શુભપ્રવૃત્તિઓના સંસ્કાર પડે અને તે જન્માંતરમાં સાથે આવે.

જે જીવને જે શુભપ્રવૃત્તિઓના જન્માન્તરના સંસ્કારો દેખાય તેનામાં એનાથી વિપરીત પાપપ્રવૃત્તિઓના સંસ્કાર, રૂચિ, લાગણી મોળી પડેલી જોવા મળે.

આપણા આત્મામાં કર્મનો ક્ષયોપશમ કરવા. ગુણની પ્રાપ્તિ માટે, તેના વિકાસ માટે દરેક જગ્યાએ આદર-વિવેકની પ્રધાનતા લાવવી. સદ્ભાવના અને સતતપ્રવૃત્તિમાં સતત પ્રવર્તવું.



## પુરુષાર્થનું સ્વરૂપ-કમ્- કાર્યકારણભાવ

સર્વજ્ઞપ્રણીત ત્રિલોકનાથ અરિહંત પરમાત્માના શાસનમાં ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ બતાવવામાં આવ્યા છે. તેમાં પુરુષાર્થ શબ્દનો અર્થ છે પ્રવૃત્તિથી, ઉદ્ઘામથી, સાહસથી પુરુષ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ કે ગુણ. આ રીતે પુરુષાર્થ શબ્દની વ્યાખ્યા કરવાથી પુદ્ગાલસ્કંધોમાં પરસ્પર સંઘટન અને વિઘટનની પ્રવૃત્તિ એ પુરુષાર્થ શબ્દથી વાચ્ય બનતી નથી.

જેવી રીતે અર્થ મેળવવા માટે તેના સાધનમાં થતી પ્રવૃત્તિને અર્થ પુરુષાર્થ કહેવાય છે, કામ સુખ મેળવવા માટે તેના કારણોમાં થતી પ્રવૃત્તિ તે કામપુરુષાર્થ કહેવાય છે એજ રીતે સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિનું કારણ ધર્મ હોવાથી કાર્યને છચ્છતા આત્માએ કારણાને પણ છચ્છવું જોઈએ એ ન્યાયે ધર્મ પણ સ્વતંત્ર પુરુષાર્થ છે.

**પુરુષેણ અભિલસણીય** એ અર્થમાં પુરુષાર્થ શબ્દ શાસ્ત્રોમાં વપરાતો આવ્યો છે. મોક્ષનું સુખ એ એકાંતિક અને આધ્યાત્મિક હોવાથી તેમજ તેમાં અપ્રયાસી વીર્યનું પ્રવર્તન હોવાથી તે સ્વત: કાય છે, સ્વત: છચ્છનીય છે એથી કરીને મોક્ષના કારણમાં પ્રવર્તવું તે મોક્ષ પુરુષાર્થ છે. મોક્ષની પ્રાપ્તિ થયા પછી મોક્ષપુરુષાર્થ કહેવાતો નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિ એ તો મોક્ષપુરુષાર્થનું ફળ છે.

પુષ્પાત્મક ધર્મ તમામ સુખનું કારણ હોવાથી પણ ધર્મ

પુરુષાર્થરૂપ છે પુરુષાર્થ શબ્દનો રૂઢિથી ઉદ્યમ, મહેનત, પ્રયત્ન એવો અર્થ ઘટે છે. આ સંદર્ભમાં “મોક્ષાયૈવ તુ ઘટતે વિશિષ્ટમતિરૂત્તમઃ પુરુષः” એમ તત્ત્વાર્થસૂત્ર કારિકામાં કહ્યું છે. ‘ઉત્તમકક્ષાવાળા વિશિષ્ટમતિ સંપત્ત જીવો મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે.’ તે મોક્ષપુરુષાર્થ છેણ ગુણાઠાણાના ઉપરના નિરતિચાર સંયમસ્થાનોથી માંડીને બારમા ગુણાઠાણા સુધી મુખ્યત્વા હોય છે અર્થાત્ આત્મામાંથી બહુધા મોહજન્ય અશુભ વિકલ્પોનું બળ નીકળી જાય છે, અશુભ વિકલ્પોનું અનુત્થાન હોય છે અને જે શુભવિકલ્પો આવે છે તે પણ માત્ર પુષ્યબંધનું કારણ ન હોતાં સ્વરૂપના સાધક હોય છે એવી પરમ શાંત-પ્રશાંત અવસ્થાથી મોક્ષપુરુષાર્થની શરૂઆત થાય છે. આ મોક્ષપુરુષાર્થ જેમ જેમ આગળ વધે તેમ તેમ સ્વરૂપ સાધક શુભવિકલ્પોનું બળ પણ ઘટતું જાય છે અને આત્મોપયોગ સ્વરૂપમાં વધુને વધુ સ્થિર થતો જાય છે અને અંતે તે સ્વરૂપમાં વધુને વધુ ઘનીભૂત થવા દ્વારા ક્ષપકશ્રેણિ માંડી વીતરાગ બને છે. અને તેનાથી આગળ વધીને ઉપયોગ પૂર્ણતાને પામે છે ત્યારે આત્માને કેવલ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે જ્યાં મોક્ષપુરુષાર્થનો અંત આવે છે અને સ્વરૂપમાં પરમસ્થિતા રૂપ ભાવમોક્ષ પ્રાપ્ત થાય છે.

ગુણસંપત્ત અપુનર્બધક અવસ્થાથી માંડીને પ્રમાદ ભરપુર સાતિચાર સંયમસ્થાનો સુધીના બધાજ ક્ષયોપશમભાવો અને ઉપશમભાવો એ ધર્મપુરુષાર્થ છે. જે ધર્મપ્રવૃત્તિ દ્વારા પુષ્યાનુભંધી પુષ્યની મુખ્યતા છે તાં સુધી બધો ધર્મપુરુષાર્થ માની શકાય. ટૂંકમાં ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થની ભેદરેખા પાડવી હોય તો એટલી જ પાડી શકાય કે જે ધર્મપ્રવૃત્તિ દ્વારા આત્મામાં મેત્રી, પ્રેમ, વાત્સલ્ય કરુણા, સહાયકભાવ, સેવા, વિનય, વિવેક, વૈરાગ્યાદિ, શુભભાવો

વૃદ્ધિ પામે છે તે બધો જ ધર્મપુરુષાર્થ છે અને આ જ વૃદ્ધિ પામતાં શુભભાવો દારા આત્મા આગળ વધીને સ્વરૂપમાં ઠરતો જાય છે, સ્વરૂપમાં સમાતો જાય છે તે બધો મોકાપુરુષાર્થ છે અને સ્વરૂપમાં સંપૂર્ણપણે સમાઈ જવું અને તેમાંથી ક્યારે પણ બહાર ન નીકળવું તે મોકા છે.

**પ્રશ્ન :-** મોકાના કારણ તરીકે જો ધર્મપુરુષાર્થ માનશું તો મોકાપુરુષાર્થ કોને કહીશું ?

**ઉત્તર :-** મોકાને અનુભવવો તેને જ જો મોકાપુરુષાર્થ કહીએ તો અર્થના માલિક થયેલાને, અર્થનો ઉપયોગ કરનારને અર્થપુરુષાર્થ કહેવાની આપત્તિ આવશે તેમજ કામના સાધનોના માલિકને કામપુરુષાર્થ કહેવાની આપત્તિ આવશે પરંતુ વ્યવહારમાં તો અર્થ ઉપાર્જન, વર્ધન અને રક્ષણના પ્રયત્નને અર્થપુરુષાર્થ કહેવાય છે તથા કામસુખ મેળવવા માટે તેના સાધનોમાં થતી પ્રવૃત્તિને કામપુરુષાર્થ કહેવાય છે.

તેથી ધર્મપુરુષાર્થને સમજવા માટે સૌ પ્રથમ ધર્મનો અર્થ સમજવો પડે અને પછી તેના માટે અને તેમાં પુરુષાર્થ એવો અર્થ કરવો પડે, તો પ્રસ્તુતમાં ધર્મ એટલે સ્વભાવ-ભાલ્યભાવ નિવૃત્તિ-આશ્રવ નિવૃત્તિ-અંતર્મુખ પ્રવૃત્તિ. આ બધાના કારણરૂપ બાધ્ય વ્યવહારમાં જે શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય તેને વ્યવહારથી ધર્મપુરુષાર્થ કહેવાય અને આંતર પરિણામથી જે શુભભાવમાં પ્રવૃત્તિ અને અશુભભાવમાંથી નિવૃત્તિ તે ભાવધર્મપુરુષાર્થ-નિશ્ચયધર્મપુરુષાર્થ કહેવાય.

વ્યવહાર ધર્મપુરુષાર્થથી પુણ્યબંધ છે, ક્ષયોપશમ નથી-ભાવધર્મ નથી. પરંતુ તે ક્ષયોપશમભાવનું-ભાવધર્મનું કારણ જરૂર

છે. જ્યારે ભાવધર્મથી ક્ષયોપશમભાવની વૃદ્ધિ, ગુણોની વૃદ્ધિ એ મુખ્ય છે, પુણ્ય કથંચિત્તુ છે. બ્યવહાર ધર્મથી પુણ્ય અને ભૌતિક સામગ્રીઓ પ્રાપ્ત થાય એટલે અર્થ-કામ મળે જ્યારે ભાવધર્મથી મોક્ષપુરુષાર્થ અને તેને અનુકૂળ સામગ્રીઓ પણ મળે છે.

(૧) ક્ષયોપશમ ભાવના અને ક્ષાયિકભાવના ઉદેશથી કરાતી આંતરિક-બાધ્ય પ્રવૃત્તિ તે મોક્ષપુરુષાર્થના કારણભૂત ધર્મપુરુષાર્થ છે. (૨) જ્યારે ક્ષયોપશમભાવના વિશેષ ઉદેશ વિના સામાન્ય ઉદેશવાળી ધર્મપ્રવૃત્તિ એ ધર્મ=પુણ્ય પુરુષાર્થ છે. (૩) ક્ષયોપશમભાવના અનાદર અને અવજ્ઞાથી કેવળ પુણ્ય માટે કરાતી ધર્મપ્રવૃત્તિ એ વિષ-ગરાનુષ્ઠાનરૂપ ધર્મ=પુણ્ય પુરુષાર્થ છે. (૪) જે ધર્મપ્રવૃત્તિમાં ક્ષયોપશમભાવનો રાગ અને યત્કિંચિત્તુ ભૌતિક આશંસા પણ ભલેલી છે તેવી ધર્મપ્રવૃત્તિ એ પુણ્ય પુરુષાર્થ છે અને તે મોકાના કારણભૂત જે મોક્ષપુરુષાર્થ, તેના કારણભૂત ધર્મપુરુષાર્થનું કારણ બને છે.

પુરુષાર્થ એટલે આભોગપૂર્વકની=ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિ. તેના ઉદેશ, વિષય અને આશય એમ તરફ ભેદ પડે છે. ધર્મપુરુષાર્થનો ઉદેશ છે ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ અને ઉભય અવિરુદ્ધ પુણ્ય.

ધર્મ પુરુષાર્થનું કરણ અર્થાત્ સાધન છે અપુનર્ભધકથી માંડીને સર્વવિરતિ સુધીની બધી બાધ્ય પ્રવૃત્તિ, દયા-દાન-અનુકૂળ- જીવદ્યા, મૈત્રી-કરુણા વગેરે ભાવનાઓ તથા બાધ્ય ધર્મના સ્થાનો- ધાર્મિક વ્યક્તિ-ધર્મના ઉપકરણો.

ધર્મપુરુષાર્થ આશય - ધર્મમાં સહજ રૂપી, આત્મશુદ્ધિ, આત્મિક ગુણોની અનુભૂતિ, કર્મનિર્જરા.

ધર્મપુરુષાર્થી અલ્યકિંમતવાળા અર્થ મળે છે અર્થાત્ જગતના તમામ અર્થની કિંમત અલ્ય જ છે, તેના કરતાં પંચેન્દ્રિયપૂર્ણતા, આરોગ્ય, ચિત્તની પ્રસન્નતા વગેરેની કિંમત અનંતગુણી છે. અબજ રૂપિયાથી પણ આંખ, જીબ મળતી નથી. આંખ એ કામ પુરુષાર્થનું સાધન છે, જે ધર્મ-પુણ્યથી જ મળે છે. માટે ધર્મ પુરુષાર્થનું બીજું ફળ કામની પ્રાપ્તિ અને ત્રીજું ફળ છે મોક્ષ, ધર્મ દ્વારા મળતા અર્થ અને કામ એ ગૌણ છે, અપ્રધાન છે. તૃતીયફળ મોક્ષ તે વિશેષ ઉપાડેય છે.

ધર્મપુરુષાર્થ દ્વારા મળતા અર્થ-કામનું સાફલ્ય છે કારણ કે તે અર્થ-કામ મોક્ષ પ્રાપ્તિમાં બાધક ન બનતા પરંપરાએ મોક્ષ પ્રાપ્તિમાં સહાયક બને છે.

અર્થ અને કામના બે વિભાગ છે, પ્રધાન અને અપ્રધાન. આમાં જે પ્રધાન છે તે ધર્માઓને જ મળે છે. માટે ધર્મપુરુષાર્થ-વાળાને મળતા અર્થ અને કામ જ મુખ્ય છે. બાકીના જીવોને મળતા અર્થ અને કામ એ તુચ્છ છે.

રાગ, મોહ અને અશાનના કારણો જીવોને અર્થ માટે પુરુષાર્થ વધારે કરવો પડે છે અને છતાં તેનું ફળ અલ્ય મળે છે. જ્યારે ધર્મપુરુષાર્થથી ઉત્પત્ત થયેલ વિશેષ પુણ્યવાળાને અર્થ-કામ માટેની મહેનત અલ્ય હોય છે અને ફળ બીજા જીવો કરતાં વિશેષ પ્રાપ્ત થાય છે માટે જે આત્માઓ પોતાના જીવનમાં ધર્મપુરુષાર્થનું દ્રવ્ય-ભાવ ઉભય રીતે આલંબન લે છે તેઓ જીચી કોટિનું પુણ્ય ઉપાર્જન કરે છે અને તેથી વિશુદ્ધિ વિના અતિચારબહુલ મહિન વ્યવહારધર્મથી જે અર્થ-કામ મળે છે તે તુચ્છ-અલ્ય-પરાધીન અને કલંકિત મળે છે.

જેમ જેમ ધર્મપુરુષાર્થમાં આદર-બહુમાન-ભક્તિ-ઉલ્લાસ-

અનુમોદનાદિ ભાવો ભળતા જાય છે તેમ તેમ ધર્મપુરુષાર્થ ઉંચી કોટિનો બને છે, નિરતિચાર બને છે અને તેનાથી બંધાતું પુણ્ય પુણ્યાનુબંધી બને છે જેના પ્રભાવે આસક્તિ વગરના ઉંચી ક્વોલીટીના ભોગો મળે છે અને ક્યારેક અતિવિશુદ્ધ પુણ્ય ઉપાર્જન થઈ જાય છે તો અર્થકામ માટેના લેશમાત્ર પ્રયત્ન વિના જ ઉંચી ક્વોલીટીના ભોગોને પામે છે. શાલિબદ્રનો જીવ આને માટે દસ્તાંતરૂપ છે.

પૂર્વના સંગમ ગોવાળના ભવમાં ત્યાગી મહાત્મા પ્રત્યે અત્યંત આદર-બહુમાનપૂર્વક સુપાત્રમાં ખીરના દાનનું સુફૃત કર્યું તો તેના પ્રભાવે પછીના જ ભવમાં મનુષ્યપણામાં દેવી ભોગોનો માલિક બન્યો, તેનો ભોગવટો કરવા છતાં તેમાં અત્યંત અનાસક્તતા અને નિઃસ્પૃહતા રહી, જેના પ્રભાવે તે જ ભવમાં તારક તીર્થકર પરમાત્માનો યોગ, ચારિત્રની પ્રાપ્તિ, નિરતિચાર ચારિત્રનું પાલન, અંતે અણાસણા અને એકાવતારીપણું પ્રાપ્ત થયું.

ધર્મપુરુષાર્થ મુખ્યતયા તો મોક્ષપુરુષાર્થનું જ કારણ છે. તેમ છતાં ધર્મપુરુષાર્થ કરનાર સંસારી આત્મા છે તેને અર્થ-કામ ગૌણ-મુખ્યભાવે હોય છે. વિશેષ ભૂમિકા વગર તે જીવો અર્થ-કામના પ્રયત્નને કે તેની અપેક્ષાને છોડી શકતા નથી તેથી અલ્ય, તુચ્છ અને આનુધંગિક ફળરૂપ અર્થ-કામને આપનાર પણ ધર્મ છે તે માટે ધર્મ પછી અર્થ-કામ પુરુષાર્થ બતાવી મુખ્યફળ રૂપ મોક્ષપુરુષાર્થ બતાવ્યો છે. મહત્ત્તા મોક્ષપુરુષાર્થની અને તેના કારણભૂત ધર્મપુરુષાર્થની છે. ધર્મના યોગાભેદ અસંખ્ય ભેદ પડે છે અને તરતમભાવે પણ તેના ભેદ અસંખ્ય પડે છે.

અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ એ સાંસારિક કહેવાય પરંતુ તે પણ ધર્મને બાધા ન પહોંચે તે રીતે ઔચિત્યથી આસક્તિ છોડીને

કરવાનું સામર્થ્ય ધર્મપુરુષાર્થથી આવે છે માટે સાનુબંધ ધર્મપુરુષાર્થથી અનુવિદ્ધ અર્થકામવાળાના જીવનમાં અર્થ-કામની મહત્તા હોતી નથી પરંતુ ધર્મની મહત્તા હોય છે અને જેના જીવનમાં ધર્મપુરુષાર્થ નિરપેક્ષ અર્થ-કામની મહત્તા હોય તેનો ધર્મપુરુષાર્થ નબળો, દૂષિત અને નાશ પામનાર છે.

માટે આ રીતે ચાર પુરુષાર્થનું સ્વરૂપ બરાબર સમજી આત્માર્થી જીવોએ ધર્મપુરુષાર્થમાં ઉગ્ર વીર્ય ફોરવવું જોઈએ, જેના પ્રભાવે પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી બની મળેલા ભોગસુખોને લાત મારી મોક્ષપુરુષાર્થ આદરી અલ્યભવમાં મુક્તિસુખના ભોક્તા બનાય.

•\*• •\*• •\*•

# શુદ્ધી

॥ મનઃશુદ્ધ્યૈ ચ કર્તવ્યો રાગ-દ્વેષવિનિર્જયઃ ॥

જેમ આરિસામાં આપણે પ્રતિબિંબ પાડવું હોય તેવું નથી  
પડતું, પરન્તુ તેની સન્ભૂખ જે વસ્તુ જેવી રહે તેનું તેવું પ્રતિબિંબ પડે  
છે, તે રીતે જીવોનો ઉપયોગ શુદ્ધ કે અશુદ્ધ રાખવો તે તેના સામાન્ય  
પ્રયત્નથી કે ઇચ્છાથી સાધ્ય નથી. પરંતુ જેવા સંસ્કારો હોય તેવો જ  
ઉપયોગ રહેતો હોય છે.

જેમ જ્ઞાન મેળવવામાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ કારણ છે  
અને જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનાચારના પાલન દ્વારા કર્મ ક્ષયોપશમ  
થાય ત્યારે જ્ઞાન આવે છે. એ જ્ઞાનને નિર્ભળ બનાવવા, મન અને  
આચારને પવિત્ર બનાવવા, કામે લગાડવા માટે દર્શનમોહનીય અને  
ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ જોઈએ.

 ( દર્શન મોહનીયના ક્ષયોપશમ વગર જીવને મળેલું ભૌતિક કે  
આધ્યાત્મિક જ્ઞાન કષાય અને ઇન્દ્રિયનું પોષક બને છે, માન અને ગૌરવની  
પરિણાતિ સર્જે છે. એ જ્ઞાન પરિણાતિની, ઉપયોગની શુદ્ધિ નથી કરતું.

અનાદિકાલીન રાગદ્વેષની ગાઢતા જીવમાં જ્યાં સુધી છે ત્યાં  
સુધી જીવને જે કાંઈ જ્ઞાન કે બીજી શક્તિ મળે તે ચિત્તશુદ્ધિ કરવાને  
બદલે વ્યક્ત રૂપે રાગદ્વેષને વધારવાનું જ કામ કરે છે.)

આત્માના ઉપયોગની શુદ્ધતા જરૂરી છે સંસ્કારોની શુદ્ધતા  
ઉપરથી. જે માણસ આત્મવીર્યથી કોઇ એક ગુણ આદર અને વિશેષ  
પ્રયત્નથી પકડે છે, તેને તેના દઢ સંસ્કાર પડે છે, તેથી તે શુદ્ધ પ્રયત્નથી

વિવેકની ઉત્પત્તિ થાય તેવા કર્મ બંધાય છે, તે કર્મના ઉદ્યથી વિવેકની ઉત્પત્તિ થાય તેવા કર્મક્ષયોપશમ થાય છે અને તે ક્ષયોપશમથી વિવેકની ઉત્પત્તિ થાય છે અને સર્વત્ર શુદ્ધતા-ઉપયોગની નિર્મળતા પ્રગટ થાય છે.

આભોગ-જાણકારી પૂર્વકના વિશિષ્ટ શુલ્ભ પ્રયત્ન જૂના અશુલ્ભ સંસ્કારોને સુધારી શુદ્ધ સંસ્કારો ઉત્પત્ત કરે છે અને શુદ્ધ ઉપયોગ રહે છે અને એ શુદ્ધ પ્રયત્નના ઉત્તર કાળમાં અશુદ્ધ ઉપયોગ પ્રાય: નથી આવતા, જ્યારે ઉપયોગ આવે ત્યારે શુદ્ધ જ આવે.

આત્મગુણોને ઉદેશીને જે કોઈ સંકલ્પ-ભાવના કે પ્રવૃત્તિઓ કરવામાં આવે તે ઉપયોગ શુદ્ધિનું કારણ બને છે અને એમાં જેટલી તીવ્રતા તેટલી વિશેષ શુદ્ધિ.... આ ઉપયોગ શુદ્ધિનો મુખ્ય ઉપાય છે. વિશિષ્ટ ધ્યેયનું ધ્યાન, અરિહંત પરમાત્માના ગુણો, આત્મ સ્વરૂપ વગેરેનું કાઉસ્સગ દ્વારા અને અન્ય રીતે વારંવાર ચિંતન. એ વિદ્યા જન્મ=વિવેક ઉત્પત્તિનું કારણ છે અને આ રીતે જ ચિત્ત નિર્મળ થાય છે.

વારંવાર રાગ-દ્રેષનો નિગ્રહ કરવો, વારંવાર શુલ્ભ ગુણોનો અભ્યાસ કરવો, સૂત્ર-અભ્યાસ, પરાવર્તન, પરમાત્મા સ્મરણ-જાપ-તેમના ગુણોનું ચિંતન, સદ્ આચાર દ્વારા અસદ્ આચારની અરુચિને ઉત્પત્ત કરવી, આ બધી વૃત્તિ-પ્રવૃત્તિઓ ઉપયોગની નિર્મળતાને કરે છે.

આ ભવમાં આદર-ભાવનાપૂર્વક કરાયેલ શુલ્ભ સંકલ્પ-ઉદેશ-પ્રયત્ન એ ધર્મના અનુબંધવાળું કર્મ બંધાવે છે. જેના ઉદ્યકાળમાં વિવેક જન્મે છે, જેનાથી આત્મા વિશેષ રુચિ, ઉપયોગની નિર્મળતા મેળવે છે. આમ નીચેના મુદ્દા ફલિત થયા.

- ૧) વિશેષ ધ્યેયનું ધ્યાન એ વિવેક ઉત્પત્તિનું કારણ છે... એ વાત પરમેશ્વરપ્રાણિત શાસ્ત્રમાં સિદ્ધ છે.
- ૨) વિવેક ઉત્પત્તિને અનુકૂળ સામગ્રીથી, પ્રવૃત્તિથી જ આત્માની વૃત્તિ નિર્મળ થાય છે.

૩) પ્રસ્તુત કાયોત્સર્ગાદિ ધ્યાન રૂપી ભાવથી ઉત્પત્ત થયેલા શાતા વેદનીયાદિ કર્મા પણ શુભ ભાવરૂપી ફળને આપે છે.

૪) શુભ ભાવથી ઉત્પત્ત કરેલ કર્મના ઉદ્યથી વિવેક ઉત્પત્તિ લક્ષણ કાર્ય થાય છે. કારણાના સ્વરૂપને અનુસરવાનો કાર્યનો સ્વભાવ હોય છે.

શુદ્ધ કે શુભભાવરૂપુક્ત શુભ ક્રિયાથી પુષ્યાનુબંધી પુષ્ય બંધાય, તેનાથી શુભ સામગ્રી મળે, તેમ એ પુષ્યોદય સાથે સંકળાયેલ જ્ઞાનાવરણ-મોહનીય કર્મનો ક્ષયોપશમ પણ મળે છે તેથી સદ્બુદ્ધિ-સારી લાગણી-શુભ વિચારણા-કષાય-વિષયની મંદતા વગેરે પણ મળે છે. જેવી રીતે તે તે દેવ વગેરે ભવ મળતાં અવધિજ્ઞાન અને બીજી શક્તિઓના ક્ષયોપશમ મળે છે તેમ પુષ્યાનુબંધી પુષ્ય સાથે વિવેક, વિનય, સંઘર્ષયતા, ઔદાર્ય, ગાંભીર્ય વગેરે મળે છે. એજ રીતે પાપક્રિયામાં પદ્ધ્યાત્તાપ, જયણા વગેરે શુભ ભાવથી પુષ્યાનુબંધી પાપ બંધાય તો તે પાપના ઉદ્યમાં પણ શુભ ઉપયોગના પ્રતાપે આત્મગુણોનો વિકાસ મળે છે.

આમ શુદ્ધ ભાવથી ક્ષયોપશમ મળે છે અને શુભ ભાવથી બંધાતા પુષ્યથી પણ વિવેક-ઔચિત્ય વગેરે મળે છે.

૫) જેમ મોક્ષમાર્ગ ચાલવામાં મોહવિષ કંટાળો-અનાદર પેદા કરી બાધક બને છે તેમ મોહવિષના અભાવમાં જીવ સંસારમાં ખેડ-કંટાળો-અનાદર-અદૃચિ સાથે પ્રવર્ત્ત છે અને તે સાંસારિક પ્રવૃત્તિ તેને બાધક તો નથી બનતી, કર્મબંધ અને ઉપયોગમાલિન્ય પણ નહિવત્ત થાય છે.

૬) વિવેક ઉત્પત્તિ દ્વારા વિષયવિરાગ, ક્રિયાયોગ અને જ્ઞાનયોગની પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ સતત ગમન થાય છે જેના દ્વારા ઉપયોગશુદ્ધિ-કર્મશુદ્ધિ થઇ છેવટે સ્વરૂપશુદ્ધિને પ્રાપ્ત કરી જીવ સાંદિ અનંતકાળ માટે સ્વરૂપમાં લીન બને છે.

## મનકી ગતિ હૈ અટપટી

જેમ હાથ એ શરીરનું બહારનું એક અંગ છે, જેમ બાબ્ય ઇન્દ્રિયો એ શરીરનું એક અંગ છે, જેમ ઇન્દ્રિયોમાં વિષય ગ્રહણ કરવાની, રૂપાદિને જોવાની શક્તિ એ શરીરના અંગરૂપ વસ્તુ વિભાગની શક્તિ છે જેના દ્વારા રૂપ જોઇ શકાય છે તેમ શરીરમાં અમુક રીતે અમુક વિભાગમાં ઉત્પન્ન થયેલ શક્તિને મનનું કારણ (જ્ઞાનતંત્ર) કહેવાય છે. જીવ એના દ્વારા અમુક પુદ્ગલો લઈને મન રૂપે પરિણામાવીને છોડે છે.

જેમ કરંટ (વિધુત) પ્રકાશરૂપે પરિણામી નાશ પામે છે, તેમ અમુક પુદ્ગલો લઈ મનરૂપે પરિણામાવી જીવ તરત છોડી દે છે, નિરંતર નવા પુદ્ગલો ગ્રહણ થાય, પરિણામે અને છુટે.

આ ગ્રહણ કરીને પરિણામાવેલ પુદ્ગલને દ્રવ્યમન કહેવાય છે, એનું પરિણામ નહીં પામેલા જે વિચારણારૂપી કાર્ય તે ભાવમન કહેવાય છે.... અથવા આ પરિણામ પામેલા પુદ્ગલને ભાવમન કહેવાય છે, અને એ પુદ્ગલોને દ્રવ્યમન કહેવાય છે.

આ ગ્રહણ કરવાની અને પરિણામાવવાની શક્તિને મન: પર્યાપ્તિ કહેવાય છે. જીવના પ્રયત્નથી આ મન પ્રવર્ત્ત છે, જીવને વિચારણા વગેરે થાય છે.

આ મનને પ્રવર્તાવવાનો, વિચારો કરવાનો જીવનો પ્રયત્ન બે પ્રકારે છે.

(૧) પોતાની જાણકારીથી અને અંકુશપૂર્વક વ્યવસ્થિત રૂપમાં યોગ્ય રીતે જે થાય.

(૨) કર્માના ઉદ્યથી-મોહના આવેગથી-કખાય નોકખાયના સંસ્કારોથી અશુભ વિચારો ઉત્પત્ત થાય. તેને જાણી શકાય છે પણ સામાન્ય રીતે રોકી શકાતા નથી.

આવા પ્રકારનું પ્રવર્તતું મન એ પૂર્વના શુભાશુભ સંસ્કારોથી પ્રવર્તે છે, તેથી તેમાં કર્મના ઉદ્યો અને કર્મના ક્ષયોપશામ કારણ છે.

બહુધા અશુભ વિચારોમાં કર્મના ઉદ્યો અને અશુભ સંસ્કારો કારણ છે અને શુભ વિચારોમાં શુભ કર્મના ઉદ્યો-શુભ સંસ્કાર કારણ હોય છે.

જ્યાં સંસ્કારનું જોર નથી, કર્મનું જોર નથી ત્યારે આત્માની સારી-ખોટી રુચિ, સાચી-ખોટી સમજણપૂર્વક જે જ્ઞાન મેળવવા કે કાર્ય કરવા જે વિચારણા કરે તે જાણકારીપૂર્વકનો-અંકુશપૂર્વકનો વ્યવસ્થિત માનેલ પ્રયાસ હોય છે.

આ વિચારણામાં, વિચારણાપૂર્વક બોલવામાં કોઈ ભૂલ કાઢે તો તરત વિચારીને સુધારાય છે. જે વિચારણા વખતે ભૂલ સુધારવાની કે ચોક્કસ કરવાની યોગ્યતા હોય તે સ્વાધીન વિચારણા છે. તે પ્રથમ ભેદ સમજવો.

આ વિચારણાના પ્રયત્નથી વિપરીત કર્મના ઉદ્યો રોકાય છે, સંસ્કારો મોળા પડે છે, અનુકૂળ સંસ્કારો જન્મે છે, તીવ્ર બને છે.

સંસ્કારો પાડવા-વધારવા-ફેરવવા માટે

૧. રુચિની કે અરુચિની તીવ્રતા,

૨. આદર-અનાદર-ઉપેક્ષા,

૩. સમજણા, અને

૪. ઉપયોગ... એ કારણ છે. આ બધાનું મુખ્ય સાધન મન છે. બીજા પ્રકારના મનની અશુદ્ધિ, અશુભ સંસ્કારને સુધારનાર પણ પ્રથમ પ્રકારનું મન છે.

મન દ્વારા વચન પદ્ધતિ ઉચિત-અનુચિત વિભાગ કરવાપૂર્વક હિત-મિત-પ્રિય કે અસાવધારુપે પ્રવર્તિ શકે છે.

મન દ્વારા જ જીવોના વાચિક વ્યવહાર પ્રમાણિક થાય છે, કાયાની પ્રવૃત્તિ પણ મન દ્વારા અંકુશિત થાય છે.

જેનું મન અંકુશ વગરનું, તેની વચન-કાયાની પ્રવૃત્તિ અંકુશ વગરની....

મન દ્વારા તીવ્ર પાપ, તીવ્ર પુણ્ય અને વિશિષ્ટ સાનુબંધ ધર્મ-અધર્મ થઈ શકે છે.

મન એ આત્માની પ્રયત્નજન્ય પૌરુણ્યિક શક્તિ છે. એ સંસાર અને મોકષનું કારણ કે સદ્દ્બાવના, સદ્દ્બાન, સત્તપ્રવૃત્તિ, સત્તસંસ્કારનું કારણ છે. અસદ્દ ભાવના રોકવા-સુધારવાનું કારણ છે. અસદ્દ જ્ઞાનને સમજવાનું અને હેઠળુપે છોડવાનું કારણ છે.... જેમકે પોતાના કાકાને નાનો છોકરો માભા કહે પણ સમજણ આવે ત્યારે અસદ્દ્બાન સહેલાઇથી છૂટે છે, ભૂલ સમજાય છે.

અસત્ત પ્રવૃત્તિને જાણવાનું, શક્ય હોય તો રોકવાનું, અશક્ય હોય તો ઘટાડવાનું, એમાં પશ્ચાત્તાપ અને અરુચિ કરવાનું મન દ્વારા જ થાય છે. આ અસદ્દને રોકવું-ઘટાડવું-અરુચિ અને ઉપેક્ષા કરવી એ સત્ત સંસ્કાર રૂપ બને છે.

પ્રભુશાસનનું મુખ્ય કાર્ય ઉપદેશ અને જ્ઞાનાભ્યાસ છે... તે બને મનના કાર્ય છે, સમર્પણ અને પ્રજ્ઞાપનીયતા એ પણ મનના કાર્ય છે.

કાયિક વાચિક બધી જ પ્રવૃત્તિઓમાં યોગ્ય-અયોગ્ય વિભાગ, પારિસ્થિતિક ફેરફાર, નિયત વ્યવહાર વગેરે બધું મનના આધારે છે.

મન દ્વારા વ્યક્ત અનુભવજ્ઞાન થાય છે અને એનાથી આત્મામાં સંસ્કાર પડે છે. મન દ્વારા રાગ-દ્રેષ્ણની તીવ્રતાથી અશુભ પ્રણિધાન દ્વારા પણ આત્મામાં સંસ્કાર પડે છે. વિવેક-સમજણા-તીવ્ર ઈચ્છા-શુભ પ્રણિધાન અને પ્રવૃત્તિ દ્વારા પણ આત્મામાં શુભ ક્ષયોપશમ અને સંસ્કાર પડે છે.

આ પડેલા સંસ્કારોને હાલના વૈજ્ઞાનિકો અંતર મન કહે છે. તીવ્ર પ્રણિધાન (નિર્ણય), તીવ્ર ઈચ્છા (રુચિ-અરુચિ) થી ઉત્પત્ત થયેલા આત્મસંસ્કારોથી વિપરીત જીવ સહજ પરિસ્થિતિમાં પ્રવર્તતો નથી અને કોઈક પરિસ્થિતિવશ વિપરીતપણે પ્રવર્તવાનું અચાનક આવે તો પણ જીવનમાં એ સંસ્કારો જાગ્રત થતા વાર લાગતી નથી. ખ્યાલ આવે પછી એ પરિસ્થિતિવશ વિપરીત પ્રવર્તે એવાત જુદી... સામાન્યથી કે અનુપયોગથી તો એ સંસ્કારવશ જ પ્રવર્તે.

- મનનું કાર્ય લોકના અનુસારે જ્ઞાન મેળવવું, શાસ્ત્રના અનુસારે જ્ઞાન મેળવવું.
- જીવના ભૂતકાલીન પ્રસંગો યાદ કરવા.
- ભવિષ્યકાલીન યોજનાનું નિયમન.
- વર્તમાનમાં કઇ રીતે પ્રવર્તવું.
- પોતાની અને બીજાની ભૂલો જાણવી, યાદ રાખવી, એના પર બચાવ-સુધારણા-પશ્ચાત્તાપ વગેરે.
- જીવનના દરેક પાસા વિકસાવવા-પ્રતિકૂળ ઘટાડવા વિચારણા.
- શાસ્ત્ર અધ્યયન-ભાવના દ્વારા નિર્રથ્ક વિચારોનો-સાવધ વિચારોનો ત્યાગ કરવો.

## - મનની શક્તિ વધારવાના પ્રકાર -

- શરીરની નિરોગિતા માટે પાચનતંત્ર મજબૂત બનાવવું.
- હલકું સુપાચ્ય ભોજન-અલ્ય ભોજન.
- કોષ શુદ્ધિ.
- યોગ્ય વ્યાયામ, પ્રાણાયામ વિ.
- અતિ આહાર-ભારે આહાર-વાસી આહાર ત્યાગ.
- નીચેના તંત્રમાં ખામી પડે તો ઉપરના તંત્રમાં ખામી આવે.  
આહારમાં-પરિણામનમાં ખામીથી બાકીની પર્યાપ્તિ-શક્તિમાં ખામી આવે માટે આહારાદિની નિયમિતતા જાળવવી.
- સશક્ત માણસનું મન સામાન્યથી મજબૂત હોય, અશક્ત થતાં મન ઢીલું પડે માટે વધારે પડતી અશક્તિ ન આવવા દેવી.
- અપેક્ષાવાળાને અપેક્ષામાં વિક્ષેપ આવતા મન ઢીલું પડે. રાગ-દ્રેષ્ણની તીવ્રતાવાળાને અપેક્ષા ન પુરાતા વિપરીત પરિસ્થિતિમાં મનની શક્તિ ઘટે... માટે,
- અપેક્ષાઓ ઘટાડવા, રાગ-દ્રેષ્ણ ઘટાડવા વૈરાગ્ય-સદ્ગ્લાવનાનો આશ્રય લઈ ભાવિત બનવું.
- પૂર્વના મહાપુરુષોના જીવનચરિત્રો સાંભળી, ભાવિત કરી આપણા સત્તવની વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન કરીએ તો પણ મનની શક્તિ વધે.
- આત્મનિરીક્ષણ અને આત્માને અનુશાસ્તિ (હિતશિક્ષા) દ્વારા પણ મનની શક્તિ વધારી શકાય.

માટે જ આપણો ત્યાં કહેવાયું છે કે મનને બાળો નહીં વાળો,  
તોડો નહીં, જોડો. મનના રોદણા રોવાથી કે મન પર અત્યાચાર  
કરવાથી મનનું ઠેકાણું નહીં પડે, યોગ્ય માર્ગ મનની શક્તિ વધારી  
છેવટે સત્તમાં જોડવાથી આ જ મન મોક્ષ સુધી લઈ જનારૂં બને છે.

## પાલન પંચાચારનું, કારણ ભવજલપારનું

સામાન્યથી સત્કાર્યની પ્રવૃત્તિ સહજમલનો છાસ થવાથી-  
બીજાની પ્રવૃત્તિ જોવાથી-કોઇની પ્રેરણાથી અથવા વડીલના આદેશથી  
થાય છે.

સાહજિક રીતે યા કંઈક જોવા-સાંભળવાથી કે બીજાની  
પ્રેરણાથી પ્રથમ રુચિ વિનાની પ્રવૃત્તિ પણ થાય. પ્રારંભિક કિયામાં  
રસ ન પડે, ઉલ્લાસ ન જાગે, ઉપયોગ પણ પરાણો લાવવો પડે.  
પરંતુ તેમાં કંટાળો લાવવાની કે નિરાશ થવાની કે પ્રવૃત્તિ છોડી  
દેવાની જરૂર નથી, મનને-આત્માને સમજાવીને પરાણો પણ સત્ત્વવૃત્તિ  
અને વારંવાર ઉપયોગનું સ્થાપન કરવાથી જીવમાં તેના ક્ષયોપશમ  
થાય છે, સંસ્કાર પડે છે.

પરાણો પણ આવેલા સંસ્કારો વિપરીત ઉપયોગના પાવરને  
તોડે છે, ધીમે ધીમે ખરાબ સંસ્કાર દૂર થએ સારા સંસ્કાર મજબૂત  
બને છે. જે પરાણો પણ ચારિત્ર પાળે-સ્વાધ્યાય કરે-તપ કરે તેને  
પણ ચારિત્ર મોહનીય, જ્ઞાનાંતરાય, વીર્યાંતરાય આદિનો ક્ષયોપશમ  
જ થાય. જે અનિચ્છાએ પણ નિશાળે ન જાય તે ઠોડ રહે, જાય તેનું  
ઠોડપણું દૂર થાય-કંઈક જ્ઞાન મેળવે.

જીવ વારંવાર આ પ્રવૃત્તિ કરે તેમાંથી તેના પ્રત્યે ગ્રેમ-આદર  
ઉભો થાય, ગુણકારિતાની બુદ્ધિ આવે અથવા તે પ્રવૃત્તિ સાહજિક

ગમે તેવા પ્રકારની રૂચિ ઉલ્લો થાય.

રૂચિ અને પ્રવૃત્તિ દ્વારા એમાં ઉપયોગ આવતો જાય પછી અવાર-નવાર ઉપયોગ આવતો જાય. આ પછી જીવને પ્રણિધાન-નિશ્ચય-નિર્ણય આવે. તેનાથી કિયામાં ચોક્કસાઈ વધે. રૂચિની તીવ્રતા આવે અને દરેક કિયામાં ઉપયોગ રાખવાનું મન થાય. ટેક-પ્રક્રિયા-સંસ્કાર આવે.

આ સંસ્કાર ક્ષયોપશમને લબ્ધિરૂપ ગુણ કહેવાય. આ લબ્ધિ ઉત્પત્ત થયા પહેલા પ્રવૃત્તિમાં વારંવાર જોડાવું અને ઉપયોગને લાવવો. ભજેમાં આત્માનો જે પ્રયત્નપૂર્વકનો પુરુષાર્થ તે ગુણોનું કારણ હોવાથી કારણરૂપ ગુણ કહેવાય.

સંસ્કાર પડવા છતાં જ્યાં સુધી તે તીવ્ર તીવ્રતમ ન બને ત્યાં સુધી કારણરૂપ ગુણમાં અર્થાત્ આચાર અને ઉપયોગમાં પુરુષાર્થ જીવને સામેથી કરવો પડે, મન મારવું પડે. આમ અભ્યાસ દ્વારા ક્ષયોપશમની તીવ્રતા થાય ત્યારે સંસ્કાર-ગુણો સહજ બને.

આ સાહજિક ગુણો સાહજિક પ્રવૃત્તિ કરાવે અને સાહજિક ઉપયોગ પણ લાવે. સાહજિક ગુણો થયા બાદ અવસરે પ્રવૃત્તિ કે ઉપયોગ ન આવે તેવું કદાપિ ન બને. માણસ બેભાન હોય ને કોઇ મોઢામાં નાંખવા જાય તો ખાવાના સંસ્કારવાળો મોહું ખોલે, ખાદ લે અને તપના સંસ્કારવાળો મોહું બંધ રાખે.

વિપરીત સંયોગમાં પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ લાગણી- રૂચિ જાગૃતિ રહે, પક્ષપાત રહે. સાહજિક રીતે વિપરીત રૂચિ કે પ્રવૃત્તિ ન થાય.

ગુણવાળાને રૂચિ અને પ્રવૃત્તિ અવશ્ય હોય એમ કહેવાય

પણ પ્રવૃત્તિ-રૂચિવાળાને મંદતામાં=શરૂઆતમાં ગુણા ન પણ હોય છતાં તે ગુણાનું કારણ કહેવાય. તેથી જ વ્યવહારને નિશ્ચયનું કારણ બતાવો છે અને નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ, તેથી જ ગૃહસ્થકેવળીને દેવો વેષ આપતા તેઓ તરત સ્વીકારી લે છે.

વ્યવહાર વગર એટલે કે પ્રવૃત્તિ અને તજજન્ય રૂચિ વિના નિશ્ચય બહુધા પમાતો નથી. જે જે આરાધના ન કરતો હોય તેનો તેને પરિણામ કદાપિ જાગતો નથી. તપ કરે તો તપનો પરિણામ જાગે, સંસ્કાર પડે.

(૧) આચારચુસ્તતા એ નિશ્ચયનું-ગુણાનું કારણ છે.

(૨) આચારદૃઢતા એ રૂચિનું કારણ છે.

(૩) આચારચુસ્તતા એ દર્શન-ચારિત્રમોહનીયના ક્ષયોપશમનું કારણ છે.

(૪) આચારચુસ્તતા એ સમ્બંધાનના ફળરૂપ છે તેથી જ્ઞાનાવરણના ક્ષયોપશમને પણ કરે છે.

(૫) આચારચુસ્તતા એ સત્કાર્યમાં શક્તિનું સ્કુરણ હોવાથી અંતરાયના ક્ષયોપશમનું પણ કારણ બને છે.

એક નિયમ એવો પણ છે કે દર્શન-ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમના કારણથી યુક્ત જે જ્ઞાનાવરણાદિ કર્મ ક્ષયોપશમના કારણ હોય તે સર્વ કર્મના ક્ષયોપશમ-ક્ષયના પણ કારણ હોય છે. અહીં દર્શન-ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની યુક્તતા એટલા માટે કહી કે તે હોવાથી વિવેક-ગુરૂપરતંત્રતા-સમ્કૃપણું આવે છે. આ આવતા જ્ઞાન ભણવું વગેરે જે પણ કિયા-અનુઝાન કરીએ તે સર્વકર્મક્ષય-ક્ષયોપશમનું કારણ બને જ.

માટે (૧) આચારચુસ્તતા એ મોક્ષમાર્ગ છે. (૨) પંચાચાર એ મોક્ષમાર્ગ છે. (૩) નિશ્ચય-ગુણસ્વરૂપ મોક્ષના અસાધારણ કારણરૂપ વ્યવહાર એ મોક્ષમાર્ગ છે.

વ્યવહાર અર્થાત् પંચાચારના પાલનથી જ અસંઘબહુભાગ જીવો મોક્ષે જતા હોય છે. એક અસંઘાતમો ભાગ જ મરૂદેવા માતાની જેમ કે અન્યલિંગ સિદ્ધ થનાર હોય છે.

તેથી જેને મોક્ષ સુધી પહોંચવું હોય, આગળ સ્વાભાવિક આરાધના જોઈતી હોય તેણે આભવમાં અનિષ્ટાએ પણ આચારમાં પ્રવૃત્ત બનવું જોઈએ. અનિષ્ટા એ પણ જેટલું કરશું તેટલા વધુ સંસ્કારો પડશે, દઢ બનશે. વ્રત-પચ્ચકખાણ-જ્ઞાન-તપ ઇષ્ટા હોય તો જ કરવાના તેમ નહીં પણ મન મારીને પણ લેવાના-કરવાના-પાળવાના. પ્રશ્ન :- અનિષ્ટાએ કરીએ તો તે કાર્યમાં વેઠ ન ઉત્તરે ?

ઉત્તર :- ના, બીજો કોઇ આપણાને પરાણો કરાવતો હોય ત્યાં હજુ વેઠ ઉત્તરવાનો સંભવ છે અહીં તો આપણો જ આપણા મનને સમજાવીને-મનાવીને-મારીને કરવાનું છે.

તેથી જેમ જેમ આચારપાલનમાં ઉદ્યુક્ત બનશું તેટલી રૂચિ-ઇષ્ટા જાગશે, કિયામાં ઉપયોગ આવશે અને આત્મામાં શુભ સંસ્કારો પડશે જે ભવાંતરમાં આત્માને ઉર્ધ્વગતિમાં સહાયક બનશે.

•\*• •\*• •\*•

## જીવનમાં જરૂર પુણ્યની કે ધર્મની ?

દરેક કાર્યની પાછળ ઉદેશ ધર્મનો રાખવાનો કે પુણ્યનો ? જવાબ આપતા પહેલા બીજો પ્રશ્ન, જરૂરિયાત પરચૂરણની કે પાંચસો રૂપિયાના નોટની ? કહેવું પડે કે જોઈએ તો પાંચસો રૂપિયા પરંતુ તે ન મળે ત્યાં સુધી પરચૂરણથી જ કામ ચલાવવું પડે. તેમ જીવનમાં જરૂર તો ધર્મની જ પરંતુ ધર્મ કરવા માટે ય પુણ્યની જરૂર પડે છે. કારણ કે આરાધના-સાધના કરવા માટે જોઈતા સંયોગ-સામગ્રી પુણ્યને આધીન છે. ધર્મ કરવાની ગમે તેટલી છચ્છા હોય પરંતુ જો પુણ્ય માયકાંગલું હોય તો છચ્છા છચ્છારૂપ જ રહે છે પ્રવૃત્તિરૂપ બની શકતી નથી.

મનુષ્યભવ મળે પુણ્યથી, પાંચે ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પુણ્યથી, આર્થિક-આર્થિક પણ પુણ્યથી, મજબૂત સંઘયણ અને સાનુકૂળ સંયોગો બધું જ પુણ્યથી પ્રાપ્ત થાય છે. અલબજ્ઞ પુણ્યને ઉત્પત્ત કરનાર ધર્મ જ છે.

ધર્મ કરવા માટે પુરુષાર્થ જોઈએ તે પણ નિર્વિવાદ વાત છે. પરંતુ જ્યારે પુરુષાર્થ પાંગળો હોય ત્યારે પુણ્ય કામ લાગે છે. ધર્મના હિસાબ માંડો તો ઉત્તમ પણ તે ન મંડાયાં ત્યારે પુણ્ય/પાપના હિસાબ માંડો. દરેક પ્રવૃત્તિમાં પુણ્ય-પાપનો વિચાર કરવાનો. હું કોઇને અશાંતા આપીશ તો મને અશાંતા મળશે. હું કોઇને અસમાધિમાં

निमित्त बनीश तो मने समाधि नहीं भणे. आवा विचार करવाथी  
आत्मा पापथी निवृत्त थाय छे. जेनाथी पाप बंधाय ते प्रवृत्त्यादि  
छोडा दे छे अथवा पश्चात्ताप द्वारा तेने निर्बंण बनावे छे.

आम पुष्यनी द्रष्टिथी धर्म करतां रस जगतां ज्ञव धर्म  
आत्मद्रष्टिथी करतो थाय छे. सेवा करवाथी कर्मनो क्षयोपशम थाय  
आवुं जे न जाणो तेने अभ कहेवुं पडे के 'तुं कोइनुं करीश तो कोइ  
ताहुं करशो.' अहीं तेने धर्मनी द्रष्टि नथी पुष्यनी छे. जेने आत्मानी  
द्रष्टि न जाणी होय ते समाजमां प्रतिष्ठा भणशे भाटे भणो तो पण  
चाले. भणता भणता आगण आत्मद्रष्टि आवे. जेम नाना बाणकने  
शरुआतमां प्रलोभनथी स्कूल-पाठशाळामां भोकलाय, भणावाय  
अने आगण जता प्रलोभन धूटी जाय अने भणावानुं चालु थए  
जाय तेम ज्यां लगी आत्मद्रष्टि-भोक्षद्रष्टि-धर्मद्रष्टि न आवे, न  
केणवाय त्यां पुष्यद्रष्टिथी काम करवानुं. धर्मना प्रतापे परमात्मा  
भणे तेम पुष्यना उद्ये पण परमात्मा भणे. तेथी धर्म भाटे न थाय  
तो पराणो पुष्य भाटे पण प्रवृत्ति करवानी.

शास्त्रमां अधमाधमादि छ मकारनों पुरुषो बताव्या छे.  
तेमांथी जे आलोक परलोक बने बगाडे छे ते अधमाधम छे. (२) जे  
परलोकनी चिंता कर्या वगर भात्र आलोकने साचवी ले छे, भोग  
सुखोमां भस्त बने छे ते अधम छे. (३) जे परलोकना विचार साथे  
आलोकनी स्फृहावाणो छे ते विमध्यम. (४) जे आलोकनुं गौणा  
करीने अर्थात् थोडुं सहन करीने भोजशोभ ओछा करीने परलोकनो  
विचार करे छे ते मध्यम छे. (५) जे भात्र भोक्षनो विचार करी अहीं  
भोगसुखोमां लेपातो नथी, कर्तव्य अदा करी लेतो होय ते उत्तम छे  
अने (६) जे स्वभावथी ज फृतार्थ होवा छतां बीजाने धर्मोपदेश

આપે છે તે પરમાત્મા ઉત્તમોત્તમ છે.

આમાં પહેલાં બેમાં ન ધર્મદ્રષ્ટિ છે, ન પુણ્યદ્રષ્ટિ છે.

પાંચમાં નંબરના આત્માઓ ધર્મદ્રષ્ટિવાળા છે. છઠા નંબરના આત્મા સ્વરૂપસ્થ-પરોપકારી છે. જ્યારે ત્રીજા-ચોથાવાળા જીવો પુણ્યદ્રષ્ટિવાળા છે. તેઓને આગળ જતાં આત્મદ્રષ્ટિ આવે.

મોક્ષની દ્રષ્ટિ સાથે પુણ્ય મળતું જ હોય છે. પુણ્ય વગર ક્યાંય ચાલી શકે તેમ નથી. આપણા જીવનની બાહ્ય-આભ્યંતર બને જરૂરિયાતો માટે ઓછે વત્તે અંશે પુણ્યની આવશ્યકતા રહેવાની જ. જ્યાં લગી પુરુષાર્થપ્રધાન જીવન ન બને ત્યાં સુધી પુણ્યપ્રધાન બનાવવાનું.

છેલ્લે આપણી કિયાઓ ધર્મમય બને તો સૌથી ઉત્તમ, ન બને તો પુણ્યમય બનવી જ જોઈએ. જે જે ધર્મના સ્થાનો છે તે જ પુણ્યના પણ છે. બનેમાં માત્ર દ્રષ્ટિનો ફેર છે.



## જેવી કરો કિયા તેવું મેળવો ફળ

આપણો જીવ સંસારમાં ભવોભવથી ભમી રહ્યો છે, રખડી રહ્યો છે. તેમાં કાચિક કે વાચિક કરતાં માનસિક કારણ મોટું હોય છે. વાધિ કે ઉપાધિ કરતા આધિ મોટો ભાગ ભજવતું હોય છે. બાધ્ય પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય તેનાથી કાંઈ જાગો ફરક નથી પડતો, જો મનઃસ્થિતિ સમતુલ્યિત રહેતી હોય તો. બહારની અંધાધૂંધીમાં જો મન ભણે તો જ રાગ-દેખ દ્વારા સંસારનું પરિલખમણ ચાલુ રહે છે. ઘડિયાળનું લોલક જ્યાં સુધી આમ તેમ ફરે છે ત્યાં સુધી જ ઘડિયાળ ચાલુ રહેતી હોય છે.

આપણો આપણી મનઃસ્થિતિ તપાસવાની છે કે તેને શું જોઈએ છે ? તેની છચ્છા શું છે ? કયા કારણો તે પ્રસંગો આવતા રાગ-દેખ, હર્ષ-શોક, આનંદ-ઉદ્ઘેગ કરી બેસે છે ? તેનો જવાબ આપતા શાસ્ત્ર કહે છે, અનંતકાળના સંસારમાં જીવ દુઃખદ્વિદ અને સુખલિપ્યુ રહ્યો છે અર્થાત્ દુઃખનો દેખી અને સુખનો લાલચુ છે. દુઃખ તેને સ્વખભાં પણ આવે તો નથી ગમતું અને સુખ તેને દરેક પરિસ્થિતિમાં જોઈએ છે. આટલો બધો દુઃખ પ્રત્યે અણાગમો અને સુખની તીવ્ર આકંશા હોવા છતાં તેને પ્રતિકૂળતાઓ જ મળે છે. દુઃખો જ સામેથી આવે છે. અનુકૂળતા ભાગ્યે જ આવે છે. સુખો જલ્દી મળતા નથી અને જે મળે છે તે કયાં સુધી ટકશે તેની ખાત્રી નથી હોતી.

આવું બનવાની પાછળ કારણ એ છે કે આપણી જેવી ઇચ્છા છે તેવો પ્રયત્ન નથી. ઇચ્છા કંઈક હોય અને પ્રયત્ન બીજી તરફનો હોય તો કદી ઇચ્છિત ફળ મેળવી શકાતું નથી. ડોક્ટર બનવું હોય અને કોમર્સની લાઇન લે તો ન ચાલે, દૂધપાક બનાવવાની ઇચ્છા હોય અને દૂધમાં મીહુ નાંખે તો ન ચાલે. ઇચ્છા પ્રમાણોની જ પ્રવૃત્તિ કાર્યસાધક બને છે.

૧) દુઃખ નથી જોઈતું તો કોઈને પણ દુઃખી ન કરવા. કાયિક, વાચિક કે માનસિક કોઇ પણ પ્રકારે બીજાને દુઃખ થાય, પીડા થાય તેવું ન કરવું. દુઃખ આપશો તો દુઃખ જ મળવાનું, બીજાને અશાંતિ-અસમાધિનું દાન કરનારને અશાંતિ-અસમાધિ જ મળવાની. કાયદો છે જેવું આપશો તેવું મળશે. વાવો તેવું લણો, બાજરી વાવીને ઘઉં કદી મળી શકતા જ નથી.

બીજાને આંધળા કહો, બોબડા કહો તેનાથી તેને ક્ષણિક દુઃખ પરંતુ જાતને ભવોભવ આંધળાપણાનું, બોબડાપણાનું કર્મ બંધાય. બીજો એકાદ ટકો દુઃખી થાય પણ આત્મા ૧૦૦% દુઃખી થવાનું પાપ બાંધે. કથાનક આવે છે ને મા ઘરે આવવામાં મોડી પડી. વહેલા આવેલા દિકરાએ ભૂખના કારણો ગુસ્સામાં માને કીધું - 'ક્યાં શૂલીએ ચઢવા ગઈ'તી ?' ગુસ્સામાં આવેલી માતાએ પણ સામુ વાણ્યું - 'તારા હાથ શું કપાછ ગયા હતા ? ઉપર શીકામાં તો રોટલા મૂકેલા છે.' આટલા જ વાક્યે પછીના ભવમાં દીકરાને ફાંસીએ ચઢવું પડ્યું અને શેઠની પુત્રી બનેલ માતાના હાથ ઘરેણા લેવા માટે ચોરોએ કાપી નાંખ્યા. તેથી પ્રથમ નંબરે બીજાને દુઃખ પહોંચાડવું નહીં. પોતાની ગેરસમજના કારણો પામે તે વાત જુદી.

૨) સુખ જોઈએ છે તો પોતાના જીવનને પાપમુક્ત બનાવો. જેટલા બિનજરૂરી છોડી શકાય તેવા હોય તે પાપોને છોડી દેવા, ઓછા કરવા અને જે નથી છોડી શકાય તેવાનો પશ્ચાત્તાપ કરો, તેમાં વિવેક-જ્યષ્ઠા રાખો. ધંધાદિના કારણો રાત્રિભોજન કરવું પડતું હોય તો પણ એક ટંકથી વધારે ન ખાવું તેવો નિયમ રાખવો. તેથી રાત્રિભોજન એ પાપ છે તેવું સતત મનમાં રહ્યા કરશે અને પોતાને ખાવું પડે છે તેનો પશ્ચાત્તાપ રહેશે. તેનાથી જ્યારે સંયોગો અનુકૂળ થશે ત્યારે રાત્રિભોજન ઝટ છોડી શકાશે.

જીવનમાં જેટલા પાપો ઓછા થશે તેટલા દુઃખો ઘટશે કારણ કે નિયમ છે. ‘પાપ કરવાથી દુઃખો જ આવવાના-વધવાના. સુખ જોઈએ તો પાપો છોડવા જ પડે.’ મીઠાશ જોઈએ તો પાકી કેરીમાં જ મળે. આંબલી ખાવાથી ખટાશ જ મળે.

જીવનમાં શક્ય તેટલા પાપો ઓછા કરવા અને જે કરવા જ પડે તેમાં પશ્ચાત્તાપ કરવો, ઉંખ રાખવો તેનાથી દુઃખ ઓછા થશે.

આ બનેની પૂર્વ આખા દિવસમાં ૨૪ કલાકમાં પોતે શું કર્યું તેની નોંધ રાખવી જોઈએ. કેટલું સારુ-જરૂરી, કેટલું ખોટું-બિનજરૂરી છે તે તપાસવું જોઈએ. દુકાનમાં પણ હિસાબના ચોપડા હોય છે. કાચા-પાકા કે નોંધપોથી પણ હોય. આ રાખે તો જ જમા-ઉધાર, નફા-તોટાનો ખ્યાલ રહે, નહીં તો દુકાન ઉઠતા વાર ન લાગે. તેમ ૧૮ પાપસ્થાનકોની નોંધ રાખવી જોઈએ. તેને યાદ કરવા જોઈએ. તેમાં આવશ્યક-અનાવશ્યકનો ભેદ પાડવો જોઈએ. તેમાંથી કેટલા છોડી શકાય તેમ છે તેનો વિચાર કરવાનો, ન છોડી શકાય તેમાં

પણ કેટલી જ્યણા થઈ શકે તેમ છે તે વિચારવું. દા.ત. કાચા પાણીનો ઉપયોગ સંદર્ભ બંધ નથી થઈ શકવાનો તો આવશ્યકતાથી વધારે ઉપયોગ ન કરવો. ગેસ-સ્ટેવ ચાલુ કરવા જ પડે છે તો પૂંજ્યા સિવાય ન પ્રગટાવવા.

ગુંડાને ઓળખો તો તેનાથી સાવધ રહી શકો તેમ ૧૮ પાપસ્થાનકોના કારણો જ આખો સંસાર ચાલે છે. સંસારનો બધો વ્યવહાર પાપમય છે, ઉંઘે માર્ગ દોરી જાય છે. હવે જો તે પાપસ્થાનકોને ઓળખીયે નહીં તો કેમ ચાલે ? કાદવવાળા રસ્તે ચાલવું હોય તો સડકની જેમ સડસડાટ ન ચલાય. સાચવીને કાળજીપૂર્વક ચાલીએ તો જ વ્યવસ્થિત પહોંચાય તેમ પાપમય સંસારમાં જો ઉપયોગ-જ્યણા-વિવેક રાખીએ તો જ સાધ્ય સુધી પહોંચી શકાય. માટે પ્રતિકમણ કરનારે અને ન કરનારે પણ ૧૮ પાપસ્થાનકોની નોંધ રાખવી. રોજ છિસાબના ચોપડાની જેમ તે જોઈ જવી. થયેલા પાપોની માઝી માંગવી-મિશ્છામિ દુક્કડમ્ય દેવું. તેનાથી આ છોડવા જેવું, ત્યાગવા જેવું છે તેવું મનમાં સતત યાદ રહે. શક્ય તેટલા પાપ છૂટતા જાય અને ન છૂટે તેની પરમાત્મા પાસે માઝી માંગવી.

નાના પાપો જ મોટા પાપો કરાવે છે માટે તે પહેલા છોડતા જવા. જેના જીવનમાં નાનું પાપ ન આવે તેનામાં મોટું ક્યારેય ન આવે. મોટું પાપ તો પાપ તરીકે લાગે, કરતા આત્મા દુલ્ભાય-ગલ્ભરાય પરંતુ નાનું પાપ પાપરૂપે લાગતું જ નથી તેની તેના તરફ ઉપેક્ષા થાય છે. ‘આટલામાં શું થઈ જશે’ આ વિચાર જ તેની તરફ આંખમિચામણાં કરાવે છે. પરંતુ નાવડીમાં પડતું એક નાનું કાણું જ આખી નાવડીને દુલ્ભાડી દે છે, બાળપણમાં નાની ચોરી કરતાં બાળકને

મા-બાપ અટકાવે નહીં તો તે આગળ જઈને મોટી ચોરી કરતો થાય  
તેથી નાના પાપ અટકાવનાર મોટા પાપમાં કદી પડતો નથી.

દવા કરતાં પથ્થથી આરોગ્ય જલ્દી મળે છે તેમ પાપ છૂટતા  
જશે તો દુઃખો આપોઆપ ઓછા થશે માટે રોજ સવાર-સાંજ પાપને  
ઘટાડવા છે આવું સંકલ્પપૂર્વક યાદ કરવાથી આત્મા હળવો બનશે,  
ભવાંતરમાં પરમાત્મા-તેમનો ધર્મ મળશે. તે માટે પાપ ઓછા કરવા  
પ્રયત્ન કરવો.



## ઈરણા છે કાર્યસાહિકા

ગુણો કોને આધીન ? કોના આધારે ઉત્પત્ત થાય ?  
 ઇચ્છાથી, ભાવનાથી કે નિમિત્તથી ?  
 ગુણોને મેળવી આપવામાં મુખ્ય ભાગ ભજવે છે ઇચ્છા-  
 ભાવના.

ઇચ્છા-ભાવના ન હોય તો ગમે તેવા સારા શુભ નિમિત્તો  
 મળે છતાં ગુણ ઉત્પત્ત ન કરી શકાય. દોષ જ ઉભો થાય-વધે. અફળક  
 સંપત્તિ મળી હોય, ધર્મ અનુષ્ઠાનના પ્રસંગો આવ્યા હોય છતાં જો  
 તેમાં લાભ લેવાની, સંપત્તિ વાપરવાની ઇચ્છા ન હોય તો ગુણ ન જ  
 થાય બલ્કે પાપકાર્યમાં વપરાઈને દોષ જ ઉભા કરે તેની સામે નિમિત્ત  
 ન મળે પરંતુ પોતાના ફદ્દયમાં ઇચ્છા-ભાવના હોય તો ગુણ થાય.  
 દા.ત. કોછ માણસ એવી ભાવના રાખે કે “ગમે તેવી ક્ષેત્ર-કાળ-  
 વ્યક્તિ-પુદ્ગલકે શરીરજન્ય પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારે હાય-વોય,  
 પ્રતિકાર ન કરતા સહન કરવું.” આ માણસને અતિપુણ્યનો ઉદ્ય  
 હોય તો કદાચ જીવનના અંત સુધી કોછ રોગ-પ્રતિકૂળતા ન આવે  
 તો ય તેને નિરંતર પુણ્યબંધ ચાલુ જ રહે. આનાથી પ્રતિકૂળતા આવતા  
 દુધ્યાન ન થાય અને અનુકૂળતામાં જે શક્ય હોય તે અમલમાં આવે.  
 આ ન હોય તો દુર્ગુણો ન જાય, સત્ત્વ ન પ્રગટે.

સત્તવને પ્રગટ કરવા માટે પણ પ્રવૃત્તિ કરતાં ઈચ્છા-ભાવના મુખ્ય કારણ છે. કિયાથી પ્રગટતું સત્તવ એક આની હોય છે જ્યારે ભાવનાથી ૧૫ આની સત્તવ વિકસે છે. તેથી દરેક કાર્યમાં આત્મગુણોને મેળવવાની-કેળવવાની ભાવના પણ રાખવાની ઘણું સહન કરવાની ભાવના હોય ને કોઈ બે-ચાર અપશબ્દો સંભળાવે તો કાંઈ ન થાય, ઉશ્કેરાટ ન આવે અને માનની ઈચ્છા હોય ને કોઈ સ્હેજ અપમાન કરી જાય તો તરત ઉદ્દેગ થઇને ઉભો રહે. તેથી જેને શાંતિ-સ્વસ્થતા જોઈતી હોય તેણે ગુણોની ઈચ્છા-ભાવના રાખવાની.

(૧) પ્રવૃત્તિ તો નિભિત્ત-સંયોગ હોય તો થાય, ન હોય તો ન થાય. અર્થાત્ પ્રવૃત્તિ પરિસ્થિતિને પરાધીન છે જ્યારે ઈચ્છા-ભાવના દરેક સ્થિતિમાં કરી શકાય છે. તેને માટે કોઈ બાધક બની શકતું નથી. પ્રવૃત્તિ એ બહારની વસ્તુ છે, તેને બહાર રહેલા કે જેઓ પોતાને આધીન પરતંત્ર નથી તેઓ અટકાયત કરી શકે છે. જ્યારે ભાવના ઈચ્છા કરવી તે અંદરના પરિણામો છે જે પોતાના હાથમાં છે. લક્ષ્ય થતાં પરમાત્માની પૂજા કરવા ન જઈ શકાય પરંતુ પથારીમાં રહ્યા શત્રુંજ્યની ભાવયાત્રા કરતા કોઈ રોકી શકતું નથી.

(૨) પ્રવૃત્તિ પરિભેત થઈ શકે છે અને ભાવના જેટલી રાખવી-કરવી હોય તેટલી કરી શકાય છે. માસક્ષમણાના પારણે માસક્ષમણા ન કરી શકાય પરંતુ ત કરવાની ભાવના રાખી શકાય છે, કરી શકાય છે. સંયમ કદાય કર્મના ઉદ્યે ન લઈ શકાય તો ય ભાવના તો મનમાં સતત એ જ રહે ‘સંયમ કબહી મિલે....’

આ ઈચ્છા / ભાવના પ્રવૃત્તિ ન હોવા છતાં પુષ્યબંધ કરાવે, કષ્યોપશામ આપે. આનાથી વિપરીત ઈચ્છા હોય તો પ્રવૃત્તિ ન કરો

ઇતાંય પાપ બંધાય. તંદુલિયો મતસ્ય એક પણ માછલું મારવાની પ્રવૃત્તિ કરતો નથી ઇતાં ઇચ્છાને કારણો જ નિરંતર પાપબંધ કરે છે.


પ્રવૃત્તિ પણ જો ભાવના વગર કરાય તો સંશો તૂટતી નથી, દોષો મોળા પડતા નથી. જ્યારે પ્રવૃત્તિમાં ભાવ મળે છે ત્યારે જ તે યોગ્યફળ આપી શકે છે.

તેથી આપણી ઇચ્છા-ભાવના આચારોમાં, પ્રવૃત્તિમાં, ગુણો કેળવવામાં, સહન કરવામાં રાખીએ તો સત્ત્વ વિકસે. પ્રસંગ આવતા કોઈ મુશ્કેલી ન પડે. કૃષ્ણ મહારાજા પેલી મરેલી કૂતરીની તીવ્રદુર્ગંધ શી રીતે સંહન કરી શક્યા ? અત્યાર સુધી કોઈ દિવસ આવો પ્રસંગ આવ્યો નથી ઇતાં શી રીતે સ્વસ્થ રહી શક્યા ? ને તેના દાંતની પ્રશંસા કરી ? સહન થયું કારણ કે તે ભાવનાશીલ બન્યા હતા, વિચારશીલ થયા હતા. તે ભાવનાથી ક્ષયોપશમ / સત્ત્વ ઉત્પન્ન કર્યું હોય છે માટે કરી શક્યા.

અનિન્શાર્મા ઉપર ગુણસેનને ક્યારેય દ્રેષ-અરુચિ ન આવી કારણ ભાવનાથી ભાવિત હતા. હલા ભવથી ભાવિત બન્યા તો મરણાંત કષ્ટમાં પણ દ્રેષ ન થયો.

આમ ભાવનાથી સર્વત્ર આરાધના થઇ શકે છે અને નિમિત્ત મળતા પ્રવૃત્તિથી આરાધના થાય છે. સત્ત્વ વિકસાવવા માટેનો આ સુંદર રસ્તો છે. કારણ કે સત્ત્વની વૃદ્ધિ શક્તિ પર નહિ પણ આંતરિક ક્ષયોપશમ પર આધારિત છે અને આંતરિક ક્ષયોપશમ ઇચ્છા / ભાવનાને આધીન છે.

આનો અર્થ એ નહિ કે પ્રવૃત્તિ ન કરવી, માત્ર ભાવનામય જીવન બનાવવું. પ્રવૃત્તિ વિનાની ભાવના લાંબો સમય ટકી શકતી



નથી. ભાવનાને ટકાવી રાખનાર છે પ્રવૃત્તિ. કદાચ ઇચ્છા ન હોય  
તો ય પ્રવૃત્તિ કરતા રહીએ તો ભાવના પ્રગટ થાય પરંતુ પ્રવૃત્તિ  
પરિમિત થતી હોય છે જ્યારે ઇચ્છા ભાવના સદા રાખી શકાય છે  
તેથી તેની અહીં મહત્ત્વ બતાવી છે.

- સારાંશ-આરાધનાના બે પાયા
- (૧) ઇચ્છા / ભાવના સતત રાખવી.  
(૨) સંયોગ મળતાં પ્રવૃત્તિ કરવી.



## ભાવે ભાવના ભાવીઓ

મૈત્રી વગેરેની વિચારણા કરવી તે ભાવના છે. તેનાથી જે કર્મ ક્ષયોપશમ થાય છે તેને ભાવ કહેવાય છે.

ભાવના એ ઉપયોગ રૂપ છે, ભાવ એ ક્ષયોપશમ રૂપ છે. છન્દસ્થ આત્માને સ્નેહ-પરિણામયુક્ત ભાવના હોય છે.

મૈત્રી જ્યારે ઉપયોગ રૂપે ન હોય, પણ ક્ષયોપશમરૂપે હોય ત્યારે તેને મૈત્રીભાવ કહેવાય છે. મૈત્રીભાવ ઉપયોગરૂપ ન હોવાથી ત્યાં સ્નેહ પરિણામ નથી. છન્દસ્થને ભાવના ઉપયોગરૂપ હોય છે, અને ભાવ લબ્ધિરૂપે હોય છે.

એક સમયે ભાવના એક હોય છે, જ્યારે ભાવ એકસાથે ચારેય-બારેય હોય છે.

છન્દસ્થને જે ભાવો ક્ષયોપશમરૂપે છે તે ભાવો કેવળજ્ઞાનીને ક્ષાયિકભાવ રૂપે થાય છે કારણ કે કેવળજ્ઞાનીને ક્ષયોપશમ ભાવ હોતો નથી.

કેવળજ્ઞાનીનો ઉપયોગ કાયમી છે, પણ એ ઉપયોગમાં સમભાવરૂપ (ઉદાસીનભાવરૂપ) ભાવ છે. કેવળજ્ઞાનીને ચારે ભાવનામાંથી એકે ભાવના નથી છતાં ચાર ભાવનાના ફળ રૂપનો બ્યવહાર અને આંતરિક ક્ષાયિકભાવ તો ચારેયનો હોય છે. અભવસ્થ સિદ્ધ ભગવંતો બ્યવહારથી અતીત છે. માટે કાર્યરૂપ એકે ભાવ તેમને

ન હોય.

કેવળીને મધ્યસ્થ ભાવના ન હોય કારણ કે મધ્યસ્થભાવના એટલે મૈત્રીપરિણામના કારણો ઉત્પત્ત થયેલ સ્નેહપરિણામને અવિનયી જીવો પ્રત્યે અટકાવવાની પ્રવૃત્તિ, સ્નેહપરિણામનો નિગ્રહ. આ ભાવના છિદ્રસ્થને જ હોય.

કેવળજ્ઞાનીને કોઈ શુભ કે અશુભભાવના હોતી નથી. કેવળજ્ઞાનીને કોઈ અશુભભાવ હોતો નથી. સર્વ શુભભાવોની પૂર્ણતા કેવળજ્ઞાનીમાં ક્ષાયિકભાવ રૂપે હોય છે.

જેમ એક મતે કેવળજ્ઞાનીને મત્યાદિ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે, પણ નાચ નથી થતાં. તેવી રીતે મોહનીયના ક્ષયોપશમ ભાવજન્ય ક્ષમાદિ ગુણો અને મૈત્રી આદિ ભાવો પણ મોહનીયનો ક્ષય થતાં ક્ષાયિકભાવથી વીતરાગતારૂપ સ્વરમણતારૂપ ચારિત્રમાં અંતર્ગત થછ જાય છે ત્યાં મતિજ્ઞાનની જેમ જુદા બેદરૂપે રહેતા નથી.

મતિજ્ઞાનનો સર્વવિષય કેવળજ્ઞાનમાં છે. મૈત્રીભાવનો સર્વવિષય વીતરાગતામાં છે. એનાથી એકે વિરુદ્ધ ભાવો નથી.

આમ ચાર જ્ઞાનના ન્યાયથી પણ મૈત્રી આદિ ભાવો લખિ રૂપે ક્ષાયિકભાવથી હોય છે તેવું જણાય છે. ઉપયોગમાં કેવળજ્ઞાનીને સ્નેહપરિણામરૂપ ભાવનારૂપે નથી.

કેવળીને મોહનીયના ક્ષયથી આત્મરમણતારૂપ વીતરાગતારૂપ સંયમ છે. તપ-નિયમ-સંયમ પણ આ વીતરાગતામાં અભેદરૂપે પરિણામેલા છે.

બ્યવહારથી કેવળીને તપ, નિયમ અને સંયમ પ્રવૃત્તિરૂપ હોય છે. બાધક મોહનીય તત્ત્વનો ક્ષય હોવાથી તપ, નિયમ કે સંયમના પરિણામોની વધઘટ નથી. ત્રણોનો પ્રકૃષ્ટ પરિણામ છે. એનાથી

વિપરીત પરિણામ નથી. માટે તપ વગેરેનો અભાવ કે મંદતા નથી.

અર્થાતું જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયના ક્ષયોપશમથી જે જે ગુણો ઉત્પત્તિ થાય છે તે બધા તે તે કર્મના ક્ષયથી સર્વાશ યોગ્યતારૂપે પ્રગટ છે. ફક્ત ભેદરૂપે કે દોષરૂપે નથી હોતા. ગુણરૂપે વ્યાવહારિક રીતે યથાયોગ્ય હોય છે માટે બાધકના અભાવથી, વિપરીત પરિણામના અભાવથી, નિશ્ચયથી બધા ગુણો યોગ્યતારૂપે છે. (વ્યવહારથી બાધ્ય પ્રવૃત્તિરૂપે યથાયોગ્ય પ્રવર્ત છે.) માટે ઘાતીકર્મના ક્ષયોપશમની જેમ ક્ષયથી ભવસ્થ કેવળજ્ઞાનીને બધા ગુણો હોય છે તેમ જણાય છે.

•✽• •✽• •✽•

## ઉપાસ્ય પ્રથમ નજીકળા

ઉપાસના-ભક્તિ પહેલા નજીકની હોય પછી દૂરની કરાય. નજીકની ઉપેક્ષા કરીને દૂરવાળાની કરાતી સેવા-ભક્તિ વાસ્તવિક નથી હોતી. પોતાની પિતાની આમન્યા સામાન્ય ન રાખે અને કાકાની વાત માને તે ન ચાલે, નજીક રહેલ દેરાસરના દર્શન-પૂજન ન કરે અને બહાર તીર્થોની યાત્રા કરે તે ન ચાલે, નીચેનું ભણ્યા વગર ઉપરનું ભણવા માંડે તે ન ચાલે. આ બધી બાબતો એક જ વાત કહે છે કે નજીકનું પહેલું ઉપાસ્ય છે. પછી જ દૂર જવાય....

પરંતુ આપણાને ‘દૂરના કુંગાર રળિયામણા’ લાગે અને નજીકના કાંકરા લાગે છે કારણ દૂરવાળાના માત્ર ગુણો જ દેખાય છે જ્યારે સાથેવાળા જોડે અતિનિકટતાને કારણો દોષો જ દેખાય છે અને અવજ્ઞા થાય છે, અનાદર કરાય છે. પરંતુ જેને આરાધના કરવી છે તેણો સાથેવાળા પર આદર-અહોભાવ રાખવો પડે. દૂરવાળાની સહાય ભક્તિ કરો તેનો વાંધો નહિ પરંતુ નજીકવાળાની ઉપેક્ષા તો ન જ કરાય.

આપણાને સાથેવાળા ઉપર જેટલા કારણોથી અહોભાવ ન હોય તેનો વિચાર કરવાનો અને બીજુ બાજુ એના વ્રત-નિયમાદિ ગુણો નજર સામે લાવવાના. બસેમાંથી કોણ ચઢે ? તેનો દોષ કે ગુણો ? કરોડનું આભૂષણ હોય ને આગળ-ઉપર ધૂળ ચઢી ગઈ

હોય તો કિંમત કેટલી ઘટે ? અજાનીની દ્રષ્ટિએ ઘટે પરંતુ જાનીની દ્રષ્ટિએ કિંમત ઘટતી નથી. તેમ વ્યક્તિતમાં રહેલ દોષ એ આભૂષણ પરના ધૂળ જેવો છે, ધૂળને નજર સામે રાખીને આભૂષણનો ત્યાગ કરીએ તો આપણા જેવો મૂર્ખ કોઈ નહીં.

અહોભાવ ન હોવાના ગ્રણ કારણો છે (૧) ક્યાંક અણાગમો-નફરત હોય (૨) ક્યાંક તેના પ્રત્યે ઉદાસીનતા હોય, અને (૩) ક્યાંક તો અજાન હોય. ગ્રણમાંથી એકેય ચાલી ન શકે. સાધુ-સંધ પ્રત્યેના અહોભાવને બદલે ઉપેક્ષા ભાવ-ઉદાસીનતા આવે તો કર્મરાજી આપણાને ધર્મભ્રષ્ટ કરે. અહોભાવ ન આવતો હોય તો શરૂઆતમાં બનાવ્યી પણ ઉભો કરવો પડે. ગમે તેમ કરીને પણ અહોભાવ જોઈએ.

કૂવો ખોદવા માટે જમીન-માટી ખોદવી જ પડે. પછી ક્યાંક થોડી તો કો'ક જગ્યાએ વધારે પરંતુ ખોદ્યા વગર ન ચાલે પરંતુ પછી પાણી શોધવું પડે કે આપમેળે આવે ? જમીન ખોદ્યા પછી પાણી તો આપમેળે આવશે. તેમ ચારિત્રમોહનીય ક્ષયોપશમ એ પાણી છે અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ એ જમીન ખોદવાના સ્થાને છે. દર્શનનો ક્ષયોપશમ તીવ્ર થયો હોય તો જ ચારિત્રનો ક્ષયોપશમ થાય. તેથી જ કહું ‘સમકિત વિરતિને ખેંચી આણો.’

શ્રદ્ધા-આદરવાળી કિયા સમકિતનું કારણ છે. ધર્મના એક પણ સ્થાન પર અરૂપી હોય તો બધી આરાધના એળે જાય. ઉલ્લાસ લાવવા માટે આરાધકો અને આરાધનાના સાધનો બધા પર આદર / અહોભાવ ઉભો કરવો, એની પ્રશંસા કરવી, એને આદર આપવો.

જેનાથી દર્શનમોહનીય ખપે તેનાથી ચારિત્રમોહનીય કર્મ ખપે છે. ચારિત્ર પરનો આદર દર્શનમોહનીયના ક્ષયોપશમ વગર ન આવે.

જેમ દૂરવાળા કરતા નજીકવાળી વ્યક્તિ વધારે ઉપાસ્ય છે,  
તેમ રોજિંદા જીવનના વ્યવહારો-પાપનિવૃત્તિઓ પર પર્વતિશિ કરતા  
વધારે આદર રાખવાનો. રોજિંદા પર આદર ન રાખીએ તો ફદ્ય  
બુઝું થાય.

જેમ જમીનને કુટીએ તો ઉગવાની યોગ્યતા જાય અને  
ખોડીએ-ખેડીએ તો યોગ્યતા વધે તેમ અનાદર-ઉપેક્ષા રાખીએ તો  
ધર્મની યોગ્યતા જાય અને અહોભાવ રાખીએ તો ધર્મ ઉગે.

વ્યક્તિમાં રહેલ ગુણ જ જોવાય કારણ દોષ એ ક્ષમ્ય છે.  
તેટલા માત્રથી એ વ્યક્તિ ઉપેક્ષણીય નથી બનતી. એક જગ્યાએ  
કવિએ સ્તવના કરતા લઘ્યું કે ‘તે સ્થુલભદ્ર જય પામો જેની ગ્રણ જ  
ભૂલો છે અને તે પ્રભુ મહાવીર જય પામો જેમની છ જ ભૂલો છે.’

ઇચ્છસ્થતાના કારણો જીવનમાં થતી ભૂલો, રહેલા દોષોથી  
તે વ્યક્તિ કાંઈ ઉપેક્ષણીય નથી. જો ઉપેક્ષા કરીએ તો મૈત્રી આદિ  
ભાવનાઓ કરી જ નહીં શકીએ. આગળના ગુણોની યોગ્યતા જતી  
રહેશે અને સાથે જ રહેલા ઉપર અરૂચિ આવશે તો આરાધના પ્રાણ  
વિનાની બનશે. માટે નજીકની ઉપર પૂર્ણ આદર / અહોભાવ  
રાખવો....



# સાધુસેવા સદા ભક્ત્યા

શાસ્ત્રમાં આ વાક્ય છે ‘સાધુસેવા સદા ભક્ત્યા’ સંધ-  
શાસનના જેઓ આધાર છે, આગળ ચલાવનાર છે તે સાધુ-સાધીજી  
મહારાજોની ભક્તિ ઉછૃણતા ફદ્યના ભાવોથી કરવાની. જેમ  
મહાત્માઓ વધારે દેખાય, મળે તેમ આનંદ-ભક્તિ-બહુમાન વધવા  
જોઈએ. તેમની ભક્તિમાં ક્યાંય કચાશ ન રહેવી જોઈએ.

દુનિયામાં ક્યાં જોટો મળે આ પરમાત્માના પંચમહાપ્રતધારી  
મહાત્માઓનો ? આજના આ વિષમ ભોગમય કાળમાં સંસાર ત્યાગી  
સંયમ સ્વીકારવું સહેલું નથી. ત્યાં આ સાધુમહારાજો મસ્તીથી સંયમની  
સાધના કરી રહ્યા છે. આવા મહાત્માઓના દર્શન પણ પૂર્વના પુષ્ય  
વિના મળી શકતા નથી. “સાધુનાં દર્શનં પુણ્યમ्” જેમ દર્શન થતા  
જાય તેમ આનંદ વધવો જોઈએ, ભક્તિ મનમૂકીને થવી જોઈએ.

ભરત-બાહુબલીના જીવ બાહુ-સુબાહુ મુનિને શું મળ્યું ?  
બાહુબલીને અપરાજિત-ચક્રવર્તી કરતાં વધુ બળ અને ભરતને  
અદ્ધીતીય ભોગસુખો અને આરિસાભુવનમાં કેવળજ્ઞાન. ભરચક  
વૈરાગ્ય અને અનાસક્તપણું કોણો આપ્યું ? પૂર્વભવમાં કરેલ ચારિત્રના  
પાલન સાથે સાધુઓની ભક્તિ.

સાધુની ભક્તિથી તીર્થકર નામ કર્મ બંધાય, મહાવૈરાગ્ય

મળે, નિકાયિત કર્મ પણ નાશ પામે.

જીવનમાં સાધુ પર અત્યંત અહોભાવ સાથે ભક્તિમાં ક્યાંય ચૂકવું નહિ ને વિશેષે કરીને વૃદ્ધ અને જ્વાન મહાત્માઓની. તેમને આહારાદિપ્રદાન-શરીરશુશ્વા-સમાધિ આપવા દ્વારા તેમની વિશેષ ભક્તિ કરવી. જેમ કાળે આપેલ દાન મહાન પુણ્ય બંધાવે છે તેમ અશક્તની કરેલ સેવા-ભક્તિ અઢળક પુણ્ય-વિપુલ નિર્જરાનું કારણ બને છે. (સેવા કરનારને ઘડપણ ન આવે. અંત સમય સુધી કોઈ રોગ-બિમારી ન આવે. શરીર સંપૂર્ણ નિરોગી રહે. ભવાંતરમાં પણ પોતે તો નિરોગી રહે પરંતુ પોતાના વિશિષ્ટ પુણ્યથી આજુબાજુવાળા પણ નિરોગી રહે. પોતાને કોઈની સેવા લેવાનો વખત ન આવે તેવું પુણ્ય બંધાય.) તેથી જેને ભવાંતરમાં ઉત્તમકોટિની સામગ્રી / આરાધના જોઈતી હોય તેણે અહીં વૃદ્ધ બિમાર સાધુ ભગવંતની ભક્તિમાં વિશેષ તત્પર રહેવું જોઈએ. જ્વાનની સેવા એ પરમાત્માની જ સેવા છે કારણ પ્રભુનું જ વચન છે. ‘જો ગિલાણ પડિસેવઙ્ગ સો મં પડિસેવઙ્ગ’

બિમારની સેવાના સમયે જો પોતાની આરાધના મુખ્ય કરે તો ધર્મ કરતા છતાં કર્મ બાંધે. ઔચિત્યનો ભંગ એટલે વિવેકનો ભંગ અને જ્યાં વિવેક જાય ત્યાં બધું જ જાય. વિવેકનાશ તે બધા ધર્મથી ભ્રષ્ટ થવાનું કારણ છે. અવસરોચિત કાર્ય કરવું તેનું નામ વિવેક...)

ભક્તિના યોગમાં બાહ્યપ્રવૃત્તિ સંયોગાધીન છે. તેથી જેટલી શારીરિક અનુકૂળતા-પરિસ્થિતિની અનુકૂળતા હોય ત્યાં શક્તિને ગોપવ્યા વિના પૂર્ણ ભક્તિ કરવાની. જ્યાં સંયોગો અનુકૂળ ન મળે ત્યાં પણ આંતરિક પરિણાત્તિ-બહુમાન તો અવશ્ય ઉછ્છળતા રાખવાના. ભક્તિ અને અહોભાવ વિનાની બધી સાધના-આરાધના માણપૂરક

બનતી નથી, માત્ર ખોખું રહે છે, અંદરનો માલ ગાયબ. ભરેલા  
માલવાળા ખોખાની જ કિંમત હોય છે. માત્ર ખોખારૂપ કિયા વિશિષ્ટ  
પુષ્પનું કારણ બનતી નથી.

માટે મહાત્માઓની સેવા-ભક્તિમાં ક્યાંય ઉણાપ ન રાખવી.  
તેઓની કરેલી ઉપેક્ષા જિનાજ્ઞાભંગ કરાવે છે, ચારિત્ર મોહનીય  
બંધાવે છે જેના કારણે ભવાંતરમાં ચારિત્ર તો ઉદ્યમાં ન આવે પણ  
સાધુઓના દર્શન પણ દુર્લભ બને.

•\*• •\*• •\*•

જયણા ધર્મસ્સ જણણી ધર્મસ્સ પાલણી જયણા ।  
તલુઢીકરી જયણા એગંતસુહાવહા જયણા ॥

જ્યષ્ઠા એટલે યતના, કાળજી, સાવધાની ગુણો મેળવવાની,  
દોષો ઘટાડવાની, આશ્રવો ઘટાડવાની, આશ્રવો છોડવાની, એમાં  
પદ્ધ્યાત્તાપની, એમાં અંકુશ રાખવાની, એની પ્રશંસા ન કરવાની  
કાળજી રાખવી તે જ્યષ્ઠા. એ જ રીતે ધર્મસ્થાનોમાં પાપબુદ્ધિ,  
બેકાળજી ન પેસે, અવિવેક, આવેશ ન થાય તેની કાળજીને પણ  
જ્યષ્ઠા કહેવાય. દોષ ન વધે તેની કાળજી, ગુણ ન ઘટે તેની કાળજી  
રાખવી આ રીતે જાતની કાળજી રાખવી, શક્ય એટલી બીજાની  
પણ કાળજી રાખવી તેને પણ જ્યષ્ઠા કહેવાય.

જ્યષ્ઠાથી ધર્મ ઉત્પત્ત થાય છે. એનો અર્થ એ કે જ્યષ્ઠા  
વગર વ્યવહાર ધર્મ હોવા છતાં ભાવધર્મ નથી. ભાવધર્મ ગુણાદોષનું  
જ્ઞાન અને કાળજી આવે ત્યારે આવે છે. જે ગણિતનો જવાબ સાચો  
નહિં તે ગણિત સાચું નહિં. તેમ જ્યાં રાગદ્રેષની હાનિ નહિં, જ્યાં  
ઓચિત્ય નહિં, જ્યાં આશ્રવ-સંવરની પરખ નહિં, જ્યાં આશ્રવના  
ઘટાડાની અને સંવરની વૃદ્ધિની કાળજી નહિં, જ્યાં સ્વ-પરના  
પરિણામની રક્ષા નહિં, જ્યાં અપવાદ-અનાચારનો ભેદ નહિં, જ્યાં  
લાભ-નુકશાનના બળાબળની વિચારણા નહિં, જ્યાં પ્રજ્ઞાપનીયતા  
નહિં, જ્યાં ગીતાર્થતા નહિં, જ્યાં ગીતાર્થને સમજણા નહિં, જ્યાં  
સ્યાદ્વાદ નહિં, જ્યાં એકાંતે ઉત્સર્ગરુચિ કે ઉત્સર્ગની અરુચિ હોય-  
આ બધે સ્થાને જ્યષ્ઠા ન હોય.

જે વક્તિ સારો અને સસ્તા ભાવે માલ લે તે વેપારી કહેવાય. માલની પરીક્ષા ન કરે, ભાવમાં કરકસરન કરે તો વેપારીન બનાય, વેપારી ન કહેવાય. તેમ ધર્મમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સારા-નરસાપણું જોવું પડે, ગૌણ-મુખ્યપણું જોઈએ તો તે ધર્મ જ્યણાયુક્ત કહેવાય.

જેમ વેપારી માલસંગ્રહ કાળજીથી કરે, સંભાળી રાખે, બગડે નહિં, અવસરે કાઢે આ બધી આવડત હોય તે જ સાચો વેપારી બની શકે, તેમ દાનની, શીલની, તપની, ભાવની આરાધના ક્યાં, ક્યારે, કેટલી, કેવી કરવી તે પણ આવડવું જોઈએ તો જ તે ભાવધર્મ બને.... માલ જેમ ખરીદભાવ કરતાં વધારે ભાવથી વેચાણ કરવાથી નફો મળે તેમ દરેક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે જ્યારે ત્યારે કરવામાં જે લાભ થાય તેના કરતાં કટોકટીમાં, વિશેષ અવસરે કરવાથી કેછ ગુણો લાભ થાય. દુંકમાં જ્યણાથી ધર્મ ઉત્પત્ત થાય છે, ધર્મનું પાલન થાય છે, ધર્મની વૃદ્ધિ થાય છે અને એકાંતે સર્વ રીતે જ્યણા સુખ-લાભ આપનારી છે.

સંસારના કાર્યમાં પણ જ્યણા ધર્મને ઉત્પત્ત કરે છે. જેમ ધર્મમાં જીવજંતુ ન થાય માટે વધારે સામગ્રીનો ભરાવો ન કરવો. જીવજંતુ ઉત્પત્ત થાય તેવા ઊંડા ખાડાવાળા-નકશીવાળા ફર્નિચર ન રાખવા, વારંવાર કાજો લેવો, પૂજવું વગેરેથી સાફ રાખવું. આ બધું જીવદયા માટે હોય તો ધર્મ ઉત્પત્ત થાય છે, સંસારની-ધરની શોભા તો આનુષંગિકપણો થાય જ છે.

અભક્ષ ન ખાવું, ન ખવરાવવું વગેરે ખાવામાં રખાતી  
કાળજી આત્મામાં ધર્મભાવના ઉત્પત્ત કરે છે. એ રીતે જીવન  
 વ્યવહારની દરેક ચીજ કે પ્રવૃત્તિમાં જે પાપ કે હિંસાદિ ન થાય, ઘટે

તેવી કાળજી રાખવી તે જ્યણા છે. પાપમાં કરકસર રાખવી તે જ્યણા  
કહેવાય, પાપમાં મોકલાશ-ઉદારતાને અજ્યણા કહેવાય.

જ્યણમાં રહેલ વિવેક, કાળજી, શાનપરિણાતિ જીવન  
વ્યવહારમાં આવે તે કાળજીને જ્યણા કહેવાય. આમાં ક્યાંક વધારો  
થાય, ક્યાંક ઘટાડો થાય, ક્યાંક ફેરફાર થાય, ક્યાંક બંધ થાય,  
ક્યાંક કંઈક શરૂ થાય, ક્યાંક ગૌણપણું થાય, ક્યાંક મુખ્યપણું થાય,  
ક્યાંક નભાવાય, ક્યાંક ન નભાવાય-આ બધું જ્યણા કહેવાય. આ  
કોણ કરી શકે ? જે કંજુસ ન હોય, જે ઉડાઉ ન હોય, જે લાલચુ ન  
હોય, જે આળસુ ન હોય, જે સમજુ હોય, જે પરિસ્થિતિને જાણો તે.  
સૂક્ષ્મબુદ્ધિ વધે તેમ જ્યણા વધે, કાળજી વધે તેમ જ્યણા વધે,  
શાનપરિણાતિ વધે તેમ જ્યણા વધે, આવડત-અનુભવ-ગરજ વધે  
તેમ જ્યણા વધે.

શાસ્ત્રોમાં ગીતાર્થને જ સર્વ કાર્યમાં મહત્ત્વ આપી છે તેનું  
કારણ તે સર્વ રીતે જ્યણા જાણી શકે છે, જ્યણા પળાવી શકે છે.  
માટે ગીતાર્થના વચનને અનુસરનાર જ્યણાને અનુસરે છે, ગીતાર્થ  
વચનને નહિં અનુસરનાર જ્યણાને અનુસરતો નથી.

શાસ્ત્રોમાં સંધ્ય તરીકે ગીતાર્થોના સમુહને મુખ્યતયા ગણોલ  
છે, કારણ કે એ અવસરોચિત ગૌણ-મુખ્યભાવ વગેરેને જાણો છે.  
અથી એમને વ્યક્તિગત કે ભેગા થઇને સમજીગત સામાચારી-  
આચારોમાં કામચલાઉ કે કાયમી ફેરફાર કરવાની યોગ્યતા અપાઈ  
છે, અને તે સર્વમાન્ય ઠરે છે.

ધર્મનું પ્રધાનતત્ત્વ વ્યવહારમાં જ્યણા છે, અનું પ્રેરક તત્ત્વ  
જ્ઞાન છે, જ્યણાનો વ્યવહારવિષય આચાર-ક્રિયા છે.

જેમ ચાલવાના વિષયમાં સામાન્યથી 'ચરે સંદમણુંદ્વિગ્રહો' ની

વાતથી ઉતાવળા ન ચાલે, અતિ ધીમા પણ ન ચાલે એ વાત હોવા છતાં અતિવૃદ્ધ, અતિબિમાર સાથે ચાલવું પડે તો અતિમંદ ચાલે, એમ પોતાની તેવી બિમારીમાં પણ અતિમંદ ચાલે. અતિ મહત્વના કાર્ય માટે કે અતિ ઉતાવળી પરિસ્થિતિમાં અતિ ઉતાવળે કે દોડીને પણ જવું પડે તો જાય. આ બધું ચાલવામાં જ્યષ્ઠા કહેવાય. તેવી રીતે જરૂર પડે તો ઉભો રહે અને જરૂર પડે જવાનું કાર્ય ગોણા કરીને રોકાછ જાય. આ પણ ગમન છિયાના કાર્યને ફેરવનારી જ્યષ્ઠા છે.

મોટા માણસ જોડે વાત કરતા વાતની પદ્ધતિ જુદી, સરળ માણસ સાથે જુદી, પંડિત અભિમાની સાથે જુદી, માયાવી સાથે જુદી, બાળક જોડે જુદી. આ બધી વાત પદ્ધતિઓ સામા પાત્ર અને પરિસ્થિતિને લક્ષમાં લઈને કરવાની હોય છે તેથી પરિસ્થિતિ વગેરેને લક્ષમાં લઈ કરવાનું હોય તે નિષિદ્ધ હોવા છતાં ઉપાદેય બને છે, તેને પણ જ્યષ્ઠા કહેવાય. જેમ બઘ્યભઙ્ગસૂરિ છોકરાઓ સાથે રમતા હતા અને પંડિતો પુછવા આવ્યા ત્યારે ઉપાશ્રયમાં જવાનો મુખ્ય રસ્તો એમને બતાવી પોતે અવાંતર રસ્તે આવી કામળી ઓઢીને સૂછ ગયા. પંડિતોએ કુકડો બોલાવ્યો તો એમણે બિલાડીનો અવાજ કર્યો. આવો અવાજ કરવાનું શાસ્ત્રનિષિદ્ધ છતાં પરિસ્થિતિવશ કરવું પડે તે જાણીને કાળજીથી કરે તો જ્યષ્ઠા કહેવાય, પણ ગાવાની, જુદા જુદા અવાજ કરવાની ટેવ જ પડી જાય તે જ્યષ્ઠા ન કહેવાય.

ક્યારેક ધીમે અતિધીમે ખાવું, ક્યારેક ઉતાવળે અતિ ઉતાવળે ખાવું, ક્યારેક અડધું ખાવાનું છોડી દેવું આ બધું સંયોગવશ જે કરવું પડે તે જ્યષ્ઠા કહેવાય.

જીવદ્યાને જ્યષ્ઠા કહેવાય. બોલવામાં બીજાને નુકસાન ન થાય તેની કાળજી રાખે તેને જ્યષ્ઠા કહેવાય. શિકારીને શિકાર ન

બતાવવા ક્યારેક આડાઅવળા કે ખોટા ઉત્તર આપવા પડે તે પણ જ્યણા કહેવાય. સામાન્યથી પૂજા માટે ગૃહસ્થ સ્નાન કરે તો સ્નાન એ જ્યણા છે. તેવી રીતે ક્યારેક પરિસ્થિતિવશ બીજી વાર પૂજા કરવાની હોય તો સ્નાન કરે તે પણ જ્યણા છે.

આ રીતે જ્યાં જ્યણા આવે ત્યાં તે તે રીતે કર્તવ્ય સમજવું.

કોઈક કામ છોડવામાં, ગૌણ કરવામાં પણ કર્તવ્ય હોય છે. અતિશક્તિશાળી, શાસનના વિશેષ ઉપયોગી શિષ્યને બીજી ભક્તિ કે ગોચરી જવાનું ગૌણ કરાવી અભ્યાસ-અનુભવથી તૈયાર કરવા માટે જે ભિક્ષાચર્ચા વગેરે આચારો બીજા દ્વારા પતાવી તેની તેના માટે ગૌણતા કરવી તે પણ જ્યણા છે. સામાન્ય રાજમાર્ગના-ઉત્સર્ગ માર્ગના ચાલુ વ્યવહારો, આચારો વ્યક્તિ કે ચુપને કે સંઘને અપેક્ષિને દ્રવ્યાદિ વિષમ પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને જ્ઞાનાદિ રલત્રયની વૃદ્ધિ માટે જે છોડાય, ફેરફાર કરાય તે જ્યણા કહેવાય.

આજે ઉપાશ્રયો સાધુ માટે પણ બને છે, જ્યારે ગૃહસ્થના ફ્લેટો નિર્દ્દાષ હોય છે, પરંતુ તે ફ્લેટો વિજ્ઞતીય આદિથી સંસક્ત હોય. માટે આવા કારણો ગૃહસ્થોના ફ્લેટમાં ન રહેતા દોષિત-સાધુ માટે બનેલા ઉપાશ્રયમાં રહેવું પડે કે રહેવું જોઈએ તે જ્યણા છે.

પૂજાના અભિગ્રહવાળાને ગુમડું થાય, રસી નિકળે, પાકે ત્યારે પૂજા ન થઇ શકે. તે વખતે દ્રવ્યપૂજા ગૌણ કરી રોજની જેમ દહેરાસરમાં એક-દોઢ કલાક જાપ, સ્તોત્રપાઠ વગેરે કરે તો તે પૂજાના અભિગ્રહમાં જ્યણા કહેવાય. એ રીતે સર્જન કે ડાંકટરે ના પાડી હોય ત્યારે પણ પૂજાના બદલે આ રીતે પરમાત્માભક્તિ કરે તે જ્યણા કહેવાય.

જરૂરી અવસ્થામાં ફેરફાર કરી આપવું પડે તેમ પ્રમાદી,

આળસુ, વક શિખાદિને થોડું સહન કરાવીને, બીજુ વાતો ગૌણા કરાવીને પણ મૂળ વાત પકડી રખાવવી તે પણ જયણા છે.

જે ઘરેડ પ્રમાણો ચાલે, ગૌણા-મુખ્યપણું ન કરે, ન માને તે જયણા વિનાનો કહેવાય. દશમના એકાશનના દિવસે સવારે ભૂલી જાય, નવકારશી કરી લે અને દશ વાગે દશમ અને એકાશન યાદ આવે તો તે દિવસે ખાવાનું છોડવું અને બીજા દિવસે એકાસન કરી આપવું. આમ કરવાથી વધારે મક્કમતા આવે છે, સાપેક્ષતા વધે છે. તે દિવસે વારંવાર ખાવાથી અને આગળ દશમ કરવાથી મક્કમતા વધતી નથી. તે દિવસે ન ખાવું, બીજા જ દિવસે એકાશન કરવું તે વ્રતની ભૂલમાં મજબુતાઈનો ઉપાય છે. આને પણ યતના કહેવાય. સાંજે પાણી પીતા હોય તે વખતે કોઇ કહે કે સૂર્યાસ્ત થછ ગયો છે અને ખુદને પણ લાગે કે કદાચ વાત બરાબર હશે તો બાકીનું પાણી પીવાનું છોડી દેવું તે યતના કહેવાય. જે પાણી વાપરી જાય તો રાત્રિભોજન થાય. છોડી દે તો મન મક્કમ બનવાથી વ્રતમાં દઠ બને છે. શાસ્ત્રોમાં અતીત પચ્ચક્રખાણ અનાગત પચ્ચક્રખાણ જે બતાવ્યા છે તે મૂળ તિથિના પચ્ચક્રખાણની યતનારૂપ છે. એ રીતે આગારો પણ યતનારૂપ છે.

સામુહિક કાર્ય વખતે બ્યક્ઝિનગત કાર્ય ગૌણા કરવું પડે કે ફેરવવું પડે તે ન ફેરવે તો ન ચાલે. ફેરવે તે જયણા છે.

જયણા એટલે પ્રયત્ન વિશેષ, કળથી કામ લેવું તે. જેમ કબાટ ખોલવા એક ચાવી ન લાગે તો બીજી ચાવી લગાવવી, ન ખુલે તો તેલ નાખવું, પણ બળ ન કરવું, ગુસ્સો ન કરવો, ચાવી જોર કરી તોડી ન નાખવી. કારણા વિચારી કાર્ય થાય તેવા રસ્તા લેવા અને થોડા ફેરફાર સાથે પણ વિશેષ લાભહાયી કાર્ય કરી લેવું તે જયણા.

ઠલ્લા-માત્રાની તકલીફવાળાને ૪૮ મિનિટનું સામાયિક ન થાય તો અભિગ્રહ કરાય કે ઠલ્લા માત્રા સિવાય ૪૮ મિનિટ સામાયિકની જેમ રહેવું. આ પણ ન છૂટકે સામાયિકના ભાવ ટકાવનાર ઉપાય છે.

જ્યષ્ઠા એટલે કિયામાં પ્રવર્તતો શાનયોગ છે. ઉપયોગની જેમ જરૂર છે તેમ તે તે સંયોગ-પરિસ્થિતિ અનુસાર વર્તવાની પણ જરૂર છે અને તે શાનયોગથી થાય છે.

જ્યાં આત્માની, મોક્ષની, નિર્જરાની મુખ્યતા છે તે શાનયોગ છે અને તેના અનુસારે જે પ્રયત્ન, કિયા થાય તે જ્યષ્ઠા છે અને તે મોક્ષનું કારણ છે.



## “પર્યાપ્તિ વિચાર”

પર્યાપ્તિ નામકર્મ જીવવિપાકી પ્રકૃતિ છે. જે પ્રકૃતિ યદ્વિપાકી હોય તેમાં (જીવ કે પુદ્ગલમાં) તેનું મુખ્ય કાર્ય થવું જોઈએ, અન્યત્ર જે કાર્ય થાય તે મુખ્ય કાર્યની વાયા થઇ શકે. પર્યાપ્તિ શબ્દ સામર્થ્ય વાચક છે. પર્યાપ્તિનામકર્મથી જીવના વીર્યાન્તરાય ક્ષયોપશમના બળથી ઓદારિક / વેક્ટિય / આહારક શરીરના પુદ્ગલમાં શક્તિ ઉત્પત્ત થાય છે એટલે કે જીવ શક્તિ ઉત્પત્ત કરે છે. તે શક્તિથી જીવ કાર્ય કરે છે.

જીવની શક્તિ હોવા છતાં જીવને પુદ્ગલ દ્વારા પુદ્ગલમાં પ્રવર્તવાનું છે તેથી જીવ શરીર દ્વારા પ્રવર્ત છે. તેથી જીવ દ્વારા શરીરમાં આ શક્તિઓનું નિર્માણ થાય છે અને તે પુદ્ગલ શક્તિરૂપ પર્યાપ્તિ છે.

જીવ પર્યાપ્ત થવાનો હોય તો ભવના પ્રથમ સમયથી પર્યાપ્ત નામકર્મનો ઉદ્ય હોય છે. અને તે ભવના અંત સમય સુધી હોય છે. જીવ અપર્યાપ્ત રહેવાનો હોય તો ભવના પ્રથમ સમયથી અપર્યાપ્ત નામકર્મનો ઉદ્ય હોય છે અને તે ભવના અંતસમય સુધી હોય છે. આથી વિગ્રહગતિથી જ પર્યાપ્તજીવને પર્યાપ્ત નામકર્મનો ઉદ્ય હોય છે.

તેથી અંશતઃ આહારગ્રહણાદિ કરવાની શક્તિ (સામર્થ્ય)

ત્યાં પ્રાપ્ત છે. ઉત્પત્તિ થયેલા જીવને આહાર વગર શરીર બનવાનું નથી અને આહાર ગ્રહણ કરવાનું સામર્થ્ય જ જો ન હોય તો આહાર લે કેવી રીતે ? એટલે ઉત્પત્તિના પ્રથમ સમયે જ આહાર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય છે અર્થાત્ આહાર ગ્રહણ કરવાનું આપેક્ષિક સામર્થ્ય આહારપર્યાપ્તિનામકર્મના ઉદ્યના પ્રતાપે પ્રાપ્ત થઈ જાય છે. આમ તો જીવમાં અનંત શક્તિઓ (સામર્થ્ય) હ્યાત જ હોય છે. ફક્ત નિષ્ઠિ હોય છે. પર્યાપ્તિ નામકર્મ ઉદ્યના બળે તે જાગૃત થઈ જાય છે. આહાર પર્યાપ્તિરૂપ સામર્થ્ય તો પ્રથમ ઉત્પત્તિ ક્ષણે જ આપેક્ષિક રીતે પરિપૂર્ણ જાગૃત થઈ જાય છે. બાકીની પર્યાપ્તિઓ જાગ્રત થવામાં અંતર્મુદ્દૂર્ત સમય લાગી જાય છે. એમાં પણ પર્યાપ્ત જીવને સ્વપ્રાયોગ્ય બધી જ જાગૃત થાય અને અપર્યાપ્ત જીવને ત્રણથી વધુ પૂર્ણપણે જાગૃત ન થાય. (જાગૃતિની શરૂઆત તો પહેલા સમયથી જ થઈ જતી હોય છે પરંતુ ત્રણથી વધુની પૂર્ણ જાગૃતિ અપર્યાપ્તને નથી થતી).

(૧) આહાર પર્યાપ્તિ :- જીવ તૈજસ-કાર્મણા શરીર વડે ઉત્પત્તિ સ્થાને આવીને પ્રથમ સમયે ઓજાહાર ગ્રહણ કરે છે. બીજા સમયથી તૈજસ-કાર્મણા શરીર અને ઔદારિક મિશ્ર શરીર વડે અંતર્મુદ્દૂર્ત સુધી ઓજાહાર ગ્રહણ કરે છે. અને અંતર્મુદ્દૂર્ત બાદ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઔદારિક શરીરથી લોમ અને કવળ આહાર થાય છે. અહીં પ્રથમ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થાય છે એટલે આહાર પર્યાપ્તિનું કાર્ય વ્યક્ત થાય છે. આ આહારગ્રહણ અને પરિણામન કાર્ય ભવના અંત સુધી રહે છે. આ આહારપર્યાપ્તિનું કાર્ય છે.

શરીર બનાવવા માટે જીવનું તૈજસ-કાર્મણા શરીર ગ્રહણ કરેલ પુદ્ગલરૂપ આહારમાં જોડાય છે, સંયુક્ત થાય છે તેને આહાર


ગ્રહણ કર્યા કહેવાય છે. આ કાર્ય મરણ સુધી ચાલે છે. તૈજસ અને કાર્મણ શરીરના પણ બળથી થાય છે.

(૨) શરીર પર્યાપ્તિ :- જીવ સાથે સંબંધિત થયેલા આહારમાંથી જીવની શક્તિથી રસરૂપે પરિણામ પામેલા પુદ્ગલ શરીરરૂપ બને (વધારાના પુદ્ગલ છોડી દે). બનેલા શરીરમાં જે અમુક શક્તિ ઉત્પત્ત થાય છે તેના દ્વારા શરીર કામ કરે છે (જીવ શરીર દ્વારા કામ કરે છે). અમુક હદની શક્તિનો સંચય થાય ત્યારે પર્યાપ્તિ પૂર્ણ થઈ કહેવાય. પરંતુ જેમ આહાર પ્રતિક્ષણ ચાલુ છે તેમ તેના દ્વારા શરીરનું સર્જન / વર્ધન / રક્ષણ / પોખરણ પણ મરણ સુધી ચાલુ છે તેથી મરણ સુધી શરીર પર્યાપ્તિ કામ કરતી રહે છે અને એનું કાર્ય પણ થાય છે.

(૩) ઇન્દ્રિય પર્યાપ્તિ :- શરીરના જ પુદ્ગલોમાંથી જીવ અમુક સારા પુદ્ગલોને બાખ્ય ઇન્દ્રિય / અભ્યંતર ઇન્દ્રિય વગેરે રૂપે બનાવે છે તેમાં જે વસ્તુને અનુભવવાની વિશિષ્ટ શક્તિવાળા પુદ્ગલો છે તે ઘણા અલ્ય છે તેને જ=તેની શક્તિના નિર્માણને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. આની સાથે આત્મપ્રદેશો સંબંધિત જ હોય છે.

આત્માના બધા જ પ્રદેશોમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ હોવા છતાં આજ પુદ્ગલોમાં તે તે ઇન્દ્રિયના વિષયગ્રહણની શક્તિ નિર્માણ થાય છે. તે અમુક હદ સુધીની થાય તેને પર્યાપ્તિ પૂર્ણ થઈ તેમ કહેવાય. પછી તે શક્તિ આહાર અને શરીરના પોખરણ દ્વારા પોતાની ઇન્દ્રિયનું પોખરણ મરણ સુધી થયા કરે છે. એટલે પર્યાપ્તિનું કામ ચાલુ જ રહે છે.

(૪) શાસોચ્છ્વાસ પર્યાપ્તિ :- શાસોચ્છ્વાસ પર્યાપ્તિનામકર્મ એ જીવમાં શાસોશાસ લેવાનું બળ એટલે કે શાસોચ્છ્વાસ પર્યાપ્તિને



જાગ્રત કરે છે. જીવને લાંબો કાળ જીવવું હોય તો શાસોચ્છ્વાસ લેવાની જરૂર પડે જ. શાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી તો જીવ જેમ તેમ કરીને અંતર્મુહૂર્ત કાળ ખેંચી નાખે છે પણ પછી વધુ જીવવા માટે શાસોચ્છ્વાસ અનિવાર્ય બની જાય છે. જે જીવ આ પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે એ અંતર્મુહૂર્તથી વધારે જીવી પણ નહીં શકે તેથી એ અપર્યાપ્ત કહેવાય.

હવે આ શાસોચ્છ્વાસ સ્થાવર-ત્રસ બધાય પર્યાપ્ત જીવોમાં હોય છે. પ્રાણવાયુને ગ્રહણ કરવો એને જો શાસોચ્છ્વાસ કહીએ તો વાયુકાયમાં નહીં ઘટી શકે. વળી પંચેન્દ્રિય સિવાયના જીવોને નાક પણ હોતું નથી. હંડા વિ.માં પણ શસન કિયા હોય છે એમ આધુનિક વિજ્ઞાન માને છે. એટલે નાક વગર પણ શરીરના છિદ્રોથી બાબ્ય પ્રાણવાયુના (ઓક્સિજન) ગ્રહણાત્મક શાસોચ્છ્વાસ હંડા વિ.માં હોય છે પણ અપ્કાય વગેરેમાં એ પણ ઘટી શકે નહીં.

શાસ્ત્રકારોએ શાસોચ્છ્વાસ વર્ગણા અલગ ગણાવી છે. (સ્થૂલ પ્રાણવાયુ એ તો ઔદારિક વર્ગણા છે) શાસોચ્છ્વાસ પર્યાપ્તિ આ. શાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવાની શક્તિરૂપ છે. એના દ્વારા ગૃહિત શાસોચ્છ્વાસ વર્ગણા પુદ્ગલ આહારની જેમ જ જીવવાની કિયામાં પ્રયંડ ઉપષ્ટમ્ભક બની રહે છે. એટલે તળાવ વગેરેના પાણીમાં અડધો કલાક બાબ્ય શાસોશાસ વગર પણ માણસ જીવી શકે છે અથવા પ્રાણાયામ કરતા કરતા શાસોશાસને અડધો એક કલાક સુધી થંભાવી દે છતાં પણ જીવતા રહે છે તે આ શાસોચ્છ્વાસપર્યાપ્તિ દ્વારા ગૃહિત થયેલા શાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલના ઉપષ્ટમ્ભકના પ્રતાપે એ વાત જુદી છે. કેટલાક પ્રાણીઓ

બાબુ શાસોચ્છ્વાસ વગર દીર્ઘકાળ જીવી શકતા નથી. નાકથી કે વગર નાકે બાબુ પ્રાણવાયુ ગ્રહણ કર્યામાં ફેફસા વગેરે અનેક કારણો હોઈ શકે છે. જેમાં શાસોચ્છ્વાસ પર્યાપ્તિ ગૃહીત શાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલો એ મહત્વનું અંતરંગ કારણ હોઈ શકે છે.


(૫) ભાષા પર્યાપ્તિ :- એજ રીતે ભાષાશક્તિ પણ સૂક્ષ્મ રીતે સર્વ શરીરમાં અમુક પ્રકારના પુદ્ગલોમાં ઉત્પત્ત થાય છે તેના બણથી જીવ બોલી શકે છે. સ્થૂલથી કંઠ, તાલુ વગેરે સ્થાનોના પુદ્ગલોમાં આ શક્તિ ઉત્પત્ત થાય છે. આ શક્તિ પણ જીવે ગ્રહણ કરેલા શરીરના જ પુદ્ગલોમાં ઉત્પત્ત થાય છે.

(૬) મન : પર્યાપ્તિ :- એજ રીતે મન : શક્તિ પણ સર્વ શરીરમાં જ્ઞાનતંતુમાં ઉત્પત્ત થાય છે. સ્થૂલ દૃષ્ટિએ તે અમુક ભાગમાં હોય. વાસ્તવમાં બધે ઓછે વત્તે અંશે હોય માટે મન : પર્યાપ્તિ પણ નિર્માણથી માંડીને મરણ સુધી આહારથી પોખાતી રહે છે. આ રીતે આહાર દ્વારા શરીર અને શરીરની વિશિષ્ટ શક્તિઓ (ઇન્દ્રિયથી મન સુધીની) જીવની શક્તિથી નિર્ભિત થાય છે માટે પર્યાપ્તિ જીવની કહેવાય અને પુદ્ગલમાં શક્તિનું નિર્માણ થાય છે માટે પુદ્ગલની શક્તિને પણ પર્યાપ્તિ કહેવાય છે તેનાથી યુક્ત જીવ તે પર્યાપ્ત કહેવાય.

પર્યાપ્ત જીવ પોતાના પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા અનેક કર્મ બાંધે છે. કર્મબંધનના કારણોમાં જીવના પુરુષાર્થને યોગ નામ આપવામાં આવ્યું છે.

પ્રશ્ન :- યોગ કોને કહેવાય ?

ઉત્તર :- જીવના પ્રવર્તમાનવીર્યને યોગ કહેવાય. ક્ષયોપશમ કે ક્ષાયિક લાભ્યવીર્યને યોગ ન કહેવાય. પુદ્ગલમાં કે પુદ્ગલ દ્વારા જીવના



પ્રવર્તમાનવીર્યને યોગ કહેવાય. આ યોગ વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયપૂર્વક શરીરનામકર્મના ઉદ્યથી પ્રવર્ત છે. શરીરનામકર્મનો ઉદ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી યોગ હોય છે. તેજસ-કાર્મણા બે શરીર અનાદિ છે. બે શરીરનો ઉદ્ય અનાદિ છે. અને ૧૩ મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી છે ત્યાં સુધી યોગ છે. જે શરીરનામકર્મનો ઉદ્ય હોય તે શરીરના પુદ્ગલો જીવ યોગ દ્વારા ગ્રહણ કરે. ઔદારિક / વૈક્રિય / આહારક શરીરના પુદ્ગલને કર્મપ્રકૃતિમાં આહારવર્ગણા કહી છે. તેથી આ પુદ્ગલ ગ્રહણ કરતા કરતા આહારી કહેવાય છે. તેજસ અને કાર્મણાથી જીવ આહાર કરે છે તેમ ઉત્પત્તિના પ્રથમ સમયે કહેવાય છે તેમાં કાર્મણાશરીર બે પ્રકારનું છે. સર્વકર્મરૂપ અને એના એકદેશ શરીરનામકર્મરૂપ. તેમાં પણ ઔદારિક શરીરનામકર્મના ઉદ્યથી તેજસશરીર-કાર્મણાશરીરના ઉદ્યરૂપ યોગથી જીવ ઔદારિક પુદ્ગલ ગ્રહણ કરે છે. પ્રથમ સમયે જીવ કાર્મણાયોગથી આહાર કરે છે એવો એક મત છે. બીજો મત ઔદારિક ભિશ્રયોગથી આહાર કરે છે એવો છે. યોગ પુદ્ગલના આધાર ઉપર છે. પુદ્ગલનો આધાર ઔદારિક / વૈક્રિય / આહારક શરીર ઉપર મુખ્ય છે માટે વિગ્રહગતિમાં કાર્મણાયોગ હોવાથી અલ્ય છે.

પર્યાપ્તિ ઔદારિક / વૈક્રિય / આહારક શરીરમાં થાય છે માટે વિગ્રહગતિમાં એ પુદ્ગલો ગ્રહણ કરવાના નથી તેથી પર્યાપ્તિ શરૂ થતી નથી માટે પર્યાપ્તિ આહાર પુદ્ગલમાં ઉત્પત્ત થયેલ શક્તિ વિશેષરૂપ છે. માટે જીવ આહારના નિયમન-વિશોધન દ્વારા પર્યાપ્તિ-જન્ય શક્તિઓને વધારે છે અને વિપરીત કરવાથી ઘટાડે છે તેથી પુદ્ગલ દ્વારા મનની શક્તિની પણ વધઘટ થાય છે. વાચિકશક્તિમાં પણ વધઘટ થાય છે. શાસ કિયામાં પણ મજબૂતાઈ-વિક્ષેપ આવે.

ઇન્દ્રિયોની શક્તિ પણ વધે-ઘટે. શારીરિક શક્તિમાં અને ખોરાક ગ્રહણ તથા પરિણામન શક્તિમાં પણ વધઘટ થાય. આ બધી શક્તિઓ જેમ આહાર આધીન છે તેમ આહાર પરિણામને આધીન છે. વ્યાયામ / પ્રસન્નતા / કાળ / ક્ષેત્ર વગેરે દ્વારા આ પરિણામન શક્તિમાં ફેરફાર વધ-ઘટ થાય છે. પર્યાપ્તિનું મૂળ કારણ જીવનો પર્યાપ્તિ નામકર્મનો ઉદ્ય છે. જીવનો પુદ્ધગલમાં (આહાર) ઉચ્ચિત વ્યાપાર, શરીર વગેરે શક્તિનિર્માણકારણ અને ઉપષ્ટંભક કારણ છે જ્યારે અનુચ્ચિત વ્યાપાર એ નાશક કારણ છે, હ્રાસ કરનાર કારણ છે એ રીતે શરીર, ઇન્દ્રિય, મન ઉપર અસર કરનાર ગરમી / શરદી / શ્રમ / ચિંતા / પ્રસન્નતા વગેરે ઘણા બાધ્ય-અભ્યંતર કારણો પણ છે, જે પર્યાપ્તિ જન્ય શક્તિઓમાં વધઘટ કરે છે અને સંપૂર્ણ નાશ પણ કરે છે.



# સમતા ધરો ભવજલ તરો

આપણો ત્યાં શાસ્ત્રમાં સામાયિકનો કમ બતાવો (૧) શુત સામાયિક (૨) સભ્યકૃત્વ સામાયિક (૩) દેશવિરતિ અને (૪) સર્વવિરતિ.

આમાં શુતસામાયિક વગાર પાછળના ગ્રષા ન હોય. એનો અર્થ આપણી વિચારણામાં શુત=સાંભળેલા જ્ઞાનના બળથી સમતા રહે તો આરાધના. વિચારણામાંથી સમતા ગઈ તો બધું ગયું. આહારાદિ સંજ્ઞા-વિષય-કખાય-વિપરીત પરિસ્થિતિ સામે આપણી વિચારણા ડામાડોળ થાય તો શુત સામાયિક જાય અને તે જતા પાછળના બધા જ સામાયિક જાય. ડ્રાઇવર ઉત્તરી જતા ગાડી આગળ ચાલી શકતી નથી, એંજિનમાં ખોડ આવતા પાછળના ઉભા કાંઈ કામના નથી હોતા.

વિચારમાં સંકલેશ-ડામાડોળતા તે શુતસામાયિકને નષ્ટ કરવા સાથે બાકીના ગ્રષોયનો નાશ કરે છે. ગુરુભગવંતે મહાત્માઓની સેવા કરનાર બાહુ-સુબાહુ મુનિની જ્યારે પ્રશંસા- ઉપબૂધ્ણા કરી ત્યારે પીઠ-મહાપીઠ મુનિથી સહન ન થયું અને વિચારમાં ડામાડોળતા આવી, સમતા ગઈ કે ગુરુ તો “કરે તેનું ગાય”. આ વિચારે ઠેઠ ભિથાત્વે ઉતારી દીધા, સ્ત્રીવેદ આઘ્યો.

**પ્રશ્ન :-** આ શુત સામાયિકને પકડવા-ટકાવવા શું કરવું જોઈએ ?

**ઉત્તર :-** શુત સામાયિકને ટકાવવા પ્રથમ આચારાધ્યયન અને બીજું ભાવાધ્યયન જોઈએ. જેમાંથી સંવેગ-નિર્વદ ઉત્પત્ત થાય તેવા શ્લોકો આત્માને શુતસામાયિક આપે છે. દા.ત. શાંતસુધારસ-અધ્યાત્મકલ્યદ્રુમ જેવા ગ્રંથો જ્યારે જ્યારે પાઠ પરાવર્તન કરીએ ત્યારે સમતા પ્રાપ્ત થાય. માત્ર શબ્દ બોલવાથી કામ ન ચાલે. મનમાં તેના અર્થનો ઉપયોગ પણ રાખવાનો.

તેથી જ અધ્યયનમાં વૈરાગ્યને ઉત્પત્ત કરનારા ગ્રંથોનું ભણતર પહેલા કરવાનું કહ્યું, જેથી ગમે તેવી પરિસ્થિતિમાં સંકલેશ ન આવે. ભાવ વધતો રહે. સમતાનું કારણ વૈરાગ્ય છે તેથી જેને સમતા જોઈતી હોય તેણે વૈરાગ્યને મજબૂત બનાવવો અને વૈરાગ્ય લાવવા તેને લગતા ગ્રંથોનું વાંચન મનન અવશ્ય કરવું.

જેની વાતમાં-વાણીમાં-વર્તનમાં વૈરાગ્ય ન દેખાય તેવાને ભાવધર્મ આવે નહીં, આવેલો ટકે નહીં.

આગાંતુક વિચારથી આવેલી સમતા તે શુતસામાયિક અને તે ટકી રહે તો અભ્યાસ દ્વારા કાલાંતરે સભ્યકૃત્વ સામાયિક આવે. પથરાળ જમીન પર પાણી વહે તો પથરો ઠંડો-ભીનો થાય પરંતુ તે થોડા સમય પૂરતો તેમ જ્યાં સુધી શુતની વિચારણા ત્યાં સુધી શુતસામાયિકવાળો આત્મા સમતાવાળો રહે. પણ જમીને જે પાણી ચૂસું તે વધુ સમય રહે. પાણી દ્વારા જમીનમાં ચીકાશ ઉભી કરે તેમ વારંવારના અભ્યાસ દ્વારા ફદ્યમાં જે ભીનાશ-ચીકાશ ઉભી થાય તે લાંબો સમય રહે. આ સમતાને સભ્યકૃત્વસામાયિક કહેવાય.

ધમધોકાર વરસાદમાં માત્ર ઉપરના ક્ષાર ધોવાય, અંદરના નહીં અને ધીમે ધીમે પડે તો માટીના અંદરના ક્ષારોનો પણ નાશ કરે

તેમ આગંતુક સમતા આગંતુક લાભ કરે અને સ્થાયી સમતા સભ્યકૃત સામાયિક ચિરકાલીન લાભ કરે.

જાડના મૂળીયા કેટલે જોડે સુધી ? પાણી છેક નીચે સુધી હોય તેવું નહીં પણ તે મૂળીયા જમીનમાંથી, વાતાવરણમાંથી પાણી મેળવી લે છે તેમ સભ્યકૃત સામાયિકવાળાને કાયમ માટે બધી જ વાતોમાં વૈરાગ્ય મળતો રહે કારણ કે તેની આંતરિક પરિણાતિ સભ્યકૃતવના બળથી છે.

દેવ-ગુરુ-ધર્મની ભક્તિવાળા આત્માને વૈરાગ્ય ન હોય તો એ ભક્તિ ઔપચારિક સમજવી આત્મામાં જેમ વૈરાગ્ય વધે તેમ સાંયોગિક પરિસ્થિતિમાં આત્મા ઉપરછલ્લો ભાવ રાખે.

આચારની જોડે જ્ઞાન ભળે તો વૈરાગ્ય મજબૂત બને તેથી કુલકો ગોખવા, પાઠ કરવા અને જીવનમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા. બાબુ આચારોની જેમ મનને પણ સુધારવા વૈરાગ્યવાસિત બનાવવા દફ થવું. વૈરાગ્યની દફતા સભ્યકૃતવને દફ બનાવે છે.



પૂજયપાદ ગણ્ણાધિપતિ આચાર્યદેવ  
શ્રીમદ્વિજ્યજ્યઘોષસૂરીશ્વરજી મહારાજનો

## સાહિત્ય પૈભવ

૧. ભાવનાનું ઉઘાન (બીજુ આવૃત્તિ)	૧૩.૦૦
૨. ચલો શાંતિ કે ઉપવન મેં (હિંદી)	૧૦.૦૦
૩. ચિત્ત સાંદર્થ (બીજુ આવૃત્તિ)	૮.૦૦
૪. દર્શન સુધા (બીજુ આવૃત્તિ)	૨૮.૦૦
૫. કર્મકલંક દૂર નિવારો	૧૧.૦૦
૬. પંચસૂત્ર સ્વાધ્યાય	૧૦.૦૦
૭. ચિંતન ચંદ્રવો (બીજુ આવૃત્તિ)	૧૬.૦૦
૮. વહે મીઠી વાણી (ત્રીજુ આવૃત્તિ)	૧૬.૦૦
૯. હીરો એક પાસા અનેક	૩૦.૦૦
૧૦. ગુરુવંદન પચ્ચક્ખાડા ભાષ્યના રહણ્યો (બીજુ આવૃત્તિ)	૨૫.૦૦
૧૧. એક ઉદ્યન મુક્તિ ભણી (બીજુ આવૃત્તિ)	૧૬.૦૦
૧૨. પાને પાને વસંત	૨૦.૦૦
૧૩. અમૃતવાણી લો પીછાણી	૧૬.૦૦
૧૪. સાધનાંથી સિદ્ધિ ભણી	૨૫.૦૦
૧૫. શ્રાવક જન તો તેને કહીએ	૧૨.૦૦
૧૬. વાચના વહેણા	૨૫.૦૦
૧૭. આગમ દરિયો રત્ને ભરિયો	૪૦.૦૦
૧૮. ગીતાર્થની વાણી અનુભવની ખાડી	૧૬.૦૦
૧૯. ચિંતનયાત્રાથી ચેતન યાત્રા	૩૦.૦૦
૨૦. ભીના હૈયાનો લીલો વૈભવ	૨૮.૦૦
૨૧. સફર : માનવથી મહામાનવની	૩૦.૦૦